

# માહિતીનો અધિકાર

[www.humanrightsinitiative.org](http://www.humanrightsinitiative.org)

## અધિનિયમ ૨૦૦૫

### જા ઉપયોગ હેતુ

## માર્ગદર્શિકા

કોમનવેલ્થ છુમન રાઈટ્સ ઇનિશિએટિવ

કોમનવેલ્થ દેશોમાં માનવ અધિકારોને વ્યાવહારિક સ્વરૂપ આપવા કાર્યરત



# કોમનવેલ્થ હુમન રાઇટ્સ ઇનિશિએટિવ

કોમનવેલ્થહુમન રાઇટ્સ ઇનિશિએટિવ (સીએચઆરઆઈ) એક સ્વતંત્ર, આંતરાષ્ટ્રીય, બિન-સરકારી સંગઠન છે જેને રાષ્ટ્રમંડળના દેશોમાં વ્યાપક સ્વતંત્ર, આંતરાષ્ટ્રીય, માનવ અધિકાર્ય સુનિશ્ચિત કરવાનું કામ સૌંપાયું છે. ઇ.સ. ૧૯૮૭માં અજેક રાષ્ટ્રમંડળ સંઘોએ સીએચઆરઆઈની સ્થાપના કરી, કારણ કે તેમનું માનવ હું કે સર્વાંગીની સર્વસામાન્ય મૂલ્યો અને વૈજ્ઞાનિક સિક્ષાંતોના આધારો કામ કરે અને એવું મંચ પણ ઉપલબ્ધ કરાવે, જેનાથી માનવ અધિકારોને પ્રોત્સાહિત કરી શકાય. પરંતુ રાષ્ટ્રમંડળમાં માનવ અધિકારના મુખ્યાઓ ઉપર મોટાભાગે દ્વારા કેન્દ્રિત કરવામાં આપતું નથી.

સીએચઆરઆઈના હેતુમાં હરારે સિક્ષાંતો, માનવ અધિકારોની સાર્વજનિક ધોખણા અને આંતરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત અન્ય માનવ અધિકાર પ્રાપ્ત તંત્ર તથા રાષ્ટ્રમંડળ સંય દેશોમાં માનવ અધિકારોનું સમર્થન કરવાવાળા રાષ્ટ્રીય કાયદાઓ વિશે જાગૃતિ ઊભી કરવી અને તેના ઉપર અમલ કરવાનું સામેલ છે.

તેના વાર્ષિક અહેવાલ (અપોએટ) તેમજ સમયાંતરે થથી શોધના માદ્યમથી સીએચઆરઆઈ વિભિન્ન રાષ્ટ્રમંડળ દેશોમાં માનવ અધિકારોની પ્રગતિ અને તેના હનન વિશે સતત દ્વારા આકર્ષે છે. માનવ અધિકારોના હનનને રોકવા સંબંધી દાખિલોણ અને આ દિશામાં ઉપાયોનું સમર્થન કરીને સીએચઆરઆઈ રાષ્ટ્રમંડળ સચિવાલય, સર્વાંગીની સરકારો અને સામાજિક સંગઠનોને સચેત કરે છે. કાર્યશાળાઓનું આયોજન અને સંપર્ક વિકસાવીને સીએચઆરઆઈ નિરંતર પ્રેરક સંગઠનની ભૂમિકા ભજ્યે છે જે તેમના પ્રાથમિક મુદ્દાઓ પ્રત્યે અન્ય લોકોને સંક્ષેપ બનાવી શકે.

સીએચઆરઆઈને સહયોગ આપતાં જુથોના\* કારણે એક સ્થાનિક અને આંતરાષ્ટ્રીય નેટવર્ક ઉપલબ્ધ થયું છે. પોતાના કાર્યમાં માનવ અધિકારોને સામેલ કરી, માનવ અધિકારો સંબંધી માહિતી અને પદ્ધતિઓનું પ્રસાર કરીને, તેના સભ્યો વ્યક્તિગત રીતે અને તેમના સંગઠનમાં સામુહિક રીતે વ્યવસ્થિત પરિવર્તન લાવવામાં સક્ષમ બને છે. આ સિવાય, આ સમૂહ સ્થાનિક પરિસ્થિતિઓની જાણકારી આપે છે, નીતિ-નિર્માણ કરનારાઓથી સંપર્ક કરે છે. મુદ્દાને સંક્ષેપ કરે છે અને એક જૂથ થઈને માનવ અધિકારોને પ્રોત્સાહિત કરે છે.

સીએચઆરઆઈની મુખ્ય ઓફિસ દિલ્હીમાં છે અને તેની અન્ય ઓફિસ લંડન(ચુ.કે.) અને આશા, ઘાનામાં છે.

**કાર્યપાદક સમિતિ :** બી.જી. વગીસ-અદ્યક્ષ, માચા દાઢવાલા-નિર્દેશક, સભ્યો-અનુ આગા, બી.કે.ચંદ્રશેખર, ભગવાનદાસ, નીતિન દેસાઈ, કે.એસ.ધિલ્લોન, હરિવંશ, સંજોય હજારિકા, પુનમ મૂત્રેજા, આર.વી. પિલાઈ, પ્રો. મૂલચંદ શર્મા

**દ્રસ્ટી સમિતિ :** નિહાલ જ્યાપિક્ઝમા- અદ્યક્ષ, સભ્યો : મીનાક્ષી ધર, ઑસ્ટ્રેલિયાની ડેપાર્ટમેન્ટ કેપિસ, ડેરેક ઇંગ્રામ, નેપિલ કિંટન, કોલિન નિકોલસ, લિંડસે રોસ, પીટર સિલન, એલિજાબેથ સ્મિથ.

\* કોમનવેલ્થજનિલિસ્ટ એસોસીએશન, કોમનવેલ્થ લોયર્સ એસોસીએશન, કોમનવેલ્થલીગલ એજચ્યુકેશન એસોસીએશન, કોમનવેલ્થ પાલમેન્ટરી એસોસીએશન, કોમનવેલ્થ પ્રેસ ચુનિયન અને કોમનવેલ્થ બ્રોડકાસ્ટિંગ એસોસીએશન

ડિજાઇન અને લેએઆઉટ - પ્રકાશ ઓડા (સીએચઆરઆઈ)

ચિત્રો - સુરેશકુમાર, મુક્રણ-મેટ્રીક્સ ન્યુ દિલ્હી.

ISBN : 81-88205-43-5

કોપીરાઇટ ©સી.એચ.આર.આઈ. નવી દિલ્હી, ડિસેમ્બર ૨૦૦૬

પુસ્તકની સામગ્રીનો ઉપયોગ કરી શકાય પરંતુ સામગ્રીના ક્રોતનો ઉત્સેખ જરૂર કરવો.



## કોમનવેલ્થ હુમન રાઇટ્સ ઇનિશિએટિવ

સીએચઆરઆઈ મુખ્ય ઓફિસ :

બી-૧૧૭, પહેલા મારે,

સર્વોદય અન્ડ્સેપ,

નવી દિલ્હી-૧૧૦૦૧૭, ભારત

ફોન : +91-11-2685-0523, 2686-4678

ફેક્સ : +91-11-2686-4688

ઈ-મેઈલ : chriall@nda.vsnl.net.in

સીએચઆરઆઈ લંડન ઓફિસ :

C/o ઇસ્ટીટ્યુટ ઓફ કોમનવેલ્થ સ્ટડીઝ

૨૮, સેલ સ્કેલેચર્સ

લંડન WC 1B 5DS, UK

ફોન : +44-020-7-862-8857

ફેક્સ : +91-11-2686-4688

ઈ-મેઈલ : chri@sas.ac.uk

સીએચઆરઆઈ ઓફિસ :

મકાન નં.૬ સામોરા મિશ્નેલ માર્ગ

બેવરલી હિલ્સ હોટલ સામે,

દૂર્ઘટ ટાવર્સ નજીબ, અસાયલમ ડાઉન,

ફોન : +233-21-683068, 69, 70

ફેક્સ : +233-21-683062

ઈ-મેઈલ : CHRafrical@yahoo.com

# માહિતીનો અધિકાર અધિનિયમ ૨૦૦૫નો ઉપયોગ કરવા હેતુ માર્ગદર્શિકા

લેખક (મૂળ અંગ્રેજી સંસ્કરણ)  
મંદાકિની દેવાશેર

અનુવાદ  
સોનલ છક્કર  
નવાજ કોટવાલ

સંપાદક  
શાર્મેન રોડ્રિગ્સ

ચોગદાન તેમજ સંપાદન  
વેંકટેશ નાયક

કોમનવેલ્થ છુમન રાઇટ્સ ઇનિશિએટિવ

૨૦૦૬

ઉપયોગકર્તાની માર્ગદર્શિકા અને તેના સંબંધિત સંશોધન અને  
પ્રસાર ખ્રિટીશ હાઇ કમિશન, ન્યૂ ડિલ્હીની નાણાકીય સહાયથી  
શક્ય બની શકી છે.

## અનુકમણિકા

<b>પરિચय .....</b>	૧
ભાગ-૧ : ‘માહિતીનો અધિકાર’ શું છે ? .....	૩
ભાગ-૨ : માહિતીનો અધિકાર મને કેવી રીતે મદદરૂપ થઈ શકે ? .....	૪
ભાગ-૩ : હું કોની પાસેથી માહિતી મેળવી શકું ? .....	૫
કઈ સંસ્થાઓનો સમાવેશ થયો છે ? .....	૭
માહિતી ઘરાવનાર સંસ્થામાં હું કોનો સંપર્ક કરી શકું ? .....	૭
ભાગ-૪ : કઈ માહિતી હું મેળવી શકું ? .....	૯
કઈ માહિતી ઉપલબ્ધ છે ? .....	૯
શું એવી કોઈ માહિતી છે કે જે નહીં મળે ? .....	૧૦
ભાગ-૫ : કઈ માહિતી સ્થેચિક રીતે પ્રકાશિત કરવી જરૂરી છે ? .....	૧૨
એવી માહિતી જે ભાગીદારી અને ટેખેરેખને પ્રોત્સાહિત કરે છે .....	૧૩
એવી માહિતી જે જવાબદાર નિર્ણય પ્રક્રિયાને પ્રોત્સાહિત કરે છે .....	૧૪
ભાગ-૬ : હું માહિતી માટે અરજી કેવી રીતે કરું ? .....	૧૫
પગઠું-૧: માહિતી ઘરાવનાર જાહેર સત્તામંડળને ઓળખો .....	૧૫
પગઠું-૨: જાહેર સત્તામંડળમાં એ અધિકારીને ઓળખો જેને માહિતી માટેની અરજી આપવાની છે. ....	૧૫
પગઠું-૩: સ્પષ્ટ અરજી લખો .....	૧૬
પગઠું-૪: તમારી અરજી રજૂ કરો .....	૧૭
પગઠું-૫: નિર્ણય માટે રાહ જુઓ .....	૧૮
ભાગ-૭ : મારી અરજી ઉપર નિર્ણય કેવી રીતે લેવાય છે ? .....	૨૦
જો જાહેર માહિતી અધિકારી મારી અરજી મંજૂર કરે તો ? .....	૨૧
જો જાહેર માહિતી અધિકારી મારી અરજીનો અસ્વીકાર કરે તો શું કરવાનું ? .....	૨૨
ક્લો ચાર્ટ-૧: અરજી પ્રક્રિયા .....	૨૪
ભાગ-૮ : જો મને માંગેલ માહિતી ન મળે તો શું કરશું ? .....	૨૫
વિકલ્પ ૧ - અપીલ કરો .....	૨૬
પ્રથમ અપીલ, અપીલીય અધિકારીને .....	૨૭
બીજી અપીલ, માહિતી આયોગને .....	૨૮
વિકલ્પ ૨ - ફરિયાદ કરો .....	૩૨
વિકલ્પ ૩ - આદાલતમાં અપીલ કરો .....	૩૪
ક્લો ચાર્ટ-૨: અપીલ પ્રક્રિયા .....	૩૫
ભાગ-૯ : માહિતીના અધિકારને આગળ વધારવા હું કેવી રીતે મદદરૂપ થઈ શકું ? .....	૩૬
<b>પરિશિષ્ટ</b>	
પરિશિષ્ટ ૧ : માહિતીનો અધિકાર અધિનિયમ ૨૦૦૫ .....	૪૧
પરિશિષ્ટ ૨ : ફી-નિયમ-સરખામણી કોઠા .....	૪૬
પરિશિષ્ટ ૩ : અપીલના નિયમો .....	૪૮
પરિશિષ્ટ ૪ : માહિતી આયોગ-સંપર્ક વિગત .....	૪૯
પરિશિષ્ટ ૫ : સંશાધન અને સંપર્ક -સૂત્ર .....	૫૨

# માહિતીનો અધિકાર સત્તા ફરી લોકોને અપાવી !

ગુજરાતમાં બાળકોને મફત શિક્ષણ ઉપલબ્ધ કરાવ્યું<sup>૧</sup>

ગુજરાતના પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલી ખાનગી ટ્રસ્ટની શાળામાં બાળકો ભણવા જતાં હતાં. શાળા ગુજરાત સરકાર પાસેથી ફંડ લેતી હોવા છતાં શિક્ષકો બાળકો પાસેથી અનેક પ્રકારની ફી ભરવા દબાએ કરતા હતા, ખરેખર તો તેમણે કોઈ ફી લેવાની હોતી જ નથી. કાલોલ તાલુકાના રહેવાસી અસલમભાઈએ માહિતી અધિકાર અધિનિયમનો ઉપયોગ કરી શાળાના આચાર્ય પાસેથી સરકારી પરિપત્ર કે આટેશની નકલ મંગી, જેમાં ફી લેવાની પરવાનગી આપી હોય. માહિતીના અધિકારની અરજીના આધારે આચાર્ય લેખિતમાં જણાવ્યું કે- શાળાને કોઈપણ પ્રકારની ફી લેવાની સત્તા નથી સિવાય કે શાળાએ પોતાના ખર્ચે શરૂ કરેલ કોમ્પ્યુટર કલાસની ફી. આજે આ શાળાના બાળકો ખુશ છે કારણ કે તેમના શિક્ષકો હવે તેમની પાસેથી કોઈપણ પ્રકારની માગતા નથી.

પશ્ચિમ બંગાળમાં ધારાસભ્યએ સરકારી નાણાંથી કરેલ જંગી ખર્ચને ખુલ્લો પાડયો<sup>૨</sup>

શ્રી તથાગત રોય જે ભારતીય જનતા પાર્ટીના રાજ્ય પ્રમુખ છે, તેમણે માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરી જેમાં તેમણે ધારાસભ્યોની વિદેશશાત્રા માટે પશ્ચિમ બંગાળ સરકાર કેટલું ખર્ચ કરે છે, તેની માહિતી મંગી. તેમની અરજીના જવાબમાં જાણવા મળ્યું કે, વિદેશશાત્રાઓ માટે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જંગી રકમ ફાળવામાં આવે છે. ઉદાહરણ તરીકે, રાજ્ય સરકાર દ્વારા મુખ્ય મંત્રીની વિદેશશાત્રા માટે વર્ષ ૧૯૮૭-૧૯૯૦ દરમ્યાન રૂ. ૧૮,૩૫,૫૦૦ અને વર્ષ ૧૯૯૧-૧૯૯૫ દરમ્યાન રૂ. ૪,૫૦,૭૨૨ ખર્ચવામાં આવ્યા. ચુંટાયેલા પ્રતિનિધિઓ, જે રીતે લોકોનાં નાણાં ખર્ચે છે, તેમાં તેમને જવાબદાર બનાવવા માહિતીનો અધિકાર અસરકારક માદ્યમ છે.

માહિતીના અધિકાર અધિનિયમથી કારની નોંધણીમાં થયેલ ગોટાળાનો પર્દફિશાશ<sup>૩</sup>

કેપ્ટન એ.એન.ચોપરા (નિવૃત્ત) - જે વિમા તપાસ અધિકારી છે તેમણે માહિતીના અધિકારનો ઉપયોગ કરીને નોંધણી અને લાયસન્સ વિભાગના અધિકારીઓ દ્વારા વિમા અને જૂની કારની લે-વેચમાં ચાલી રહેલ ગોટાળા વિશુદ્ધ પુરાવા એકઠા કર્યા. શ્રી ચોપરા પાસે એક કાર અકસ્માતનો દાવો આવ્યો ત્યારથી તપાસની શરૂઆત થઈ. તપાસમાં શ્રી ચોપરાને જાણવા મળ્યું કે દાવો કરનાર નટવરે તેની જૂની કારના પુરાવા રજૂ કર્યા હતા તે મૂળ કારની નોંધણી સાથે મેળ ખાતા નહોતા. માહિતીના અધિકારનો ઉપયોગ કરીને, શ્રી ચોપરાએ કેસની પૂરી ફાઈલ માટે નોંધણી અને લાયસન્સ વિભાગને અરજી કરી. વાહનની નોંધણીના રેકર્ડમાં જોવા મળ્યું કે-વાહનની નોંધણીમાં વાહન ઉત્પાદનની સાલ ૧૯૮૯ના બદલે ૧૯૯૦ કરી દીધી હતી, આ રીતે કાર વેચનારે અને નોંધણી તેમજ લાયસન્સ વિભાગના અધિકારીઓએ નટવર પાસેથી રૂ.૫૦,૦૦૦ વધારે લઈ તેમનાં બિસ્સા ભર્યો.

૧. વેંકેશ નાથક (૨૦૦૯) ‘બાળકોને મફત શિક્ષણ ઉપલબ્ધ કરાવ્યું’સીએચઆરઆઈ અપ્રકાશિત.

૨. રટાફ પત્રકાર (૨૦૦૯) ‘જ્યોતિ બાસુની ૧૪ વિદેશ ચાત્રાઓનો રાજ્યને ખર્ચ માત્ર રૂ. ૧૮ લાખ’ દ્વારા રટાફ પત્રકાર અનુયુઆરી

૩. રોહિત મલિક (૨૦૦૫) “ઇશ્યોરન્સ મેન ગેટ્સ ઈન ટૂ એકટ, એક્સપોર્ઝ રૈકેટ” ઇન્ડિયન એક્સપ્રેસ -ચંદીગઢ ન્યૂજ લાઇન ૧૨ ડિસેમ્બર : <http://cities.expressindia.com/fullstory.php?newsid=160082> ૨૦ માર્ચ ૨૦૦૯

## પરિચय

શાસનમાં લોકભાગીદારી એ કોઈપણ લોકશાહીનું હાઈ છે. નાગરિક તરીકે, માત્ર ચૂંટણી સમયે જ ભાગીદાર ન બનતાં, રોજ-બ-રોજ-જ્યારે નીતિઓમાં નિર્ણય લેવા, કાયદાઓ અને યોજનાઓ બનાવવામાં તેમજ પ્રોજેક્ટ કે પ્રવૃત્તિઓના અમલીકરણમાં પણ ભાગીદાર બનવાની જરૂર પડે છે. લોકોની ભાગીદારીશી શાસનની ગુણવત્તા વિસ્તરે છે, સાથે-સાથે તે સરકારી કાર્યોમાં પારદર્શકતા અને જવાબદારી લાવવામાં પણ મદદરૂપ થાય છે. પરંતુ વાસ્તવમાં લોકો કેવી રીતે શાસનમાં ભાગ લઈ શકે ? કેવી રીતે લોકો જાણી શકે નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો ? સામાન્ય જનતા કેવી રીતે જાણે કે કરનાં નાણાં કેવી રીતે ખર્ચ થયાં કે યોજનાનો બરાબર રીતે અમલ થઈ રહ્યો છે કે નિર્ણય લેતી વખતે સરકાર પ્રમાણિક રહી છે કે નહિ ? સરકારી અધિકારીઓને જાહેર કામો કરવા કેવી રીતે જવાબદાર બનાવી શકીએ ?

ભાગીદાર થવાનો એક રસ્તો છે કે લોકો એવા વિભાગો પાસેથી માહિતી મેળવવા માટે તેમના માહિતીના અધિકારનો ઉપયોગ કરે જે જાહેર નાણાંથી ચાલતી હોય અને જાહેર સેવા આપતી હોય. મે ૨૦૦૫ થી અમલમાં આવેલ માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ ૨૦૦૫થી, ભારતના બધા નાગરિકોને માહિતી માંગવાનો અધિકાર છે. માહિતીનો અધિકાર અધિનિયમ સ્વીકારે છે કે ભારત જેવી લોકશાહીમાં સરકાર પાસે છે તેવી બધી માહિતી અંતે તો લોકો માટે છે. નાગરિકોને માહિતી ઉપલબ્ધ કરાવવી એ સામાન્ય સરકારી કામનો જ ભાગ છે. કારણ કે લોકોને એ જાણવાનો અધિકાર છે કે જાહેર અધિકારીઓ તેમના નામે અને તેમના નાણાનું શું કરે છે.

માહિતીનો અધિકાર અધિનિયમ સ્વીકારે છે કે સરકાર ઝ્રારા નાગરિકોની સાથે માહિતીની આપ-લે લોકશાહીની કાર્યપ્રણાલી માટે સ્વસ્થ અને લાભદારી છે. માહિતીનો અધિકાર અધિનિયમ હેઠળ ગોપનીયતા ભૂતકાળની બાબત બની જવી જોઈએ. હવેથી કોઈપણ નાગરિકોને એવી માહિતી આપવાની મનાઈ નહીં કરી શકાય જે વિધાનસભાના સત્ય અને સંસદસત્ય સરકાર પાસેથી મેળવી શકે. આ નવા અધિનિયમમાં માત્ર કેન્દ્રનાં જ જાહેર સત્તામંડળો નહીં પરંતુ રાજ્યો<sup>૪</sup> અને સ્થાનિક સ્વ-શાસન સંસ્થાઓનો પણ સમાવેશ થયો છે. તેનો અર્થ છે કે હવે તમે આખા ભારતના દરેક ગામ, જિલ્લા, શહેર અને નગરના જાહેર વિભાગો પાસે ઉપલબ્ધ હોય તેવી માહિતી માંગી શકો છો.

આજની તારીખે પણ ગોપનીયતા એ ભારતમાં બધી જ સરકારી સંસ્થાઓનું લક્ષણ રહ્યું છે. પરંતુ માહિતીના અધિકાર અધિનિયમ સાથે હવે બદલાવ શરૂ થયો છે. સરકારી ગુપ્ત બાબત અધિનિયમ ૧૮૨૩ જ્યાં માહિતી જાહેર કરવાને સજાપાત્ર અપરાધ ગણવામાં આવતું, ત્યાં માહિતીનો અધિકાર અધિનિયમ હવે સરકારમાં ખુલ્લાપણાને જરૂરી ગણે છે. સરકાર પાસે મોજુદ માહિતી લોકોને માર્ગે જ આપવામાં આપતી, અને તે પણ સરકારી અધિકારીની મરજી પર નિર્ભર કરતું, પરંતુ હવે માહિતીનો અધિકાર અધિનિયમ બધા નાગરિકોના

<sup>૪</sup> જમ્મુ અને કાશ્મીર તેના ખાસ બંધારણીય દરજાના કારણે તેમાંથી અપવાદ છે. જમ્મુ અને કાશ્મીરમાં તેમનો પોતાનો રાજ્યનો માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૪ છે, જે રાષ્ટ્રના માહિતીના સ્વાતંત્ર્ય અધિનિયમ ૨૦૦૨ પર આધારિત છે. જમ્મુ અને કાશ્મીરના લોકો રાજ્યને લગતી માહિતી માટે રાજ્યના કાયદાનો ઉપયોગ કરી શકે છે, તે સિવાય કેન્દ્ર સરકારના જાહેર વિભાગોમાંથી માહિતી મેળવવા માહિતીના અધિકાર અધિનિયમ ૨૦૦૫નો ઉપયોગ કરી શકે છે.

જીવનને અસર કરતા શાસન અને વિકાસને લગતા મુદ્દાઓમાં પૂશ્ય પૂછ્યવાનો અને જવાબ માંગવાનો અધિકાર આપે છે. આ અધિનિયમ અધિકારીઓનાં બ્રષ્ટ કાર્યોને જીપાવવા વધારે મુશ્કેલ બનાવે છે. માહિતી સુધીની પહોંચ ભારતના રાજનૈતિક, આર્થિક અને સામાજિક વિકાસ યોગદાનમાં મદદરૂપ બની શકશે.

## માહિતીના અધિકાર માટેની ચળવળ

અસરકારક માહિતીના અધિકારનો કાચદો કેન્દ્રમાં લાવવા છેવાડાની સંસ્થાઓ અને નાગરિક જૂથો ૧૯૮૦થી ચળવળ કરી રહ્યાં હતાં. છેક ૨૦૦૨માં કેન્દ્ર સરકારે આગળ પગલું લઈ, માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ ૨૦૦૨ પસાર કર્યો. કમન્સીબે, આ અધિનિયમ કચારેચ અમલમાં ન આવ્યો અને લોકો આ નવા અધિનિયમ હેઠળ કચારેચ તેમના અધિકારનો ઉપયોગ ન કરી શક્યા. ૨૦૦૪માં, નવી ચૂંટાગેલ યુપીએ સરકારે, માહિતીના અધિકારને વધારે “વિકાસલક્ષી, ભાગીદારલક્ષી અને અર્થપૂર્ણ” બનાવવાનું વચન આપ્યું. યુપીએ સરકારના વચનો પરિપૂર્ણ થયાં છે કે નહીં તેની દેખરેખ રાખવા રાષ્ટ્રીય સલાહકાર સમિતિની રચના કરવામાં આવી જેમાં રાષ્ટ્રીય માહિતીનો અધિકાર જનઅભિયાન ચળવળના (NCPRI) મુખ્ય સમર્થકોને સામેલ કરવામાં આવ્યા.

રાષ્ટ્રીય માહિતીનો અધિકાર જનઅભિયાન, સીએચઆરઆઈ અને અન્ય નાગરિક સમાજ જૂથોની ઉપસ્થિતિ સાથે રાષ્ટ્રીય સલાહકાર સમિતિએ માહિતીના સ્વાતંત્ર્ય અધિનિયમમાં ઉમેરો કરવા સરકારને કેટલીક ભલામણો રજૂ કરી. રાષ્ટ્રીય સલાહકાર સમિતિની ભલામણોને ગંભીરતાથી સ્વીકારી, સરકારે માહિતીના અધિકારને લગતો ખરડો ૨૦૦૪માં સંસદમાં રજૂ કર્યો. ખરડો અંતે લોકસભામાં ૧૧ મે ૨૦૦૫ અને રાજ્યસભામાં ૧૨ મે ૨૦૦૫ ના સફળ રીતે પસાર થયો. માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ ને ૧૫ જૂન ૨૦૦૫ના રાષ્ટ્રપતિની સંમતિ મળી. સમગ્રે દેશના નાગરિકોને માહિતી સુધીની પહોંચ માટે જરૂરી કેટલીક જોગવાઈઓનો તાત્કાલિક અમલ શરૂ થયો. માહિતીના અધિકાર અધિનિયમનો સમગ્ર અમલ ૧૨ ઓક્ટોબર ૨૦૦૫થી શરૂ થયો.

માહિતીના અધિકાર અધિનિયમનો અમલ યોગ્ય રીતે થાય અને સરકારને વધારે જવાબદાર બનાવવાનો તેનો ઉદ્દેશ પૂરો થઈ રહ્યો છે કે નહીં તે જોવાનો એક ચોક્કસ રસ્તો છે કે આપણે બધા વધારેને વધારે તેનો ઉપયોગ કરીએ - અને આ ઉપયોગ જવાબદારીથી અને અસરકારક રીતે કરીએ. આ ઉદ્દેશને દચાનમાં રાખી સીએચઆરઆઈ એ આ માર્ગદર્શિકા તૈયાર કરી છે. આ માર્ગદર્શિકાનો હેતુ આ મુજબની સમજ માટે છે :

- (એ) અધિનિયમમાં કોનો સમાવેશ થયો છે;
- (બી) અધિનિયમ હેઠળ કેવા પ્રકારની માહિતી મેળવી શકાય છે;
- (સી) માહિતી કેવી રીતે મેળવી શકાય છે ;
- (ડી) લોકોને તેમની જરૂરી માહિતી પૂરી પાડવામાં ન આવે તો તેમની પાસે શું વિકલ્પ છે ; અને
- (ઇ) અધિનિયમના અસરકારક અમલથી સરકારને વધારે જવાબદાર અને અસરકારક બનાવવા લોકો કેવી રીતે જોડાઈ શકે.

## ભાગ-૧ : “માહિતીનો અધિકાર” શું છે?

માહિતીનો અધિકાર એક મૂળભૂત માનવ અધિકાર છે જે વિવિધ અધિકારો અને જવાબદારીઓ મળીને બન્યો છે, જેવા કે :

- \* દરેક વ્યક્તિને સરકાર તેમજ અમુક કેસોમાં ખાનગી સંસ્થાઓ પાસેથી માહિતીની વિનંતી કરવાનો અધિકાર;
- \* વિનંતી કરેલ માહિતી પૂરી પાડવાની સરકારની ફરજ; સિવાય કે જણાવેલ અપવાદો લાગુ પડતા હોય; અને
- \* સામાન્ય લોકહિતને લગતી માહિતી નાગરિકો દ્વારા વિનંતીની જરૂર વગર સ્વૈરિષ્ટ જાહેર કરવાની સરકારની ફરજ.

ભારતના બંધારણમાં માહિતીના અધિકારનો ખાસ અલગથી ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ ઘણા સમયથી દેશની સર્વોચ્ચ અદાલતે તેને લોકશાહીની કાર્યપ્રણાલી માટે મૂળભૂત અધિકાર ગણાવ્યો છે. ખાસ કરીને, સર્વોચ્ચ અદાલતે માહિતીના અધિકારને બંધારણની અનુચ્છેદ ૧૮(૧) (દ') દ્વારા બાંહેદરી મેળવેલ વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને અનુચ્છેદ ૨૧ દ્વારા બાંહેદરી મેળવેલ જીવન જીવવાના અધિકારના એક જરૂરી ભાગ સ્વરૂપમાં માન્યતા આપી છે.<sup>૫</sup>

માહિતી સુધીની પહોંચનો અધિકાર એ હકીકત તરફ દ્યાન દોરે છે કે સરકારી માહિતી લોકોની છે નાઈ કે જે સરકારી વિભાગ એને રાખે છે તેની. માહિતી કોઈ પણ સરકારી વિભાગ કે તત્કાલિન સરકારની ‘માલિકી’ની નથી. તેના બદલે, માહિતી લોકોના રૂપિયાથી સરકારી અધિકારી દ્વારા બની છે, જેમનું વેતન લોક ફંડમાંથી આપવામાં આવે છે અને તે લોકોના માટે તૈયાર કરવામાં આવી છે.

માહિતીનો અધિકાર અમર્યાદિત નથી. લોકહિતને નુકસાન પહોંચી શકે તેવી અમુક માહિતી ગુપ્ત રાખી શકાય છે. ઉદાહરણ તરીકે, ચુદ્ધ દરમ્યાન સેનાની ગોઠવણાને લગતી માહિતી અથવા રાષ્ટ્રીય આર્થિક નીતિ અંગેની સલાહ તેના પ્રકાશન પહેલાં જણાવવી નાઈ, એવી બાબતો જેમાં અધિકારીઓ પાસે અમુક સમય સુધી માહિતી જાહેર ન કરવા માટે પૂરતું કારણ હોય. તે સિવાય, મુખ્ય સવાલ એક જ રહેશે કે : માહિતીને જાહેર કરવી લોકહિતમાં છે કે ગુપ્ત રાખવી ?

<sup>૫</sup> બેનેટ કોંગ્રેસ એન્ડ કંપની વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા એઆઇઆર ૧૯૭૩ એસ સી ૭૮૩, જસ્ટિસ કે કે મેધ્યનો ચચ્ચિપદ નિર્ણય; ઉત્તરપ્રેણ રાજ્ય વિરુદ્ધ રાજ નારાયણ, એઆઇઆર ૧૯૭૫ એસસી ૮૫૪; એસ.પી. ગુપ્તા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા, એઆઇઆર ૧૯૮૨ એસ.સી. ૧૪૮; ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝ પેપર્સ (બોમ્બે) પ્રાઇવેટ લિ. વિરુદ્ધ ઇન્ડિયા (૧૯૮૫) ૧ એસસીસી ૯૪૧; ડી. કે. બાસુ વિરુદ્ધ પાશ્ચિમ બંગાળ રાજ્ય (૧૯૮૭) ૧ એસસીસી ૨૧૬; રિલાયન્સ પેટ્રોક્મીકલ્સ લિ. વિ. ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝ પેપર્સ (બોમ્બે) પ્રા. લિ. ના માલિક, એઆઇઆર ૧૯૮૮ એસસી ૧૦૦.

## ભાગ-૨ : માહિતીનો અધિકાર મને કેવી રીતે મદદરૂપ થઈ શકે?

ભારતના નાગરિક તરીકે સરકાર તરફથી તમને મળતી સેવાઓ, અધિકારો અને લાભો ચોગ્ય રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવા તમે માહિતીના અધિકાર અધિનિયમનો ઉપયોગ કરી શકો છો. જો કે, માહિતીનો અધિકાર અધિનિયમ પોતે કોઈ ઉકેલ નથી; પરંતુ તે ઉકેલ તરફનું પ્રથમ પગથિયું છે. ઉદાહરણ તરીકે, માહિતીનો અધિકાર અધિનિયમના ઉપયોગથી કદાચ વીજળી કે પાણીનું નંતું કનેક્શન ન મળી શકે, પરંતુ તેનાથી તમારી અરજી ઉપર પગલાં લેવા માટે કોણ જવાબદાર છે, કામમાં શું પ્રગતિ થઈ રહી છે, વિભાગે નક્કી કરેલ નિયમો મુજબ તમને ક્યારે કનેક્શન મળશે તેમજ તમારા કેસમાં શા માટે વિલંબ થયો છે તે તમે જાણી શકો છો.

### લોક સુનાવણી જાહેર કાર્યોમાં પારદર્શકતા લાવે છે<sup>૯</sup>

૨૦૦૨માં, દિલ્હી સ્થિત એક સ્ટેચિક સંસ્થા પરિવર્તને, દિલ્હી માહિતીનો અધિકાર અધિનિયમ ૨૦૦૧નો ઉપયોગ કરીને પૂર્વ દિલ્હીની બે કોલોનીના પુનઃવસવાટ માટે આપેલ જાહેર કામોના કોન્ટ્રાક્ટની નકલ મેળવી, જેના ઉપયોગથી તેમણે ક્રમ જાહેર કાર્યોમાં સામાજિક તપાસણી (સોશિયલ ઓડિટ) કરી જેનાથી ચોકાવનારા પરિણામો આવ્યાં. સામાજિક તપાસણીમાં જબરદસ્ત બષ્ટાચાર બહાર આવ્યો. મોટાભાગનાં જાહેર કામો વાસ્તવિક રીતે થયાં જ નહીંતાં, માત્ર કાગળ ઉપર જ હતાં. જેમ કે-૧૦ કોન્ટ્રાક્ટમાં, ઇલેક્ટ્રીક મોટર સાથે ૨૮ હેન્ડપંપ જોડવાના હતા, પરંતુ તે વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા મુજબ માત્ર ૧૪ હેન્ડપંપ જોડવામાં આવ્યા હતા. શેરી ગટરમાં અનુસૂચિત કરાયેલી ૨૫૩ લોંખની જાળીઓ, જેના માટે ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું હતું, તેમાંથી વાસ્તવમાં માત્ર ૩૦ જાળીઓ જ લગાવવામાં આવી હતી. ૧.૩ કરોડના ક્રમ જાહેર કાર્યોની પરિવર્તને કરેલી તપાસમાં જાણવા મળ્યું કે ૭૦ લાખ રૂપિયાનો હિસાબ મળતો નથી.

આ માહિતી સાથે, પરિવર્તન સંસ્થાએ મુખ્ય પ્રધાન, મુખ્ય સચિવ, દિલ્હી વહીવટી સુધાર સચિવ અને દિલ્હી મહાનગરપાલિકાના કમિશનરને મળી અપરાધીઓને સજા આપવાની મંગ કરી. મે ૨૦૦૪ માં, પરિવર્તને દાખલ કરેલ જાહેર હિતની અરજીમાં, ઉર્ચ અદાલતે દિલ્હી પોલીસને બષ્ટાચારના આરોપોની તપાસ કરવાનો આદેશ આપ્યો. તેના પરિણામે, નગરપાલિકાના સભ્યે સીમાપુરી વિસ્તારમાં ચાલતાં જાહેર કામોમાં સંપૂર્ણ પારદર્શકતા લાવવા પરિવર્તનનો સંપર્ક સાચ્યો. કાર્યપાલક ઇજનેરને કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં અંદાજિત ખર્ચ અને સ્કેચની નકલો અને પૂર્ણ થયાં પછી તેની તપાસ માટે પરવાનગી આપવાનો આદેશ આપવામાં આવ્યો. નગરપાલિકાના સભ્યે લોકો અને પરિવર્તનને છૂટ આપી કે તેઓ કામોમાં થયેલ ભૂલ શોધે તેમજ કછું કે જ્યાં સુધી લોકો દ્વારા ઉઠાવાયેલ વાંદ્યાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ચૂકવણું કરવામાં આવશે નહિ.

<sup>૯</sup> પરિવર્તન (૨૦૦૨) ‘પરિવર્તને કરેલ પહેલી શહેરી લોક સુનાવણી’: <http://www.parivartan.com/jansunwais.asp>  
#Parivartan%20conducts%20Urban%20Jansunwai, ૨૦ માર્ચ ૨૦૦૭

અનેક બનાવોમાં માહિતીના અધિકારે અમટકાર સર્જ્યો છે : મહિનાઓથી વિલંબમાં પડેલાં જોડાણો અઠવાડિયાંથી પણ ઓછા સમયમાં આપવામાં આવ્યાં; ખરાબ રીતે બનાવેલ રોડ ૧૦ દિવસથી પણ ઓછા સમયમાં સરખો કરવામાં આવ્યો; મહિનાઓથી દૂર ન કરવામાં આવતો કચરો દરરોજ સવારે નિયમિત સાફ થવા લાગ્યો. નાગરિકોના સવાળોના જવાબ આપવા પડશે તેવો કાયદાનો ભય અનેક સરકારી અધિકારીઓના મનમાં શરૂ થઈ ગયો છે. માહિતીના અધિકારનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરી અનેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. ઉદાહરણ તરીકે :

- \* રાશનકાર્ડધારક તેમના ભાગનું રાશન તેમને બરાબર મળી રહ્યું છે અને તેમના નામનું અનાજ ગેરવલ્સે તો નથી જતું, તે જેવા, દુકાનદાર કે પુરવઠા વિભાગમાં રાખવામાં આવતા સ્ટોક અને વેચાણ રજિસ્ટરની તપાસ કરી શકે છે;
- \* બાળકનાં માતા-પિતા સરકારી શાળાઓમાં ફાળવવામાં આવેલ ફંડનો ચોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ અથવા શાળામાં પ્રવેશ લાંચ લઈને આપવામાં આવેલ છે કે નહિ તેની તપાસ કરી શકે છે અથવા શિક્ષણ માટે ફાળવવામાં આવેલ ફંડનો ઉપયોગ બીજા કોઈ હેતુ માટે થતો નથી તેની વિગતો આપવાનું કહી શકે છે;
- \* નાના ધંધાદારીઓ, સરકાર દ્વારા લાયસન્સ / કર રાહત અને સબસીડીઓ કયા આધારે આપવામાં આવી છે તેમજ લાભાર્થીઓ કોણ છે તે જાહી શકે છે. તેઓ ચકાસી પણ શકે છે કે સરકારે ચોગ્ય માપદંડ મુજબ લાયસન્સ/રાહતો/સબસીડી આપી છે કે નહિ;
- \* બેરોજગાર લોકો સરકારી નોકરી માટેના માપદંડો અથવા તેમની પાસે આવેલ અરજીની પરિસ્થિતિ અને અત્યારે કયા નંબર સુધી યાદી પહોંચી છે તે વિશે પૂછી શકે છે ;
- \* લોકો સરકારી સેવાનો લાભ લેવા માટેની તેમની અરજીમાં થયેલ પ્રગતિની ચકાસણી કરી શકે છે. જેમાં વીજળી અથવા પાણી માટે આપેલ અરજીની પરિસ્થિતિની ચકાસણી, કયા અધિકારી ફાઇલની કાર્યવાહી કરી રહ્યા છે તેમજ કેટલા સમયમાં અને તેમણે શું પગલાં લીધાં તેનો પણ સમાવેશ થાય છે.

એક સામાજિક વ્યક્તિ તરીકે, તમને લોકહિતના અગત્યના મુદ્દાઓ અંગેની માહિતી જાણવાની અને તે અંગે સરકારે લીધેલ પગલાં જાણવાની જરૂર પડી શકે છે. ઉદાહરણ તરીકે, તમે આ મુજબની માહિતી જાણી શકો:

- \* સરકારી હોસ્પિટલમાં કેટલાં મૃત્યુ કયા કારણસર થયાં અથવા મંજૂર થયેલ સ્ટાફની સરખામણીએ કેટલા ડૉક્ટર અને નર્સની સંખ્યા ખૂટે છે;
- \* સરકારી શાળામાં શિક્ષકોની ઈનિક હાજરી કેટલી છે ;
- \* સ્થાનિક જેલમાં ક્ષમતા કરતા કેટલા વધારે કેદીઓને રાખવામાં આવ્યા છે ;
- \* ઇન્સપેક્ટર કેટલીવાર કારખાના અને ઉત્પાદન ચુનિયોની તપાસ કરવા મુલાકાત લે છે કે તેઓ ગેરકાયદેસર રીતે જોખમકારક સામગ્રી ઠાલવી પર્યાવરણને પ્રદૂષિત નથી કરતા;
- \* નગરપાલિકાના અધિકારીઓએ કેટલા ઠેકેદારને બ્લેકલીસ્ટ કર્યા અને બ્લેકલીસ્ટ થયેલા હોવા છતાં કેટલા ઠેકેદારોને જાહેર કાર્યો કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

## ભાગ-૩ : કોની પાસેથી હું માહિતી મેળવી શકું ?

માહિતીનો અધિકાર અધિનિયમ આખા દેશના બધા રજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં (જમ્મુ-કશ્મીરનો સમાવેશ થતો નથી તેનું કારણ બંધારણની અનુચ્છેદ ૩૭૦ હેઠળ મળેલ વિશિષ્ટ દરજાને) લાગુ પડે છે.<sup>૭</sup> માહિતીના અધિકાર અધિનિયમમાં ચોક્કસ રીતે જણાવવામાં આવ્યું છે કે કચા સરકારી વિભાગો પાસેથી તમે માહિતી મેળવી શકો અને કોની પાસેથી નહિ. તેમાં એ પણ જરૂરી છે કે અધિનિયમમાં જે વિભાગોનો સમાવેશ થયો છે તેમાં તમારી અરજી સ્વીકારવા અને પ્રક્રિયા કરવા એક ખાસ અધિકારીની નિમણૂંક કરવામાં આવે.

### કઈ સંસ્થાઓનો સમાવેશ થયો છે ?

માહિતીનો અધિકાર અધિનિયમ તમને “જાહેર સત્તામંડળ”<sup>૮</sup> પાસે હોય, તેવી માહિતી મેળવવાનો અધિકાર આપે છે. જાહેર સત્તામંડળોમાં જે સંસ્થાઓ સામેલ છે તેમાં :

- સંવિધાન દ્વારા સ્થાપવામાં આવેલ અથવા રચાયેલ;
- સંસદ અથવા રાજ્ય વિધાનસભાના કાયદા દ્વારા સ્થાપવામાં અથવા રચવામાં આવેલ;
- કેન્દ્ર અથવા રાજ્ય સરકારોએ બહાર પાડેલ કોઈ જાહેરનામાં અથવા આદેશ દ્વારા સ્થાપવામાં અથવા રચવામાં આવેલ;
- કેન્દ્ર અથવા રાજ્ય સરકારોની માલિકી, નિયંત્રિત અથવા આંશિક ફંડ મેળવતી સંસ્થાઓ, જેમાં સરકાર દ્વારા આંશિક ફંડ મેળવતી બિન-સરકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

“જાહેર સત્તામંડળ”ની વ્યાખ્યા જાણી જોઈએ વિશાળ રાખવામાં આવી છે, કારણ કે કાયદાના વ્યાપમાં વધારેને વધારે સંસ્થાઓનો સમાવેશ થાય તે જરૂરી છે. પરિણામે દેરેક સ્તરની સરકારી વહિવટી કચેરીઓનો સમાવેશ થયો છે. તેનો અર્થ થયો કે લોકો-બધી જ પંચાયતો-જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, પ્રાંત કચેરીઓ, જિલ્લા કલેકટર / નાયબ કમિશનરની ઓફિસ, બધા સચિવકળાના સરકારી વિભાગો, સશાસ્ત્ર દળો, સરકાર દ્વારા સંચાલિત અથવા નાણાંકિય સહાયથી ચાલતી શાળાઓ, કોલેજો, ચુનિવર્સિટીઓ, હોસ્પિટ્લો, જાહેરક્ષેત્રની બેન્કો અને જાહેર ક્ષેત્રનાં સાહસો પાસેથી માહિતી માંગી શકે છે.

અધિનિયમનું નોંધનીય પાસું છે કે, સરકાર પાસેથી અમુક અંશો ફંડ લેતી બિન-સરકારી સંસ્થાઓનો પણ તેમાં સમાવેશ થયો છે. તેનો અર્થ થયો કે, જે ખાનગી સંસ્થાઓમાં જાહેર નાણા આપવામાં આવ્યા હોય, તેવી સંસ્થાઓ લોક નિરીક્ષણ માટે ખુલ્લી હોવી જોઈએ. વાસ્તવમાં ખાનગી શાળાઓ, કોલેજો, હોસ્પિટ્લો અથવા ચેરિટેબલ સંસ્થાઓ જે મદ્યાહન ભોજન યોજના જેવી સરકારી યોજનાઓનો અમલ કરતી હોય તેમણે માહિતીનો અધિકાર અધિનિયમ હેઠળ માહિતી જાહેર કરવી જરૂરી છે.

<sup>૭</sup> જુઓ આગળની નોંધ જ

<sup>૮</sup> કલમ ૨(અચ), માહિતીનો અધિકાર ૨૦૦૫ (હેચે પછી કલમોનો સંદર્ભ માહિતીનો અધિકાર અધિનિયમ ૨૦૦૫ રહેશે. ક્ષિયાય કે અલગ ઉત્સેખ કરવામાં આવ્યું હોય.)

## કેટલીક સંસ્થાઓનો સમાવેશ થયો નથી<sup>૯૮</sup>

કમનસીબે, કેટલીક સંસ્થાઓ છે જે સંપૂર્ણ રીતે માહિતીના અધિકાર અધિનિયમના દાયરામાં આવતી નથી. અધિનિયમમાં કેન્દ્રની ૧૮ સુરક્ષા અને જાસ્તુસી સંસ્થાઓની યાદી બનાવવામાં આવી છે જેમને માહિતી પૂરી પાડવાની જરૂરત નથી. રાજ્યોને પણ તેમની નિયંત્રિત આવી સંસ્થાઓમાંને દાયરા બહાર રાખવાની સત્તા આપવામાં આવી છે. છતાંચ, અધિનિયમ હેઠળ આ સંસ્થાઓએ ભષ્ટાચાર કે માનવ અધિકારોના ઉત્તલંઘનને લગતી માહિતી પૂરી પાડવી જરૂરી છે. માનવ અધિકારોના ઉત્તલંઘનને લગતી માહિતી અરજી સ્વીકાર્યના રૂપ દિવસની અંદર માત્ર સંબંધિત માહિતી કમિશનરની પરવાનગીથી જ પૂરી પાડવામાં આવશે.

## માહિતી ધરાવનાર સંસ્થામાં હું કોનો સંપર્ક કરી શકું ?

આદર્શ રીતે, કોઈપણ જાહેર સત્તામંડળમાં કામ કરનાર અધિકારીએ તમને અરજી રજૂ કરવામાં મદદ કરવી જોઈએ. જોકે, લોકો માટે એક ચોક્કસ સંપર્ક નક્કી કરવા, માહિતીનો અધિકાર અધિનિયમ જાહેર સત્તામંડળોમાં અરજીઓને હાથ ધરવા બે જુદા પ્રકારના અધિકારીઓની નિમણૂક સૂચયે છે: જાહેર માહિતી અધિકારીઓ અને મદદનીશ જાહેર માહિતી અધિકારીઓ.

- **જાહેર માહિતી અધિકારી :** કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક વિભાગના વહીવટી સ્તરે જાહેર માહિતી અધિકારીઓની નિમણૂક થવી જરૂરી છે. જાહેર માહિતી અધિકારીઓ અરજી સ્વીકારવા અને તેની ઉપર પ્રક્રિયાઓ કરવા માટે જવાબદાર છે.<sup>૧૦</sup> તેમણે અરજી કરવામાં મુશ્કેલી પડતી હોય તેવા અરજદારોને પણ મદદ કરવાની છે. જાહેર માહિતી અધિકારીઓનાં નામ દરેક સરકારી વિભાગોની કચેરીઓમાં દેખાય તે રીતે અને તેમની વેબસાઇટ પર હોવા જોઈએ.
- **મદદનીશ જાહેર માહિતી અધિકારી :** અધિનિયમ હેઠળ જાહેર સત્તામંડળોમાં પ્રાંત અથવા તાલુકા કક્ષાએ મદદનીશ જાહેર માહિતી અધિકારીઓની નિમણૂંક જરૂરી છે, જેમણે ઉચ્ચ સ્તરે નિમાયેલ સંબંધિત જાહેર માહિતી અધિકારીને અરજી મોકલવાની હોય છે. આ વ્યવસ્થા ઉમેરવાનું કારણ છે કે મુખ્ય સરકારી ઓક્સિસ્થી અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને અરજી કરવામાં અને તેની પૂછપરછ કરવામાં ઓછી મુશ્કેલી પડે. મદદનીશ જાહેર માહિતી અધિકારીની ફરજ છે કે તે અરજી સ્વીકાર્યના પાંચ દિવસમાં જાહેર માહિતી અધિકારીને મોકલી આપે. મદદનીશ જાહેર માહિતી અધિકારી તેમને ખરેખર માહિતી પૂરી પાડશે નહિ, કારણ કે તે મુખ્ય જવાબદારી જાહેર માહિતી અધિકારીની છે.<sup>૧૧</sup> તેમ છતાં જો માહિતી સરળતાથી ઉપલબ્ધ હોય, તો તેમણે તમારી અરજીની નોંધ કરી તમને શક્ય તેટલી ઝડપે માહિતી પૂરી પાડવી જોઈએ.

<sup>૯૮</sup> કલમ ૨૪

<sup>૧૦</sup> કલમ ૫ (૧)

<sup>૧૧</sup> કલમ ૫ (૨)

## અરજુ આપવા જાહેર માહિતી અધિકારીએ તમને ઘક્કા ન ખવડાવવા જોઈએ

કેટલાંક સરકારી મંત્રાલયો/વિભાગોમાં, અરજુઓને હાથ ધરવા અને પ્રક્રિયા કરવા અનેક જાહેર માહિતી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. અરજદાર માટે આવી પરિસ્થિતિ ખૂબ મુશ્કેલી બરી બને છે, કારણ કે જાહેર માહિતી અધિકારીઓ તમને એક જગ્યાએ થી બીજી જગ્યાએ, જ્યાં સુધી થોડ્ય જાહેર માહિતી અધિકારી ન મળે ફેરફાર્યા કરે છે. ઉદાહરણ તરીકે, ડિલ્હી ડેવલપમેન્ટ ઓથોરીટીએ (ડીડીએ) ખાસ વિષયો/ન્યાયિક વિસ્તાર મુજબ આશરે ૪૦ જાહેર માહિતી અધિકારીની નિમણૂક કરી છે. પરિણામે, માહિતી જો એક કરતાં વધારે જાહેર માહિતી અધિકારીના કાર્યક્ષેત્રમાં આવતી હોય, તો અરજદારે વધારે અરજુઓ અને ફી ભરવી પડે છે. અધિનિયમ હેઠળ આની પરવાનગી નથી. તાજેતરના એક કેસમાં કેન્દ્ર માહિતી આયોગે નક્કી કર્યું કે આ અભિગમ જોશો છે. તેણે ડીડીએ ને નિર્ણય આપી કર્યું કે, તેમના જાહેર માહિતી અધિકારીએ દરેક અરજુ સ્વીકારવી પડશે, ભલે તે તેમના વિષય/ વિસ્તારમાં ન આવતી હોય.<sup>૧૨</sup> આદર્શ રીતે, જાહેર સત્તા મંડળોઓ અરજુઓ સ્વીકારવા “‘એક બારી’” વિકસાવી શકે છે જ્યાં એક જાહેર માહિતી અધિકારી અરજુ સ્વીકારે, તે પછી ભલે અલગ અલગ જાહેર માહિતી અધિકારીઓ તેના પર પ્રક્રિયાઓ કરે.

કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારને લગતી બાબતો સંબંધિત અરજુ પહોંચાડવા માટે આખા દેશના પોસ્ટ વિભાગમાં મદદનીશ જાહેર માહિતી અધિકારીઓની નિમણૂક કરી છે, જેઓ કેન્દ્ર સરકારની બાબતો સંબંધિત અરજુ સ્વીકારે અને સંબંધિત જુદા જુદા વિભાગોના જાહેર માહિતી અધિકારીઓને મોકલે. પોસ્ટ વિભાગના મદદનીશ જાહેર માહિતી અધિકારીઓની પૂરી યાદી કર્મચારીઓ, જાહેર ફરિયાદ મંત્રાલયની વેબસાઈટ <http://www.rti.gov.in> પર જોઈશકાય છે.

<sup>૧૨</sup> કેન્દ્ર માહિતી પંચ (૨૦૦૯) અપીલ નં.૧૦/૧/૨૦૦૫-સીઆઇડી, ૨૫ ફેબ્રુઆરી : <http://cic.nic.in> ૨૦ માર્ચ ૨૦૦૯

## ભાગ-૪ : કઈ માહિતી હું મેળવી શકું ?

માહિતીનો અધિકાર અધિનિયમ વધારેને વધારે સ્વરૂપમાં માહિતી જાહેર કરવાની હિમાયત કરે છે. વાસ્તવમાં આનો અર્થ થાય છે કે તમે જાહેર સત્તામંડળ પાસે હોય તેવી મોટાભાગની માહિતી મેળવી શકો છો. તેમાં કેટલાક અપવાદો પણ છે જે સંવેદનશીલ માહિતીના રકાણ માટે બનાવ્યા છે જેને જાહેર કરવાથી લોકહિતના બદલે નુકસાન થઈ શકે છે.

### કઈ માહિતી ઉપલબ્ધ છે ?

માહિતીનો અધિકાર અધિનિયમ તમને જાહેર સત્તામંડળ પાસે વિભિન્ન સ્વરૂપમાં ઉપલબ્ધ હોય તેવી માહિતી સુધી પહોંચવાની પરવાનગી આપે છે. ઉદાહરણ તરીકે, તમે અધિનિયમનો ઉપયોગ કરી રેકર્ડ, હસ્તપત્રો, ફાઈલ, ફાઈલ નોટીંગ, માઇક્રોફિલ, માઇક્રોફિશ, ફેક્સ, દસ્તાવેજો, મેમો, ઈ-મેઈલ, અભિપ્રાયો, સલાહ, અખભારી-યાદી, પરિપત્રો, હુકમો, લૉગબુક, કરારો, અહેવાલો, કાગળો, નમૂના, માર્કેટ્સ, કોઈ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં હોય તેવી માહિતી, કોઈ સ્વરૂપમાં હોય તેવી માહિતી મેળવી શકો છો. કોઈ અન્ય કાનૂન હેઠળ એક જાહેર સત્તામંડળ કોઈ ખાનગી સંસ્થા પાસેથી જે માહિતી લઈ શકે છે, તેને તમે તે જાહેર સત્તામંડળ દ્વારા મેળવી શકો છો. <sup>૧૩</sup>

### માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ, તમને :

#### રેકર્ડ અને કાર્યોનું નિરીક્ષણ કરવાનો અધિકાર છે :

વ્યક્તિગત રીતે તમે કોઈપણ કામ, દસ્તાવેજ કે રેકર્ડનું નિરીક્ષણ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે પુલનું બાંધકામ કે હેન્ડપંપ લગાવવાનું કાર્ય નક્કી માપદંડો મુજબ થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરવાનું કરી શકો છો અથવા તમે સરકારી ફાઈલની ચકાસણી કરી શકો છો, જેનાથી તમે તે ફાઈલમાંથી જે નકલો જોઈતી હોય તેટલી નકલો જ માંગી શકો છો. આ રીતે તમે તમારો ખર્ચ પણ ઓછો કરી શકો છો; <sup>૧૪</sup>

#### પ્રમાણિત નકલ મેળવવાનો અધિકાર

તમે પ્રમાણિત નકલો અથવા દસ્તાવેજો કે રેકર્ડનો સારાંશ મેળવી શકો છો અને દસ્તાવેજ અને રેકર્ડમાંથી અમુક નોંધ લેવાનું પણ કરી શકો છો. <sup>૧૫</sup>

#### નમૂના અથવા મૉડલ મેળવવાનો અધિકાર

તમે કોઈ સામગ્રીનો પ્રમાણિત નમૂનો અથવા મૉડલ માંગી શકો છો. ઉદાહરણ તરીકે, તમારા ઘરની નજીક બનતા રોડનો નમૂનો માંગી શકો છો જેથી તમે તપાસી શકો કે તેમાં કરાર મુજબ યોગ્ય સામગ્રી ઉપયોગમાં લેવાય છે કે નહિ. <sup>૧૬</sup>

<sup>૧૩</sup> કલમ ૨ (એક) અને ૨ (૧)

<sup>૧૪</sup> કલમ ૨ (૩) (૧)

<sup>૧૫</sup> કલમ ૨ (૩) (૨)

<sup>૧૬</sup> કલમ ૨ (૩) (૩)

## ઇલેક્ટોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ હોય તેવી માહિતી મેળવવાનો અધિકાર

તમને ડિસ્કેટ્સ, ફોલોપી, ટેપ, વીડિયો કેસેટ અથવા અન્ય ઇલેક્ટોનિક સ્વરૂપમાં હોય તેવી માહિતી પ્રિન્ટાર્ટ સ્વરૂપમાં માંગવાનો અધિકાર છે. અધિનિયમને એટલા વ્યાપક સ્વરૂપે ઘડવામાં આવ્યો છે જેથી નવી ટેકનોલોજીમાં ઉપલબ્ધ માહિતીનો પણ સમાવેશ થઈ શકે.<sup>૧૭</sup>

### તમે ખાનગી કંપનીઓ વિશેની માહિતી જાહેર સત્તામંડળો પાસેથી મેળવી શકો છો

આ અધિનિયમ હેઠળ, જાહેર સત્તામંડળો પાસેથી માહિતી મેળવવા ઉપરાંત, તમે જાહેર સત્તામંડળને એવી માહિતી માટે પણ અરજી કરી શકો છો જે ખાનગી સંસ્થાઓ સંબંધિત હોય, શરત એટલી જ છે કે તે જાહેર સત્તામંડળ અન્ય કોઈ અસ્તિત્વમાં હોય તેવા કાયદા હેઠળ માહિતી મેળવવા સક્ષમ હોય. ઉદાહરણ તરીકે, પર્યાવરણ તેમજ વન મંત્રાલયની શરત મુજબ ઉંઘોગોએ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પર્યાવરણ અહેવાલ રજૂ કરવાનો હોય છે. આ અહેવાલને ઉંઘોગો દ્વારા પ્રદૂષણને ઓછું કરવા અને સંશાધનોના રક્ષણ કરવા જરૂરી પ્રચાસો નક્કી કરવા ઉપયોગ થાય છે. આવા અહેવાલો મેળવવામાં તમે માહિતીનો અધિકાર અધિનિયમનો ઉપયોગ કરી શકો છો. આ જોગવાઈમાં મુદ્દોએ છે કે જાહેર સત્તામંડળો તમારી અરજીઓને ફક્ત એટલા માટે નકારી શકે નહિ કે કાયદા હેઠળ જાણકારી એકઠી કરવાની તેમની ફરજ તેમણે બજાવી નથી. જો તેમના માટે કાયદેસર માહિતી એકઠી કરવી જરૂરી હોય, તો માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ જરૂરી છે કે તેઓ બહાર જઈને માહિતી એકઠી કરી તમારા સુધી પહોંચાડે. આદર્શ રીતે, આનો અર્થ થયો કે તેઓ જે માહિતી એકઠી કરે છે તેના પર તેમણે કાર્યવાહી પણ કરવી જોઈએ.

### શું એવી કોઈ માહિતી છે જે નહીં મળે ?

માહિતીનો અધિકાર અધિનિયમ તમને વિશાળ શ્રેણીની માહિતી મેળવવાનો અધિકાર આપતો હોવા છતાં, અમુક એવી પરિસ્થિતિ છે જ્યાં કદાચ તમને માહિતી મળી શકે નહિ, કારણ કે તે સંયેદનશીલ છે. આવી માહિતી સરકાર દ્વારા તમારી પહોંચથી દૂર રાખવામાં આવે છે. તેનું કારણ એ હોય છે કે આવી માહિતી જાહેર કરવાથી લોકહિતને બદલે નુકસાન થશે. માહિતીના અધિકાર અધિનિયમમાં એવા ચોક્કસ મુદ્દાઓ જણાવવામાં આવ્યા છે જેમાં કાયદેસર રીતે તમને માહિતી આપવા મનાઈ કરી શકાય<sup>૧૮</sup> જેવા કે :

- (એ) જે માહિતી આપવાથી દેશની સલામતી, વૈજ્ઞાનિક અથવા આર્થિક હિતોને નુકસાન થઈ શકે અથવા વિદેશી દેશ સાથેના સંબંધ પર અસર થાય અથવા અપરાધ થવાની શક્યતા હોય;
- (બી) કાયદાની અદાલત અથવા ટ્રિબ્યુનલે માહિતી પ્રકાશન કરવાની સ્પષ્ટ મનાઈ કરી હોય અથવા જે જાહેર થવાથી કોઈનો તિરસ્કાર થઈ શકે તેમ હોય;
- (સી) જે પ્રગત થવાથી સંસદ અથવા રાજ્ય વિધાનમંડળના વિશેખાધિકારનો ભંગ થઈ શકે તેમ હોય;
- (કી) વાણિજ્યક ગોપનીયતા, ધંધાકીય રહસ્યો અથવા બૌદ્ધિક અસ્ક્યામતનો સમાવેશ કરતી માહિતી,
- જે જાહેર થવાથી ત્રાહિત પક્ષકારની સ્પર્ધાત્મક પરિસ્થિતિને નુકસાન થઈ શકે તેમ હોય;
- (ઈ) માહિતી કોઈ વ્યક્તિ પાસે એટલા માટે ઉપલબ્ધ હોય કારણ કે અન્ય વ્યક્તિ સાથે તેનો વિશ્વાસનો સંબંધ હોય (જેમ કે ડૉક્ટર/દર્દી, વકીલ/અસીલ)
- (એફ) વિદેશી સરકારને વિશ્વાસમાં લઈને મેળવેલ માહિતી હોય;

<sup>૧૭</sup> કલમ ૨ (જે) (૪)

<sup>૧૮</sup> કલમ ૮ (૧) અને ૬

- (જ) જેના જાહેર કરવાથી કોઈ વ્યક્તિનું જીવન અથવા શારીરિક સલામતી જોખમમાં આવે તેમ હોય;
- (એચ) જેના જાહેર થવાથી ગુનેગારોની તપાસ અથવા ધરપકડ અથવા તેમની સામેની ફોજદારી કાર્યવાહીની પ્રક્રિયામાં અવરોધ ઊભો થઈ શકે તેમ હોય;
- (આઈ) મંત્રીમંડળ, સચિવો અથવા અન્ય અધિકારીઓની ખાનગી મંત્રણા સંબંધી રેકર્ડ સહિત ડેબિનેટનાં પેપર આપવાની જવાબદારી રહેશે નહિં, જો કે નિર્ણય લેવાઈ ગયા પછી માહિતી જાહેર કરવી પડશે;
- (જ) માગવામાં આવેલ માહિતી કોઈ વ્યક્તિના અંગત જીવનને લગતી હોય, જેને આપવા સાથે કોઈ લોકહિત જોડાયેલું ન હોય અથવા તે વ્યક્તિના જીવનમાં બિનજરૂરી મુશ્કેલી ઊભી કરતી હોય;
- (ક) જાહેર થવાથી રાજ્ય સિવાયની અન્ય સંસ્થાના કોપીરાઇટ અધિકારનું ઉલ્લંઘન થતું હોય.

આ અપવાદો કાયમી નથી. જો તમે માગેલ માહિતીને જાહેર કરવામાંથી મુક્ત રાખી હોય, તો પણ જો તે માહિતીને મુક્ત રાખવાથી લોકહિતને હાનિ થતી હોય તો તે જાહેર કરવી જોઈએ. આને “લોકહિતમાં રદ કરવું” કહેવામાં આવે છે, જે મુક્ત કરવામાં આવેલ દરેક પ્રકારની માહિતીને લાગુ પડે છે.<sup>૧૯</sup> ઉદાહરણ તરીકે, અગાઉ ભારત સરકાર વિદેશી કંપની વરચેના કરારો દેશની સલામતી અને સુરક્ષાના કારણો આપી કરારોની નકલ સુધી પહોંચવા દેતી નહીંતી. પરંતુ જો આ કરારોમાં દલાલી અને વચ્ચેટિયા દ્વારા ખોટી લાગવગના આશ્કેપો થયા હોય, તો આવા કરારો વિશેની માહિતી જાણવામાં વિશાળ લોકહિત સમાયેલું છે. કરદાતાઓને એ જાણવાનો અધિકાર છે કે ખર્ચેલા ઇન્ધિયાનું વળતર દેશને મલયું છે, ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણો પસંદ કરવામાં આવ્યા કે નહિ અને નિર્ણય પ્રક્રિયામાં સામેલ મહત્વની વ્યક્તિઓને લાંચ આપવામાં આવી છે કે નહીં. અધિનિયમના સુરક્ષા અને વ્યૂહાત્મક હિતોની જોગવાઈઓનો ઉપયોગ કરી આ માહિતી આપવાથી ઈન્કાર કરી શકાય નહિ કારણ કે તેને જાહેર કરવામાં જ લોકોનું હિત વધારે છે.

### જે માહિતી સંસદ મેળવી શકે તે તમે પણ મેળવી શકો છો

માહિતીનો અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવાનો માર્ગદર્શક સિદ્ધાંત છે કે જે માહિતી સંસદ અથવા વિદ્યાનસભાના સર્વ્યને આપવાનો ઈન્કાર ન થઈ શકે તે તમને પણ આપવાથી ઈન્કાર થઈ શકે નહિ.<sup>૨૦</sup> તેથી જ્યાં મુક્તિ આપવામાં આવી હોય તે માહિતી જો સંસદ અથવા વિદ્યાનસભાના સર્વ્યને આપી શકાય તો તમને પણ આપવી જોઈએ.

કોઈપણ પરિસ્થિતિમાં જેમ કે મોટાભાગની વસ્તુઓના ઉપયોગ કરવાની એક સમયમર્યાદા હોય છે, તેવી રીતે મુક્તિની ચાઈમાં રાખવામાં આવેલી માહિતીની પણ ‘સુરક્ષિત’ કે ‘ગોપીનીય’ રાખવાની સમયમર્યાદા હોય છે, જે હંમેશા મુક્ત નથી રહેતી. અમુક સમય પસાર થયા પછી, માહિતી જાહેર કરવાથી કોઈ પણ પ્રકારે નુકસાન રાખવાની શંકા હોતી નથી. ઉદાહરણ તરીકે, આજે જે રાષ્ટ્રીય આર્થિક બાબતોને લગતી માહિતી ભારતની આંતરરાષ્ટ્રીય નાણાંકીય પરિસ્થિતિને અસર પહોંચાડી શકે છે, જે કદાચ ૧૦ કે ૨૦ વર્ષ પછી એટલી સંપેદનશીલ ન રહે. માહિતીના અધિકાર અધિનિયમમાં તમે એક અથવા બીજા સમયે જાહેર કરવામાંથી મુક્ત રાખવામાં આવી હોય તેવી ૨૦ વર્ષ પહેલાં બનેલ કોઈપણ બનાવ કે ઘટનાની માહિતી મેળવી શકો છો, પછી ભલે તે એક અથવા વધારે મુક્તિની ચાઈમાં સમાયેલ હોય.<sup>૨૧</sup> પરંતુ ઉપર જણાવેલ (એ) (સી) અને (આઈ)ની માહિતી ૨૦ વર્ષ પછી પણ ગોપનીય રાખવામાં આવશે.

<sup>૧૯</sup> કલમ ૮ (૨). “લોકહિત રદ કરવા” અંગે વધારે માહિતી માટે જુઓ પાના નં.૨૩નો બોક્સ.

<sup>૨૦</sup> કલમ ૮ (૧)

<sup>૨૧</sup> કલમ ૮ (૩)

# ભાગ-૫ : કઈ માહિતી સ્વૈચ્છિક રીતે પ્રકાશિત કરવી જરૂરી છે ?

માહિતીનો અધિકાર અધિનિયમ એ માંગ કરે છે કે તેના દાયરામાં આવતા બધા જાહેર સત્તા મંડળોએ વિશાળશ્રેણીની માહિતી આપમેળે (જેને અંત્રેજુમાં ‘સુઓ મોટો’ કહેવામાં આવે છે) પ્રકાશિત / જાહેર કરવી, પછી ભલે તે માહિતીની અરજી કોઈએ ચોક્કસ સ્વપ્રભાવમાં કરી હોય કે નહિ. આ એક મહિતવની જોગવાઈ છે, કારણ કે તે માને છે કે કેટલીક માહિતી વિશાળ સમૃદ્ધાય માટે એટલી જરૂરી અને મહિતવપૂર્ણ છે કોઈના માંગા. વિના તેને આપમેળે નિયમિત રીતે જાહેર કરવી જોઈએ. વિશાળ અર્થમાં, તે સ્વીકારે છે કે પારદર્શકતા એ સામાન્ય રીતે લોકહિતમાં હોય છે અને તેથી જાહેર સત્તામંડળોએ શક્ય તેટલી માહિતી જાહેર કરવા ઉપર ભાર મૂકવો જોઈએ.

## એવી માહિતી જે લોકભાગીદારી અને દેખરેખને પ્રોત્સાહિત કરે છે

માહિતીનો અધિકાર અધિનિયમની કલમ ૪ (૧) (બી) હેઠળ દરેક જાહેર સત્તામંડળોએ ૧૭ પ્રકારની માહિતી નિયમિત રીતે પ્રકાશિત કરવાની જોગવાઈ છે,<sup>૨૨</sup> જેમાં નિયમિત રીતે સુધારો/ઉમેરો થવો જોઈએ.<sup>૨૩</sup> આ બાબત એ દ્યાન રાખે છે કે નાગરિકોને હંમેશા પ્રામાણિક, ઉપયોગી અને જરૂરી માહિતી મળી રહે. પ્રકાશિત કરવાની માહિતી નીચે મુજબ સામાન્ય બાબતોને લગતી છે :

**સંસ્થાનું વ્યવસ્થાતંત્ર :** જેમાં કાર્યો અને જવાબદારીઓ, તેમના અધિકારીઓની સત્તાઓ અને જવાબદારીઓ, દરેક અધિકારીને મળતું માસિક વેતન.

ઉદાહરણ તરીકે : વિભાગ/સંસ્થાનો સંસ્થાકીય ચાર્ટ, વિભાગના ઇન્ચાર્જ અધિકારીઓનાં નામ, દરેક અધિકારીઓનાં કાર્યો અને સત્તાઓ તેમજ તેમને મળતું વેતન.

**કાર્ય કરવાની રીત :** જાહેર સત્તામંડળ દ્વારા નિર્ણય લેવાની પ્રક્રિયા માટે તેમણે નક્કી કરેલ ઘોરણો, નિયમો અને વિનિયમો, અધિકારીઓ પાસે રખાયેલ દસ્તાવેજોની શ્રેણી

ઉદાહરણ તરીકે : રાશનકાર્ડ કેવી રીતે કઢાવવું, વૃદ્ધ પેન્શન કેવી રીતે આપવામાં આવશે અથવા વીજા કેવી રીતે અપાશે તેને લગતા સરકારી નિયમો એટલે કે એ બધા કાયદાઓ, નિયમો, આંતરિક આદશો, મેમો તેમજ પરિપત્રો જેનો ઉપયોગ જાહેર સત્તામંડળો તેમના રોજબરોજના કાર્યમાં કરતા હોય.

<sup>૨૨</sup> કલમ ૪ (૧)

<sup>૨૩</sup> કલમ ૪ (૨)

**સંસ્થાને લગતી નાગાડીય વિગતો અને યોજનાઓ -** બધા સત્તામંડળોનું બજેટ (જેમાં તેમના દ્વારા ચલાવાતી પ્રવૃત્તિઓ અને યોજનાઓ તેમજ અમલીકરણ સંબંધી કોઈ રિપોર્ટ) સબસીડી કાર્યક્રમોને લાગુ કરવાની રીત (જેમાં ફાળવવામાં આવેલ ફંડ અને કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો) તેમજ કચેરી દ્વારા આપવામાં આવતી તમામ છૂટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારની વિગતો.

**ઉદાહરણ તરીકે :** અંદાજિત ખર્ચાઓ, જાહેર સત્તામંડળોએ મેળવેલ ત્રાંટ અને ફંડની વિગતો, ગરીબી રેખા નીચેના પરિવારોની યાદી, ગ્રામીણ વિકાસને લગતી યોજનાઓના વહિવટ અંગે નિયમિત અપડેટ, રોજગાર બાંહેદરી યોજના હેઠળ લાભાર્થીઓની વિગતો, ઔદ્યોગિક પરવાનાઓ મેળવનાર અને પંચાયત બજેટના દસ્તાવેજો.

**પરામર્શક વ્યવસ્થાઓની વિગત -** નીતિ ઘડતર અથવા તેના અમલીકરણમાં લોકોએ જોડાવવાની વ્યવસ્થા, તેવી રીતે સરકારી બોર્ડની કાર્ય નોંધો, સમિતિઓ, કાઉન્સીલ અને સલાહકાર જૂથો અંગેની વ્યવસ્થા.

**ઉદાહરણ તરીકે :** ખાસ મુદ્દાઓ પર કામ કરવા પંચાયતો અને નગરપાલિકાઓની સમિતિઓ, સંસદીય સમિતિઓ, તપાસ નિગમો, વિભાગીય ખરીદ સમિતિઓ, વિભાગીય બઢતી સમિતિઓ અથવા ટેકનિકલ સલાહ સંસ્થાઓ

**માહિતી પ્રાપ્ત કરવા સંબંધી વિગતો-** કચેરીમાં ઉપલબ્ધ હોય તેવા તમામ પ્રકારના દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ હોય તેવી માહિતીની વિગતો, નાગરિકો માટે માહિતી મેળવવાની સુવિધા તેમજ જાહેર માહિતી અધિકારીઓનાં નામ અને હોદાઓ.

**ઉદાહરણ તરીકે :** લોકો સાથે વ્યવહારના દિવસો અને સમય, વાંચનાલયનો સમય તેમજ માહિતીનો અધિકાર અધિનિયમને લાગુ કરવા કામ કરતા બધા અધિકારીઓનાં નામ.

કેન્દ્ર અને રાજ્યસ્તરના ધણાં જાહેર સત્તામંડળોએ કલમ-૪(૧) (બી) હેઠળ આવતી માહિતી તેમની વેબસાઇટ અથવા અન્ય માદ્યમો દ્વારા પ્રકાશિત કરવાની શરૂઆત કરી દીધી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રાલયો/વિભાગોએ સ્વયં જાહેર કરેલી માહિતી ભારત સરકાર દ્વારા તૈયાર કરેલ માહિતીના અધિકાર માટેની વેબસાઇટ <http://www.rti.gov.in> પર ઉપલબ્ધ છે.

જાહેર સત્તામંડળોએ દ્યાન રાખવું જરૂરી છે કે કલમ-૪ (૧) (બી) હેઠળની માહિતીનો વ્યાપક પ્રસાર થાય. માત્ર માહિતીને એકઠી કરી ફાઈલમાં રાખવી પૂરતી નથી. માહિતી એવા સ્વરૂપમાં હોવી જોઈએ જેનાથી સામાન્ય વ્યક્તિ તેને મેળવી શકે- ઉદાહરણ તરીકે ઓફિસનાં નોટિસ બોર્ડ ઉપર માહિતી લગાવવી, છાપામાં પ્રકાશિત કરવી, સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવી, છાપામાં જાહેરાત કરાવવી અને દ્યાન રાખવું કે વિસ્તારની

સ્થાનિક ભાષામાં પ્રકાશિત થાય. <sup>૨૪</sup> દરેક જાહેર માહિતી અધિકારી પાસે ઓછામાં ઓછા એક દસ્તાવેજ અથવા કોમ્પ્યુટર સ્વરૂપમાં આ માહિતી ઉપલબ્ધ હોવી જોઈએ જેથી તરત જ તેને નિરીક્ષણ કરવા અથવા પ્રિન્ટ આઉટ અથવા ફોટો કોપી સ્વરૂપમાં માંગવામાં આવ્યું હોય તો આપી શકે. <sup>૨૫</sup>

## એવી માહિતી જે જવાબદાર નિર્ણય પ્રક્રિયાને પ્રોત્સાહિત કરે છે

સરકાર નિયમિત રીતે લોકોને અસર કરતી નીતિઓ, પ્રોજેક્ટ અને યોજનાઓ ઘડે છે. માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ દરેક જાહેર સત્તામંડળોમાં નીતિઓ ઘડવા અથવા નિર્ણય લેવા સંબંધી તમામ હકીકતો પ્રસિદ્ધ કરવી જરૂરી છે. તેનો અર્થ થયો કે, નીતિ ઘડતર પ્રક્રિયામાં નાગરિકો વધુ સક્રિય રીતે જોડાઈશકશે અને ચકાસણી પણ કરી શકશે કે વાજબી રીતે નિર્ણય લેવાયો છે કે નહીં. <sup>૨૬</sup> આમાં ઉદાહરણ તરીકે ડેમ અથવા પાવર પ્રોજેક્ટનાં બાંધકામ માટે સંપાદિત કરવામાં આવેલ ખાનગી જમીનને લગતા કોઈપણ પ્લાન અંગેની વિગતો અથવા ગરીબી નાખૂંદી માટેની નવી નીતિઓ અને યોજનાઓ વગેરેનું પ્રકાશન કરવાનું સામેલ છે.

જાહેર સત્તામંડળોએ હવે તેમના નિર્ણયોના કારણો અસરકર્તા લોકોને જણાવવા પડશે. <sup>૨૭</sup> ઉદાહરણ તરીકે, જો કોઈ કલ્યાણકારી યોજનાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે તો તેનું કારણ લાભ મેળવતા નાગરિકોને લેખિતમાં જણાવવું જરૂરી છે. આ સિવાય આવો નિર્ણય પ્રકાશિત થયો જોઈએ જેથી લોકો જાણી શકે કે નિર્ણય વાજબી રીતે લેવાયો છે કે નહીં.

### કલમ-૪ ની માહિતી માટે રાહ જોવાની કે અરજી ફી ભરવાની જરૂર નથી !

માહિતીનો અધિકાર અધિનિયમ માને છે કે રાયેચિષ્ટક રીતે જાહેર કરવાની માહિતી સરકાર વિનામૂલ્યે વ્યાપક સ્વરૂપે પ્રસાર કરશે. તે માટે કોઈ વિશેષ અરજી કે અરજી ફી ભરવાની જરૂર નથી. કારણ કે તે અરજી તરીકે ગણવામાં આવશે નહીં, માહિતી માટે તમને ૩૦ દિવસ રાહ જોવાની જરૂર નથી. માહિતી તમને શક્ય તેટલી ઝડપથી મળવી જોઈએ. વધારેમાં વધારે, તમે જે નકલો માંગી છે તેનો ખર્ચ લેવામાં આવે, પરંતુ નિરીક્ષણ વિનામૂલ્યે હોય જોઈએ. જો કોઈ જાહેર સત્તામંડળ તમને અરજી સાથે ફી આપવાનું કહે, તો તમે તેને આ બાબત રાજ્ય અથવા કેન્દ્ર માહિતી આયોગને પૂછવા કહી શકો. આયોગ નિશ્ચિત રૂપથી ખરાઈ કરશે કે તમને અરજી કરવાની જરૂર નથી.

<sup>૨૪</sup> કલમ ૪ (૨), (૩) અને (૪)

<sup>૨૫</sup> કલમ ૪ (૪)

<sup>૨૬</sup> કલમ ૪ (૧) (સી)

<sup>૨૭</sup> કલમ ૪ (૧) (ડી)

## ભાગ-૫ : હું માહિતી માટે અરજી કેવી રીતે કરું ?

જો તમને કોઈ વિશેષ માહિતી જોઈતી હોય જે સરકાર દ્વારા સ્વૈચ્છક રીતે જાહેર કરાઈ નથી, ઉદાહરણ તરીકે તમે જાણવા દરખતા હો કે તમારા સંસદ સભ્ય તેમના સ્થાનિક વિસ્તાર વિકાસ બંડોળમાંથી કેવી રીતે નાણા ખર્ચ છે, તમારા વિસ્તારમાં રોડ અને ગરૂ વ્યવસ્થા માટે કેટલા નાણા મંજૂર થયા હતાં અથવા મંત્રાલયની ઓફિસોને શાણગારવા માટે આપેલ કરારની નકલ જોવી હોય, તો માહિતીનો અધિકાર અધિનિયમ તમને જાહેર સત્તામંડળને લેખિત અરજી કરવાનો અધિકાર આપે છે.<sup>૨૮</sup>

### પગથિયું-૧ : માહિતી ધરાવનાર જાહેર સત્તામંડળને ઓળખો

સૌથી પહેલાં તમારે એ જાણવું પડશો કે તમે દરખતો છો તે માહિતી કયા જાહેર સત્તામંડળ પાસે છે. જો તમને ઓક્કસ ખબર ન હોય કે માહિતી કોની પાસે છે, તો તમને લાગતાં હોય તેવા સંભવિત જાહેર સત્તામંડળની જેની માહિતી હોઈ શકે તેની ચાટી બનાવો, તેમાંથી કોઈ એક જાહેર સત્તામંડળને તમારી અરજી મોકલો અથવા તેમના કાર્યાલયમાં અરજી આપો. તમે ખોટા પડશો તે વિશે તમારે વધારે પડતી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ જે ઓફિસમાં તમે અરજી આપી હોય, તેની પાસે તમને જોઈતી માહિતી ન હોય, તો પણ તેમણે તમારી અરજી પરત આપવાની નથી, બલ્કે અરજી સંબંધિત જાહેર સત્તામંડળને પાંચ દિવસમાં પહોંચાડવાની તેમની ફરજ છે.<sup>૨૯</sup> જો તમારી અરજી એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવી હોય, તો પ્રથમ જાહેર સત્તામંડળે અરજીની બદલી અંગે તમને લેખિતમાં જાણ કરવી જોઈએ. તે પછી બીજું જાહેર સત્તામંડળ તમે માંગેલ માહિતી ત૦ દિવસમાં પૂરી પાડવા જવાબદાર બને છે.

**ઉદાહરણ તરીકે :** જો તમે જાણવા દરખતા હો કે તમારી વસાહત/પડોશમાં શેરી રસ્તો બનાવવા કેટલાં નાણા ફુલવવામાં આવ્યા છે, તો તમારે તમારા વિસ્તારમાં રોડ અને જાહેર કાર્યો કરવા જવાબદાર સ્થાનિક નગરપાલિકાને અરજી કરવી જોઈએ. અથવા જો તમે તમારા નવા વીજળી કનેક્શનની અરજી ઉપર થયેલ પ્રગતિ જાણવા મંગતા હોય તો તમારે વીજળી વિભાગમાં અરજી કરવી જોઈએ અથવા તમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કયા પ્રકારની આરોગ્ય સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ છે, તે જાણવું હોય તો આરોગ્ય વિભાગમાં અરજી કરવી જોઈએ.

### પગથિયું-૨ : જાહેર સત્તામંડળમાં એઅધિકારીને ઓળખો જેને માહિતી માટેની અરજી આપવાની છે.

એક વખત તમે ઓળખી લો કે તમારે જોઈતી માહિતી કયા જાહેર સત્તામંડળ પાસે છે તે પછી તમારે નક્કી કરવાનું છે કે તમે અરજી કયા અધિકારીને સોંપશો તમે દરેક વિભાગમાં નિમણૂક કરવામાં આવેલ જાહેર માહિતી અધિકારીઓ અને મદદનીશ જાહેર માહિતી અધિકારીઓ અંગેની વિગતો તે વિભાગની વેબસાઇટ અથવા સીધા

<sup>૨૮</sup> કલમ ૫ (૧)

<sup>૨૯</sup> કલમ ૫ (૩)

તે વિભાગનો સંપર્ક કરી જાણી શકો છો અને તેમની મદદ પણ લઈ શકો છો.<sup>30</sup> તમારે દયાનમાં રાખવું જોઈએ કે, જો તમે અરજી મદદનીશ જાહેર માહિતી અધિકારીને આપો તો તમારો જવાબ મેળવવાની સમય મર્યાદા ૩૦ થી વધીને ઉપ દિવસ થઈ જાય છે. માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ દરેક વિભાગોએ તેમના જાહેર માહિતી અધિકારીઓ અને મદદનીશ જાહેર માહિતી અધિકારીઓની ચાટી ઇલેક્ટ્રોનીક અથવા છ્પાયેલ માદ્યમ દ્વારા તૈયાર રાજવી જરૂરી છે.

જો કે, માહિતીના અધિકાર અધિનિયમમાં સમાયેલ દરેક જાહેર સત્તામંડળની ફરજ છે કે અરજી સ્વીકારવા અને તેની ઉપર પ્રક્રિયા કરવા જાહેર માહિતી અધિકારીઓની નિમણૂક કરે, પરંતુ હક્કિકતમાં એવું જાણવા મળ્યું હતું કે, કેટલાંક જાહેર સત્તામંડળોમાં હજુ જાહેર માહિતી અધિકારીની નિમણૂક કરવાની બાકી છે અને તેના આધારે તેઓ માહિતી માટેની અરજીઓનો અસ્વીકાર કરે છે. જો તમારી સાથે આવું થાય તો, તમે સીધા કેન્દ્ર અથવા રાજ્ય માહિતી આયોગને ફરિયાદ કરી જાહેર માહિતી અધિકારીઓની નિમણૂકની માંગણી કરી શકો છો (વધારે વિગત માટે જુઓ ભાગ-૮). માહિતી આયોગોને કેન્દ્ર અથવા રાજ્ય સ્તરે જાહેર માહિતી અધિકારીઓની નિમણૂક અંગે જોગવાઈ કરવાની સત્તા છે.<sup>31</sup>

### પગથિયું-૩ : સ્પષ્ટ અરજી લખો

તમે લેખિત અથવા ઇલેક્ટ્રોનિક સ્પર્ધે અંગેજુ, હિન્દી અથવા સ્થાનિક ભાષામાં અરજી કરી શકો છો.<sup>32</sup> અરજી લખતી વખતે તમારી અરજી સ્પષ્ટ અને મુદ્દાસર હોય તે દયાન રાખવું અગત્યનું છે. તમારી અરજી શક્ય તેટલી સ્પષ્ટ હોવી જોઈએ જેથી તમે વધારે પડતા દસ્તાવેજોનો ભાર અને તે માટે ભરવી પડતી બિનજરૂરી ફી ટાળી શકો. અરજી લખતી સમયે તમારી અરજી મુદ્દાસર હોવી પણ જરૂરી છે, જેથી જાહેર માહિતી અધિકારી એ આધારે અરજી પરત ન કરી શકે કે તે અસ્પષ્ટ અને સમજવા માટે મુશ્કેલ છે.

#### તમને માહિતી શા માટે જોઈએ છે તે જણાવવાની જરૂર નથી

અધિનિયમ એકદમ સ્પષ્ટ રીતે કહે છે કે તમને માહિતી શા માટે જોઈએ છે તેના કારણો આપવાની જરૂર નથી.<sup>33</sup> શા માટે અથવા કયા હેતુસર તમને માહિતીની જરૂર છે એ જણાવ્યા વગર તમે કોઈ પણ પ્રકારની માહિતીની અરજી કરી શકો છો. તે દશયે છે કે માહિતીનો અધિકાર એ તમારો અધિકાર છે અને તમને તમારી અરજીને પૂરવાર કરવાની જરૂર નથી. બલ્કે હ્યે ગોપનીયતાને પૂરવાર કરવાની જરૂર છે.

અધિનિયમમાં અરજી કોઈ ચોક્કસ ફોર્મમાં જ હોવી જોઈએ તેવી સ્પષ્ટતા નથી. તેમ છતાં કેટલાક રાજ્ય સરકારો આવી માંગણી કરતી જણાય છે. એ નોંધનીય છે કે, કેન્દ્ર સરકારના માહિતીનો અધિકાર (ફી અને ખર્ચના નિયમનો) નિયમો ૨૦૦૫ માં અરજી માટે કોઈ નક્કી તૃપ્તેખા દર્શાવવામાં આવી નથી. વધુમાં, કેટલાક રાજ્ય

<sup>30</sup> અથવા પછી કેન્દ્ર અને રાજ્યોમાં નિમાયેલ જાહેર માહિતી અધિકારીઓ અને મદદનીશ જાહેર માહિતી અધિકારીઓની ચાટીઓ અને સંપર્ક માટે ભારત સરકારની માહિતી અધિકાર પોર્ટલ પર લોગ ઓન કરો. <http://www.rti.gov.in> ૨૦ માર્ચ ૨૦૦૫.

<sup>31</sup> કલમ ૧૮ (૮) (અ) (ii)

<sup>32</sup> કલમ ૫ (૧)

<sup>33</sup> કલમ ૫ (૨)

સરકારોએ એવું પણ નક્કી કર્યું છે કે-અરજુ ચોક્કસ ફોર્મમાં નહીં, પરંતુ રૂપરેખા મુજબ હોવી જોઈએ.<sup>૩૪</sup> એક ઐતિહાસિક ચુકાદામાં કેન્દ્રીય માહિતી આયોગે જણાવ્યું કે સામાન્ય કાગળ ઉપર લખાયેલ માહિતીની અરજીને પણ ઓપચારિક અરજુ ગણવામાં આવશે. સરકારી વિભાગો વહીવટી કારણોસર કદાચ ફોર્મ બનાવી શકે છે પરંતુ આમ કરવાથી સાદા કાગળ ઉપર હસ્તલિખિત અથવા ફોટોકોપી સ્વરૂપમાં અરજુ કરવાનું અટકાવી શકાય નહીં.<sup>૩૫</sup>

## પગથિયું ૪ : તમારી અરજુ રજૂ કરો

અરજુ પૂરી કર્યા પણી, તમારે તેને મોકલવાની જરૂર છે :

- \* તે જાહેર સત્તામંડળના જાહેર માહિતી અધિકારીને જેની પાસે જોઈતી માહિતી છે અથવા
- \* તમારી નજીક તાલુકા સ્તરે નિમાયેલ મદદનીશ જાહેર માહિતી અધિકારીને જેની જવાબદારી છે કે અરજુ સંબંધિત જાહેર માહિતી અધિકારીને પહોંચાડે.

તમે તમારી અરજુ રૂબરૂ, પોસ્ટ, ફેક્સ કે ઈ મેઇલથી મોકલી શકો છો. જો તમે તમારી અરજુ પોસ્ટથી મોકલી રહ્યા હો તો તમારે રજિસ્ટર્ડ પોસ્ટ અથવા **Under Posting Certificate (UPC)** થી મોકલવી જોઈએ. જેથી તમારી પાસે ટપાલથી મોકલ્યાનો પુરાવો રહે અને જાહેર માહિતી અધિકારી પણ એમ ન કહી શકે કે તેમને અરજુ મળેલ નથી. જો તમે રૂબરૂ અરજુ આપો તો જાહેર માહિતી અધિકારી અથવા મદદનીશ જાહેર માહિતી અધિકારીએ તે સમયે જ રસીદ આપવી જોઈએ. રસીદમાં અરજુ મળ્યાનો સમય અને તારીખ તેમજ અરજુ સ્વીકારનાર નામનો ઉલ્લેખ હોવો જોઈએ.

અધિનિયમ મુજબ અરજુ પ્રક્રિયા પર કાર્યવાહી શરૂ થાય તે પહેલાં અરજુ ફી ભરેલી હોવી જોઈએ. કેન્દ્ર અને રાજ્યો ક્રાંતિકા જુદી-જુદી ફી નક્કી કરવામાં આવી છે (વધુ વિગતો માટે જુઓ અનુસૂચિ-૨). જો તમે રૂબરૂ અરજુ આપો તો, જાહેર માહિતી અધિકારી અથવા મદદનીશ જાહેર માહિતી અધિકારી અરજુ સ્વીકાર્યની તારીખ અને સમય તેમજ મળેલ અરજુ ફીની વિગતો લખી તરત તમને રસીદ આપશો. અમુક વિભાગોમાં, જાહેર માહિતી અધિકારી પોતે ફી સ્વીકારશે નહીં, પરંતુ રોકડ સ્વીકારતા વિભાગ પાસે તમને મોકલશે. કોઈ પણ કિસ્સામાં તમે ભરેલી ફીની રસીદ મેળવવાનો આગ્રહ રાખો. જો તમે અરજુ પોસ્ટ કે ઈ-મેઇલથી મોકલાવો તો ફી તમે ડિમાન્ડ ફ્રાફ્ટ, ચેક અથવા મની ઓર્કરથી મોકલી શકો છો, પરંતુ જો તમે રોકડ ચૂકવો, તો તમારે ચૂકવેલ ફીની રસીદ લેવી જ જોઈએ.

માહિતીના અધિકાર અધિનિયમમાં ફી ભરવા માટેની અથવા વધારાની ફી માટે કોઈ ચોક્કસ રીત સૂચવાયેલ નથી. ચૂકવણીની ફી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ બધાર પાડેલ ફી નિયમોમાં દર્શાવેલ છે (વધારે વિગત માટે જુઓ અનુસૂચિ-૨). કેટલાંક રાજ્યોએ ચૂકવણીના મર્યાદિત વિકલ્પો નક્કી કર્યા છે, જેમણે તમે ડિમાન્ડ ફ્રાફ્ટ, ચેક અથવા રોકડેથી જ ફી ભરી શકો છો. પરંતુ આદર્શ રીતે પરિસ્થિતિ એ હોવી જોઈએ કે તમે નોન-જ્યુડિશયલ સ્ટેમ્પ અને પોસ્ટટ ઓર્કર જેવા વિવિધ વિકલ્પોમાંથી કોઈ એકને પસંદ કરી શકો છો. ફી કેવી રીતે ભરવાની છે તે અંગે તમને શંકા હોય, તો તમે રાજ્ય સરકારે દર્શાવેલ નિયમો તપાસી શકો છો અને / અથવા જાહેર માહિતી અધિકારીના અથવા અધિનિયમનો અમલ કરનાર નોડેલ એજન્સીનો સંપર્ક કરી શકો છો. તેઓ તમને મદદરૂપ થશે.

<sup>૩૪</sup> ગુજરાત અને મહારાષ્ટ્રના માહિતી અધિકારના અરજુ ફી નિયમ સાદા કાગળ પર અરજુ કરવાની પરવાનગી આપે છે, શરત એટલી કે તેમાં બધી વિગતો હોવી જોઈએ જે છાપેલ ફોર્મમાંછે.

<sup>૩૫</sup> એનડીટીવી (૨૦૦૯) “સલમદવેલર વિન્સ રાઇટ દુ ઇન્ડર્સેન્શન” એનડીટીવી.કોમ, રૂ ફેલ્બુઆરી, <http://www.ndtv.com/morenews/showmorestory.asp?category=National&slug=Slum+dweller+%27wins%27+right+to+information&id=84602>, ૨૦ માર્ચ ૨૦૦૯.

## માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરવા માટેની સૂચિત રૂપરેખા\*

અરજી લખવા સમયે એ જરૂરી છે કે તમારો પ્રશ્ન એકદમ મુદ્દાસર હોય જેથી તે સ્પષ્ટ થઈ જાય કે તમને કઈ માહિતી જોઈએ છે. તમારી અરજીમાં ઓછામાં ઓછા એટલી વિગતો અવશ્ય હોવી જોઈએ જેથી જાહેર માહિતી અધિકારી તમને જરૂરી માહિતી પૂરી પાડી શકે. માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ અરજી નીચે મુજબ હેખાય તેવી હોઈ શકે :

પ્રતિ : મદદનીશ / જાહેર માહિતી અધિકારી

વિભાગનું નામ

સરનામું

૧. અરજદારનું પૂર્ક નામ : કવિતા જોધી.
૨. સરનામું : ૧૦૫, હિરિનગર, પણેલો માળ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯
૩. ફોન : (૦૭૯) ૨૫૩૭ ૭૫૮૦
૪. અરજી કર્યાની તારીખ : ૧૦ ડિસેમ્બર ૨૦૦૯
૫. વિભાગનું નામ : જાહેર બાંધકામ વિભાગ
૬. માંગેલી માહિતીની વિગત :

“હું જાણવા ઈછું છું કે મારા ઘર પાસેથી સરકારી કામ કેમ નથી થયું” જેવા સામાન્ય પ્રશ્નો ન પૂછો નીચે જણાવેલ પ્રશ્નો કરતાં આ પ્રશ્નને અસ્પષ્ટ જવાબ મળવાની શક્યતા છે :

- (અ) છેલ્લા બે વર્ષમાં ૧૩૨ રીંગરોડ અને સરદાર પટેલના રીંગરોડની નિભાવણી કરવા માટે કેટલાં નાણા ફળવવામાં આવ્યા હતાં ?
- (બ) રોડ બનાવવા માટે વાસ્તવમાં કેટલાં નાણાં ખર્ચાં, અને :
- (૧) તેનો કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો હતો;
  - (૨) ટેનકરની વિગતો શું હતી;
  - (૩) કાર્ય કયારે પૂર્ણ થયું;
  - (૪) કરારમાં દશવિલ શરતો મુજબ કામ થયું છે કે નહીં, તેની અકાસણી માટે જવાબદાર અધિકારીનું નામ અને હોલ્ડો
૭. માહિતીનો સમયગાળો : જાન્યુઆરી ૨૦૦૫ થી આજ દિન સુધી.
૮. માંગેલી માહિતીનું રૂપ : નકલ / કાર્યોનું નિરીક્ષણ / રેકર્ડનું નિરીક્ષણ / પ્રમાણિત નકલો / પ્રમાણિત નમૂના. (કોઈપણ એક પર ટીક કરો)
૯. ચૂકવેલ ફીની વિગતો : રૂસીએ નંબર XXXXX તા. ૧૦ ડિસેમ્બર ૨૦૦૯
૧૦. અરજદાર ગરીબી રેખા હેઠળ આવે છે : હા / ના (જે હા તો બીપીએલ નંબર પુરાવો જોડો.)

અરજી કરનારની સહી

\* આ અરજી માત્ર નમૂના માટેની રૂપરેખા છે. સીએચઆરઆઈ સૂચયે છે કે તે જે જાહેર સત્તામંડળના જાહેર માહિતી અધિકારી પાસેથી માહિતી મેળવો છો તેને પૂછો કે અરજીમાં કઈ વિગતો સમાવવી જોઈએ.

### “ગરીબી રેખા નીચેના પરિવારો” એ કોઈ ફી ભરવાની નથી<sup>39</sup>

માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ ગરીબી રેખા નીચે (બી.પી.એલ.) જીવતા પરિવારોએ કોઈ ફી ચૂકવવાની હોતી નથી. માહિતી માટે અરજી કરતાં સમયે બી.પી.એલ. કાર્ડઘારકોએ બી.પી.એલ. કાર્ડની નકલ અથવા તેમનું નામ ઘરાવતી બી.પી.એલ. ચાદી અથવા કોઈ અન્ય પૂરાવો સક્ષમ અધિકારીની સહી સાથે રજૂ કરવાનો રહેશે. બીજે વિકલ્પ છે કે, અરજી રૂબરૂ આપતી વખતે, બી.પી.એલ. અરજદારને અધિકાર છે કે જાહેર માહિતી અધિકારી તેમની અરજી ઉપર બી.પી.એલ. સ્તર દર્શાવતું લખાણ સાબિતી તરીકે નોંધે.

### પગથિયું પ : નિર્ણય માટે રાહ જુઓ

એક વાર જાહેર માહિતી અધિકારી તમારી અરજી, ફી સાથે સ્વીકારે, તે પછી તેમણે શક્ય તેટલી ઝડપે, પણ ૩૦ દિવસની અંદર તમારી અરજી પર પ્રક્રિયા શરૂ કરવી જરૂરી છે.<sup>40</sup> જો અરજી મદદનીશ જાહેર માહિતી અધિકારી પાસે હોય તો આ સમયમચ્ચાટામાં બીજા પાંચ દિવસ ઉમેરાશે.<sup>41</sup> જો તમે માંગેલ માહિતી વ્યક્તિનાં જીવન અથવા વ્યક્તિગત સ્વતંત્રતાને લગતી હોય તો તેનો નિર્ણય રૂટ કલાકમાં થવો જોઈએ.<sup>42</sup> ઉદાહરણ તરીકે પોલીસ કોઈ વ્યક્તિને ઘરપકડ વૉરન્ટ કે મેમો વગર પકડીને લઈ ગઈ છે, તો તેના પરિવારજનો, મિત્રો અથવા અન્ય કોઈ ત્રીજે પક્ષકાર પોલીસ વિભાગના જાહેર માહિતી અધિકારીને તેને કથાં લઈ જવામાં આવ્યો છે તે વિશે પૂછી શકે છે અને આના જવાબની કાર્યવાહી બે દિવસમાં કરવી જોઈશે. જયારે આ રીતની અરજી કરવામાં આવે ત્યારે અરજીમાં તમારે ઉલ્લેખ કરવો જોઈએ કે શા માટે તમને લાગે છે કે આ અરજી “જીવન અથવા વ્યક્તિગત સ્વતંત્રતા”<sup>43</sup>ને લગતી છે જેથી જાહેર માહિતી અધિકારી તમારી અરજી ઉપર પગલાં લેવામાં મોકું ન કરે.

<sup>39</sup> કલમ ૭ (૫)

<sup>40</sup> કલમ ૭ (૧)

<sup>41</sup> કલમ ૫ (૨)

<sup>42</sup> કલમ ૭ (૧)

## ભાગ-૭ : મારી અરજુ ઉપર નિર્ણય કેવી રીતે લેવાય છે?

તમારી અરજુ અંગે પગલાં લેવા જાહેર માહિતી અધિકારીએ તરતજ એ નક્કી કરવાની જરૂર રહે છે કે તમે માંગેલી માહિતી :

- (અ) કચેરીમાં મોજુદ છે ? અને જો એમ ન હોય તો અન્ય જાહેર સત્તામંડળને એ તબદિલ કરવા અને તબદિલીની જાણ તમને લેખિતમાં કરવી જોઈએ;
- (બ) ત્રીજા પક્ષકારની ગોપનીય સંબંધીત માહિતીની ચાદીમાં આવે છે અને નિર્ણય લેતા પહેલા ત્રીજા પક્ષકાર પાસેથી સલાહ-સૂચન મેળવવાની જરૂર છે અને
- (ક) જાહેર કરવામાંથી મુક્તિ પામેલ ચાદીમાં આવે છે, અને તેને જાહેર કરવામાં કોઈ લોકહિત સંકળાયેલું છે કે નહિ.

### જે માહિતી “ત્રીજા પક્ષકાર” સંબંધિત છે તો ?

સામાન્ય રીતે, લોકો એવી માહિતી માટે અરજુ કરતા હોય છે જે અરજુ સ્વીકારનાર જાહેર સત્તામંડળને જ લગતી હોય છે. આવા કિસ્સાઓમાં અરજુ પ્રક્રિયામાં ફક્ત બે પક્ષોજ સંકળાયેલા હોય છે- અરજદાર અને જાહેર સત્તામંડળ. પરંતુ કેટલીકવાર અરજદાર એવી માહિતી માંગે છે જે ત્રીજા પક્ષકારને અસર કરતી હોય. દા.ત. તમને જે હરીફ કંપની દ્વારા અપાયેલા નિવિદા (ટેન્ડર) અથવા તમારા સાથી કાર્યકર દ્વારા સાંસદને લખાયેલ પત્ર જોવો હોય તો હરીફ કંપની અને તમારો સાથી કાર્યકર એ “ત્રીજો પક્ષકાર” છે. કચારેક- પરંતુ હંમેશા નહીં માહિતીના અધિકાર અધિનિયમમાં અરજુ અંગે ત્રીજા પક્ષકાર સાથે પરામર્શ કરવાની જોગવાઈ છે. ત્રીજા પક્ષકાર સાથે ત્યારે જ પરામર્શ કરવાની જરૂરિયાત પડે જયારે :

- \* જાહેર માહિતી અધિકારીને માહિતી જાહેર કરવાનું ચોગ્ય લાગતું હોય;
- \* માહિતી ત્રીજા પક્ષકારને સંબંધીત હોય અથવા ત્રીજા પક્ષકાર દ્વારા જાહેર સત્તામંડળને ખાનગીમાં આપવામાં આવી હોય અને
- \* ત્રીજો પક્ષકાર માહિતીને ખાનગી માનતો હોય.

ત્રીજા પ્રકારની જરૂરિયાત મુખ્ય છે. ત્રીજા પક્ષકાર સંબંધિત ઘણી માહિતી હોઈ શકે, પરંતુ એવા અમુક જ કિસ્સાઓ હોય છે જ્યાં ત્રીજો પક્ષકાર માહિતીને ખાનગી માનતો હોય. સબસીડી અથવા પરવાનાઓ મેળવનારની ચાદીઓ, સરકાર અથવા સમિતિને સાંપેલ કરારો, જેવી માહિતીમાં ત્રીજો પક્ષકાર સંકળાયેલો હોવા છતાં ત્રીજા પક્ષકારને લગતી ખાનગી માહિતી નથી. તેથી ત્રીજા પક્ષકારના સલાહ-સૂચનની જરૂરિયાત નથી.

જ્યાં ઉપર જણાવેલ ત્રીજા પ્રકારની જરૂરિયાત હોય, ત્યાં ત્રીજા પક્ષકાર સાથે સલાહ-સૂચન એ જાણવા થવું જરૂરી છે કે માહિતી આપવી જોઈએ કે નહિ. તે માટે જાહેર માહિતી અધિકારીએ પ દિવસની અંદર માહિતી જાહેર કરવા સંબંધિત લેખિત નોટિસ ત્રીજા પક્ષકારને મોકલવી જોઈએ<sup>૩૦</sup>

<sup>૩૦</sup> કલમ ૧૧ (૧)

ત્રીજા પક્ષકારે નોટિસ મળ્યાના ૧૦ દિવસમાં તેમનો જવાબ રજૂ કરવાનો હોય છે.<sup>૩૧</sup> ત્રીજા પક્ષકાર તરફથી જવાબ મળે કે ન મળે, અરજુ મળ્યાના ૪૦ દિવસમાં જાહેર માહિતી અધિકારીએ માહિતી જાહેર કરવી કે નહીં તે અંગેનો નિર્ણય લેવો પડે છે.<sup>૩૨</sup> નિર્ણય લેતા પહેલાં, જાહેર માહિતી અધિકારીએ ત્રીજા પક્ષકાર દ્વારા કરાયેલ રજૂઆતને દ્યાનમાં લેવી જોઈએ. જો ત્રીજા પક્ષકારે વાંધો ઉઠાવ્યો હોય, પરંતુ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ ન મેળવતી હોય તો જાહેર માહિતી અધિકારીએ માહિતી જાહેર કરવી જોઈએ. આવા કિસ્સાઓમાં જાહેર માહિતી અધિકારીના નિર્ણય સામે ત્રીજો પક્ષકાર વિભાગીય અપીલીય અધિકારી અને/ અથવા માહિતી આચોગને અપીલ કરી શકે છે. (વધુ વિગત માટે જુઓ ભાગ-૮ ).

## જો જાહેર માહિતી અધિકારી મારી અરજુ મંજૂર કરે તો ?

જો જાહેર માહિતી અધિકારી તમને માહિતી આપવાનો નિર્ણય લેશે, તો ત્રીજા પક્ષકાર તમને નોટિસ મોકલી નિર્ણયની જાણ કરશે. નોટિસમાં તમને વધારાની ફીની રકમ, તમારો અપીલ કરવાનો અધિકાર, માહિતી કયા સ્વરૂપમાં જોઈએ છે, અપીલીય અધિકારી અંગેની વિગતો, અપીલ કરવાની સમયમર્યાદા, અથવા અન્ય જરૂરી વિગત જણાવવામાં આવશે.<sup>૩૩</sup> ચાદ રાખો કે જો જાહેર માહિતી અધિકારી અધિનિયમમાં જણાવેલ સમય મર્યાદામાં માહિતી પૂરી ન પાડે, તો માહિતી તમને વિનામૂલ્યે મળવી જોઈએ.<sup>૩૪</sup>

માહિતી ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે જુદી-જુદી વધારાની ફી નક્કી કરી છે (વધુ વિગત માટે જુઓ પરિશિષ્ટ-૨). જાહેર માહિતી અધિકારી દ્વારા મોકલવામાં આવેલ નોટિસમાં વધારાની ફીની ગણતરી કેવી રીતે કરવામાં આવી છે તેનો ખુલાસો હોવો જોઈએ.<sup>૩૫</sup> દા.ત. જો તમે મંગેલી માહિતી એ/૪ સાઈઝના ૧૦૦૦ કાગળમાં હોય, અને એ/૪ સાઈઝ કાગળમાં માહિતી આપવાની કિંમત રૂ. ૨/- પ્રતિ કાગળ નક્કી કરી હોય તો, જાહેર માહિતી અધિકારીએ કુલ ખર્ચ ૧૦૦૦૦ રૂ= રૂ. ૨૦૦૦/- એવી રીતે દર્શાવવો પડશે. જાહેર માહિતી અધિકારીને માહિતીને શોધવામાં, બેગી કરવામાં અથવા પ્રક્રિયા કરવા માટે તમારી પાસેથી વધારાની ફી લેવાની સત્તા નથી.

માહિતી તમને મોકલી શકાય તે માટે જાહેર માહિતી અધિકારી અરજીના નિર્ણય અંગેની નોટિસમાં ગણતરી કરેલ ફીની રકમ જમા કરાવવાનું કહેશે. કેટલાંક રાજ્ય, જેમ કે-મહારાષ્ટ્રમાં ટપાલ દ્વારા માહિતી મોકલવાનો ખર્ચ ફીની ગણતરીમાં આવી જાય છે.<sup>૩૬</sup> પરંતુ, જ્યાં તમે રૂબરૂ જઈ માહિતી મેળવી શકો છો, ત્યાં પણ કાયદેસર કોઈવાંધો નથી. ચાદ રાખો કે કોઈપણ દસ્તાવેજની નકલ માંગતા પહેલાં, ફી આપીને તેનું નિરીક્ષણ કરવાનો(દા.ત. કેન્દ્ર સરકારના નિયમ મુજબ એક કલાક નિરીક્ષણાના રૂ. ૫/-<sup>૩૭</sup>) તમને અધિકાર છે. દસ્તાવેજોના નિરીક્ષણથી ખર્ચ ઘટી શકે છે, કારણ કે નિરીક્ષણ સમયે તમે નક્કી કરી શકો છો કે તમને ખરેખર કયા દસ્તાવેજોની જરૂર છે. વધારાની ફી ભરવા માટેના નોટિસ મોકલવા અને વધારાની ફી ભરવા વરચેનો સમય માહિતી આપવાના ૩૦ દિવસની સમય મર્યાદામાંથી બાદ કરવામાં આવે છે.<sup>૩૮</sup>

<sup>૩૧</sup> કલમ ૧૧(૨)

<sup>૩૨</sup> કલમ ૧૧(૩)

<sup>૩૩</sup> કલમ ૭ (૩)

<sup>૩૪</sup> કલમ ૭ (૬)

<sup>૩૫</sup> કલમ ૭ (૩) (અ)

<sup>૩૬</sup> કલમ ૪, મહારાષ્ટ્ર માહિતી અધિકાર નિયમો ૨૦૦૫.

<sup>૩૭</sup> કલમ -૨ કેન્દ્ર માહિતી (ફી અને ખર્ચ માટેના નીતિ-નિયમો) (ઉમેરો) નિયમ ૨૦૦૫

<sup>૩૮</sup> કલમ ૭ (૩) એ

કમનસીબે, અમુક રાજ્ય સરકારોએ વધારાની ફી ખૂબ જ નક્કી કરી છે. જો તમને એવું લાગે કે માહિતી માટે માંગવામાં આવેલ વધારાની ફી ખૂબ વધારે છે તો તમે વિભાગીય અપીલીય સત્તાદિકારીને અપીલ અથવા સંબંધિત માહિતી આયોગને ફરિયાદ કરી શકો છો (વિગત માટે ભાગ-૮ જુઓ). તમે બીપીએલનો પુરાવો આયો હોવા છતાં જો જાહેર માહિતી અધિકારી તમારી પાસેથી માહિતી માટેની ફી લે, તો પણ તમે સંબંધિત માહિતી આયોગને ફરિયાદ મોકલી શકો છો.

## વિશાળ પ્રમાણની માહિતી મેળવવાનો અધિકાર <sup>૪૬</sup>

માહિતીના અધિકાર અધિનિયમાં ખાસ જોગવાઈ છે કે માહિતી તમે જે સ્વરૂપમાં માંગી હોય તેજ રીતે આપવામાં આવે, સિવાય કે એથી જાહેર સત્તામંડળના સંશાધનોનો ખૂબ મોટા પ્રમાણમાં વ્યય ન થતો હોય અથવા તેનાથી રેકૉર્ડને નષ્ટ થવાની શક્તિ હોય<sup>૫૦</sup> કમનસીબે કેટલાક વિભાગો આ જોગવાઈનો ઉપયોગ નાગરિકોને માહિતી પૂરી પાડવાનો ઈન્કાર કરવા કરે છે. આ મુશ્કે કેન્દ્રીય માહિતી આયોગને ફરિયાદ કરવાનો વિષય બન્યો હતો. શ્રી સરબજુત રોચે દિલ્હી વિકાસ સત્તામંડળ(ડીડીએ) દિલ્હીના માસ્ટર પ્લાનમાં થયેલ સુધારા-વધારા સંબંધી માહિતી માટે અરજી કરી. અરજુમાં તેમણે ખાસ કરીને નિગમ ક્રારા માસ્ટર પ્લાન પર પ્રાપ્ત કરેલ લોક પ્રતિભાવોના દસ્તાવેજોની નકલ માંગી હતી. ડીડીએ અનેક આધારો જણાવી માહિતી આપવાની મનાઈ કરી જેમાં એક આધાર હો કે ડીડીએના સંશાધનોનો મોટા પ્રમાણમાં વ્યય થશે. શ્રી રોચ અને ડીડીએને સાંભળ્યા પણી કેન્દ્રીય માહિતી આયોગે જણાવ્યું કે-કાયદા મુજબ માહિતી વિશાળ પ્રમાણમાં હોય તે માહિતી પૂરી ન પાડવાનો આધાર નથી. કેન્દ્ર માહિતી આયોગે દિલ્હી વિકાસ સત્તામંડળને આદેશ આપ્યો કે તે શ્રી રોચને લોક પ્રતિભાવોનું નિરીક્ષણ કરવા દે અને તેમાંથી તેઓ દિલ્હી તે પાનાની પ્રમાણિત નકલ આપે.

## જો જાહેર માહિતી અધિકારી મારી અરજુનો અસ્વીકાર કરે તો શું કરવાનું ?

જાહેર માહિતી અધિકારી તમારી અરજુનો અસ્વીકાર ત્યારે જ કરી શકે છે, જ્યારે તમે માંગેલ માહિતી કાયદામાં માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપેલ યાદીમાં આવતી હોય (વિગતો માટે જુઓ ભાગ-૪) અને જાહેર માહિતી અધિકારી તેઓ નિર્ણય લેકે માહિતી જાહેર કરવા સાથે કોઈ લોકહિત જોડાયેલું નથી. અરજુનો અસ્વીકાર કરવા માહિતી અધિકાર અધિનિયમમાં આ સિવાય બીજું કોઈ કારણ માન્ય નથી. દા.ત. એવા કારણસર માહિતી આપવાની મનાઈ કરી શકાય નહીં કે માહિતી આપવાથી કદાચ સરકાર કે કોઈ અધિકારી મુશ્કેલીમાં મુકાઈ શકે અથવા માહિતી માટે તમે પૂર્તું કારણ આપ્યું નથી. હુએ તમને કાયદેસર માહિતી મેળવવાનો અધિકાર છે - માહિતીની ગોપનીયતા સાબિત કરવાની જવાબદારી સરકારી અધિકારીઓની છે.

<sup>૪૬</sup> કેન્દ્ર માહિતી આયોગ (૨૦૦૬) અપીલ નં.૧૦/૧/૨૦૦૫-કેન્દ્ર માહિતી આયોગ રૂપ ફેબ્રુઆરી [www.cic.gov.in](http://www.cic.gov.in) ૨૦ માર્ચ ૨૦૦૬  
<sup>૫૦</sup> કલમ ૭ (૬)

### મુક્તિ પામેલ માહિતીમાં લોકહિતને પ્રાથમિકતા સિદ્ધાંત લાગુ પડે છે

કાચદાની કલમ ૮ (૨) ની જોગવાઈ મુજબ માહિતીની અરજુમાં જ્યાં માહિતી જાહેર કરવામાં મુક્તિ લાગુ પડતી હોય, ત્યાં પણ સરકારી વિભાગ માહિતી જાહેર કરી શકે છે. જો માહિતી ગોપનીય રાખવા કરતા તેને જાહેર કરવામાં વધારે લોકહિત સામેલ હોય. “લોકહિત” ની વ્યાખ્યા કાચદાનમાં ક્યાંચ કરવામાં આવી નથી અને આ બરાબર પણ છે કેમ કે લોકહિતનો અર્થ સમય-સમયે બદલાતો રહે છે તે તેમજ તે દરેક કેસના સંઝેગો પર પણ આધાર રાખે છે. આ કારણે, જાહેર સત્તામંડળો ખાસ કરીને જાહેર માહિતી અધિકારીઓ, વિભાગીય અપીલીય અધિકારીઓ, માહિતી આયોગોએ પણ દરેક કેસના ગુણ-દોષના આધારે તપાસ કરવાની જરૂર રહેશે. તેઓએ નક્કી કરવું પડશે કે શું મુક્તિ લાગુ પડે છે અને જો હા, તો શું તે બાબતમાં લોકહિત વધારે જરૂરી છે જેમ કે જાહેર જવાબદારીને પ્રોત્સાહિત કરવાની જરૂરીયાત, માનવ અધિકારનું રક્ષણ કરવાની જરૂરીયાત કે પછી એવી હક્કીત જેને જાહેર કરવાથી કોઈ સ્વાસ્થ્ય અને સુરક્ષા પર જોખમ બહાર આવે.

જાહેર માહિતી અધિકારીએ તમને તમારી અરજુનો અસ્વીકાર કરવાના નિર્ણયની લેખિત જાણ ઽંદિવસમાં કરવાની રહેશે.<sup>૫૧</sup> નિર્ણયની નોટિસમાં અસ્વીકારનું કારણ અને

- (ક) નિર્ણય લેતી સમયે માહિતી અધિકારીએ માહિતી જાહેર કરવામાંથી મુક્તિના કયા મુદ્દાનો આધાર લીધો છે તેની વિગત તેમજ નિર્ણય લેતી વખતે જે હકીકતોને દ્યાનમાં રાખી તેની જાણકારી;
- (ખ) નિર્ણય સામે અપીલ કરવાનો સમય ગાળો; અને
- (ગ) અપીલ કરવા માટે અપીલીય અધિકારીનું નામ અને સંપર્કની વિગતો

જો જાહેર માહિતી અધિકારી તમને નિર્ણયની નોટિસ આપવામાં નિષ્ફળ જાય,<sup>૫૨</sup> તો તેને અરજુનો ‘અસ્વીકાર’ માનવામાં આવશે. તે પછી તમે વિભાગીય અપીલીય અધિકારીને અપીલ કરી શકો છો અથવા સંબંધિત માહિતી આયોગને ફરિયાદ મોકલી શકો છો. (વધુ વિગતો માટે જુઓ ભાગ-૮)

### “અંશિક” માહિતી પણ તમને મળી શકે છે<sup>૫૩</sup>


કેટલીક વાર એક જ દસ્તાવેજમાં અમુક માહિતી સંવેદનશીલ હોય અને અમુક માહિતી જાહેર કરી શકાય તેવી હોય છે. આવા કેસમાં, સંવેદનશીલ ન હોય તેવી માહિતી મેળવી શકાય છે. આને ‘અંશિક રીતે જાહેર કરેલ’ કહેવામાં આવે છે. આવા સમયે જાહેર માહિતી અધિકારી સામાન્ય રીતે દસ્તાવેજના અમુક ભાગ-લીટીઓ અથવા ફક્રાઓને-ઢાંકી દે છે, અથવા અરજુ કરનાર સમક્ષ જરૂરી દસ્તાવેજો જ જાહેર કરે છે. જો માહિતી અધિકારી ‘અંશિક રીતે માહિતી જાહેર કરવાનું’ નક્કી કરે તો તેણે તમને જાણ કરવી જોઈએ કે તમે માહિતીમાંથી અંશિક માહિતી જ મળશો, આવો નિર્ણય લેવાનું કારણ, નિર્ણય કોણે લીધો તેની વિગતો, ફી ભરવાની વિગતો અને નિર્ણયને પદકારવાના તમારા અધિકારની માહિતી આપશો. સાથે અપીલીય અધિકારીની વિગત તેમજ સરનામું પણ જણાવશે.

<sup>૫૧</sup> કલમ ૭ (૮)

<sup>૫૨</sup> કલમ ૭ (૨)

<sup>૫૩</sup> કલમ ૧૦.

# ફ્લો ચાર્ટ ૧ : અરજી પ્રક્રિયા



## ભાગ ૮ : જે મને મંગેલ માહિતી ન મળે તો શું કરવું ?

કમનસીબે, ગોપનીયતા હજુ પણ સરકારી વિભાગોમાં સામાન્ય બાબત છે. જાહેર માહિતી અધિકારીઓ એકદમ નજીવા આધારે માહિતીની અરજીનો અસ્વીકાર કરે છે. દા.ત. માહિતી અધિકારીઓ અમુક કેસોમાં અરજીનો અસ્વીકાર એમ કહીને કરે છે કે માહિતી તેમના નિયંત્રણમાં નથી, જો કે આવી અરજુ અન્ય વિભાગમાં તબદીલ કરવાની જવાબદારી તેમની છે. મોટા ભાગે માહિતી જાહેર કરવામાંથી મુક્તિને ખોટી રીતે લાગુ પાડે છે તેમ જ અમુક વખતે જાહેર માહિતી અધિકારી હાજર નથી અથવા ૨૩ પર છે તેવા કારણસર પણ અરજીનો અસ્વીકાર કરે છે.

યોગ્ય અમલ નહીં થાય તેવી ધારણા સાથે માહિતી અધિકાર અધિનિયમમાં અપીલ અને ફરિયાદની પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે, જે જાહેર સત્તામંડળો અને સરકારી અધિકારીઓના નિર્ણય અથવા નબળા પ્રતિભાવ સામે અરજદારને પગલાં લઈ શકવાનો સાંદ્રો અને સરળ રસ્તો છે. અરજદાર વિભાગના ઉપરી અધિકારીને અપીલ કરી શકે છે (જેને અપીલીય અધિકારી તરીકે ઓળખવામાં આવે છે) અને / અથવા રાજ્ય અને કેન્દ્રમાં નવાં નિમાયેલ માહિતી આયોગને સીધી ફરિયાદ કરી શકે છે.

### અપીલ વિસુદ્ધ ફરિયાદ - શું તફાવત છે ?

જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નારાજ થયેલ અરજદાર વિભાગીય અપીલીય અધિકારી સમક્ષ અપીલ કરી શકે છે, જેનો હોલ્ડો જાહેર માહિતી અધિકારી કરતાં વરિષ્ઠ હોય છે અને તે જ વિભાગમાં કામ કરતો હોય છે. અપીલીય અધિકારીએ તમને અને જાહેર માહિતી અધિકારીને સાંભળ્યાં પછી નિર્ણય લેવો પડે છે કે જાહેર માહિતી અધિકારીએ યોગ્ય નિર્ણય લીધો છે કે નહીં. અપીલીય અધિકારીના આદેશથી તમને સંતોષ ન થાય તો તમે માહિતી આયોગમાં બીજી અપીલ કરી શકો છો.

અપીલના વિકલ્પ રૂપે, માહિતી અધિકાર અધિનિયમ હેઠળ, માહિતી મેળવવા સંબંધિત કોઈપણ બાબતને લગતી સીધી ફરિયાદ તમે સંબંધિત માહિતી આયોગને પણ કરી શકો છો. દા.ત. માહિતી સંબંધિત બાબતોમાં સમય મર્યાદામાં માહિતી પૂરી ન પાડવી, ગેરવાજબી ફી લેવી, બીપીએલ વ્યક્તિ પાસેથી ફી માંગવી, તમે મંગેલ દસ્તાવેજનો નાશ કરવો, માહિતી જાહેર કરવા સંબંધિત ખોટાં નિર્ણયો લેવા વગેરેનો સમાવેશ થાય છે. ફરિયાદ સમયે તમારે વિભાગીય અપીલીય અધિકારી પાસે જવાની જરૂર નથી, પરંતુ અગત્યની બાબત એ છે કે તમે તેને ‘ફરિયાદ’ કહો નહીં તો માહિતી આયોગ તમારા પત્રવ્યવહારને અપીલ ગણી તમને પહેલાં વિભાગીય અપીલય અધિકારી પાસે જવાનું કહેશે.

## વિકલ્પ-૧ : અપીલ કરો

અપીલ પ્રક્રિયા કાયદાની કલમ ૧૮ હેઠળ આવે છે અને તે બે ભાગમાં છે-પ્રથમ છે વિભાગીય અપીલીય અધિકારીને અપીલ કરવી અને બીજુ છે - નવા નિયુક્ત થયેલ માહિતી આચોગને અપીલ કરવી. અરજદારની અપીલની પ્રક્રિયાને અદાલતની સરખામણીએ ઝડપી અને સસ્તી પ્રક્રિયા માનવામાં આવે છે.

### પ્રથમ અપીલ, અપીલીય અધિકારીને

દરેક જાહેર સત્તામંડળમાં, અપીલની સુનાવળી કરવા એક અધિકારીની નિમણુક કરવામાં આવી છે, જે હોદ્ધામાં જાહેર માહિતી અધિકારી કરતાં ઉપરી હોય છે. તેને અપીલીય અધિકારી કહેવામાં આવે છે. અરજીના નિર્ણય અથવા અસ્વીકારની નોટિસમાં જાહેર માહિતી અધિકારીએ અપીલીય અધિકારીના સંપર્કને લગતી વિગતો જણાવવાની હોય છે, કારણ કે તેનાથી તમને જાણ થાય કે નિર્ણયની તપાસ માટે તમે આગળ કોણી પાસે જઈ શકો છો. જો નોટિસમાં અધૂરી માહિતી હોય તો તમે તે જાહેર સત્તામંડળની વેબસાઇટ જોઈ શકો છો અથવા જાહેર માહિતી અધિકારીને અપીલીય અધિકારી અંગેની વિગતો પૂછી શકો છો.

તમે અપીલીય સત્તાધિકારીને અપીલ કરી શકો જો :

- અ) તમે લેવાયેલા નિર્ણયથી અસંતુષ્ટ હો
- બ) નક્કી સમયમર્યાદામાં નિર્ણય ન લેવાયો હોય
- ક) અરજી પ્રક્રિયા દરમ્યાન સંપર્ક કરાયેલ તમે ત્રાહિત પક્ષકાર છો અને જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નાખુશ છો.

તમારે જાહેર માહિતી અધિકારીએ આપેલ નિર્ણયના (અથવા જે દિવસે તમને નિર્ણય મળી જવો જોઈતો હતો) ૩૦ દિવસની અંદર અપીલીય અધિકારીને અપીલ મોકલવાની હોય છે. છતાં, જે તમે ૩૦ દિવસમાં અપીલ ન કરી શકો, અને અપીલીય અધિકારીને લાગે કે સમયમર્યાદામાં અપીલ ન કરી શકવાનું કારણ વાજબી છે, તો તે ૩૦ દિવસ પૂર્વાં થઈ ગયાં હોવા છતાંચ તમને અપીલ કરવાની પરવાનગી આપી શકે છે.<sup>૫૪</sup>

તમને સંબંધિત અપીલીય અધિકારીને તમારી અપીલ લેખિતમાં આપવાની રહેશ. કેટલીક રાજ્ય સરકારોએ અપીલ કરવા માટેનું ફોર્મ તૈયાર કર્યું છે. તમારે અપીલીય અધિકારી સમક્ષ જઈ તપાસવું જોઈએ કે તમારી રાજ્ય સરકારે આવું કોઈ ફોર્મ તૈયાર કર્યું છું કે નહિ. તમે અપીલ રૂબરૂ, પોસ્ટ કે કુરિયરથી મોકલી શકો છો. તે સિવાય તમે મદદનીશ જાહેર માહિતી અધિકારીને પણ અપીલ મોકલી શકો છો. તે પછી મદદનીશ જાહેર માહિતી અધિકારીની જવાબદારી છે કે તે સંબંધિત અપીલીય અધિકારીને અપીલ મોકલી આપે.<sup>૫૫</sup>

૫૪ કલમ ૧૮ (૧)

૫૫ કલમ ૫ (૨)

## અપીલ/ફરિયાદમાં ઉમેરવાની જરૂરી માહિતી\*

તમારા રાજ્યમાં અપીલ કરવા માટે કોઈ ચોક્કસ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું હોય કે નહિ, અપીલમાં ઓછામાં ઓછી આ મુજબ માહિતી હોવી જોઈએ :

- (ક) તમારું નામ અને સરનામું, ટેલિફોન નંબર અને ઈ-મેઇલ :
- (ખ) જે જાહેર માહિતી અધિકારના નિર્ણય સામે તમે અપીલ કરી રહ્યા હોવ તેનું નામ અને સરનામું :
- (ગ) જે આંદોશ સામે તમે અપીલ કરી રહ્યા હોવ તેની વિગત (આંદોશ નંબર) :
- (ધ) તમને કોઈ જવાબ નથી મળ્યો તે કારણે અપીલ હોય (માની લેવાયેલો નકાર) તો અરજીની વિગતો, રસીદ ક્રમાંક સાથે, અરજી કરવાની તારીખ અને જાહેર માહિતી અધિકારનું નામ અને સરનામું:
- (ચ) તમારા કેસની ટૂંકમાં વિગતો :
- (ઝ) તમારા છારા માંગવામાં આવેલી રાહત અને રાહત માંગવાના આધારો, દા.ત. તમે માહિતી જાહેર થાય તેવું ઇચ્છો છો કારણ કે કાયદેસર તેના ઉપર કોઈ મુદ્દિત લાગુ પડતી નથી
- (ઝ) તમારા છારા માહિતીની ખરાઈ જેમાં તમે જણાવશો કે “મારી જાણ મુજબ આ અરજીની બધી માહિતી સાચી અને ખરી છે” અને
- (ઝ) તે સિવાય અન્ય માહિતી જે તમને લાગે કે તમારી અપીલનો નિર્ણય કરવામાં ઉપયોગી બનશે.

\* આ અપીલ માટે જરૂરી કેટલીક સામાન્ય બાબતો છે, સીએચઆરાઈનું સૂચન છે કે તમે આ બાબતના અપીલીય અધિકારી કે માહિતી આયોગ પાસેથી જાણો કે અપીલમાં કઈમાહિતી હોવી જરૂરી છે.

માહિતીના અધિકાર અધિનિયમમાં અપીલીય અધિકારી કે માહિતી આયોગને અપીલ કરવા માટે કોઈપણ પ્રકારની ફી લેવાની પરવાનગી નથી. કમનસીબે મહારાષ્ટ્ર<sup>૪૬</sup> અને મદ્યપ્રદેશ<sup>૪૭</sup> જેવા કેટલાક રાજ્યોએ અપીલ ફી અંગેના નિયમો ઘડક્યા છે. અપીલ ફી નક્કી કરવી કે અપીલ ફી ન ભરવાના કારણે અપીલનો અસ્વીકાર કરવો ગેરકાયદેસર છે. જો તમારા રાજ્યમાં અપીલ ફી નક્કી કરાયેલી હોય તો તમે સંબંધિત માહિતી આયોગ અથવા ઉર્ચય ન્યાયાલયને આ બાબત પર વિચારણા કરવા જણાવી શકો છો અથવા આ મુદ્દાની ચર્ચા રાજ્યની વિધાનસભામાં થાય તેવા પ્રયત્નો કરી શકો છો.

સામાન્ય રીતે, તમારી અપીલ મળ્યાના ૩૦ દિવસની અંદર અપીલીય અધિકારીએ નિર્ણય આપવો જોઈએ. આ સમયમર્યાદા વધારી શકાય છે પણ અપીલીય અધિકારી માટે નિર્ણય આપવાની મહિતામ સમય મર્યાદા ૪૫ દિવસની છે. જો નિર્ણયમાં ૩૦ દિવસથી વધુ સમય લેવાયો હોય તો અપીલીય અધિકારીએ સમય વધારવાના કારણોની લેખીતમાં નોંધ રાખવી જોઈએ અને અંતિમ નિર્ણય સમયે તેમને તેના કારણો જણાવવા જોઈશે.<sup>૪૮</sup>

<sup>૪૬</sup> કલમ ૫ મહારાષ્ટ્ર માહિતી અધિકાર નિયમો અનુસાર ૨૦૦૫

<sup>૪૭</sup> કલમ ૭ અને ૮ મદ્યપ્રદેશ માહિતીનો અધિકાર (ફી અને અપીલ) નિયમો ૨૦૦૫

<sup>૪૮</sup> કલમ ૧૮ (૯)

## અપીલીય અધિકારી દ્વારા અપીલની કાર્યવાહી કેવી રીતે કરવામાં આવે છે ?

અપીલનો નિર્ણય લેતી સમયે અપીલીય અધિકારીએ કઈપ્રકિયા મુજબ કાર્યવાહી કરવી તેની કોઈ સ્પષ્ટતા માહિતીના અધિકાર અધિનિયમમાં નથી. છતાંચ સામાન્ય રીતે અપીલ પ્રકિયા વિપરીત અસર ઊભી કરે તેવી નહીં પરંતુ હકીકત શોધવાનો પ્રયત્ન કરતી હોવી જોઈએ તેમાં મુખ્ય એ બાબત જ જોવી જોઈએ કે કાયદાનો અમલ બરાબર થયો છે કે નહીં. દરેક પ્રકારની અપીલમાં, જાહેર માહિતી અધિકારીને સાબિત કરવાનું હોય છે કે અરજી અસ્વીકાર કરવાનું કારણ યોગ્ય છે. તેનો અર્થ એ થયો કે કોઈપણ સુનાવણીમાં જાહેર માહિતી અધિકારીને તેમનો ખુલાસો આપવાનું કહેવામાં આવશે. તમને તમારો પક્ષ રાજવા - એટલે કે જાહેર માહિતી અધિકારના નિર્ણયને ખોટો સાબિત કરવા, ફક્ત ત્યારે જ બોલાવશે જ્યારે જાહેર માહિતી અધિકારી તેમના પક્ષને મજબૂત રીતે રજુ કરી શક્યા હોય. દરેક કેસમાં અપીલીય અધિકારીએ હકીકતના આધારે નક્કી કરવું જોઈએ કે જાહેર માહિતી અધિકારી સાચા હતા કે નહિ. સંબંધિત પક્ષકારમાં તમે, જાહેર માહિતી અધિકારી અને ત્રીજા પક્ષકાર જેને માહિતી જાહેર કરવા માટે પૂછવામાં આવ્યું હોય-તેને નિર્ણય લેવાય તે પહેલા સુનાવણીનો અધિકાર છે.

જો અપીલીય અધિકારી તમારી અપીલનો સ્વીકાર કરે અને નક્કી કરે કે માહિતી તમને મળવી જોઈએ તો તેણે આ નિર્ણયની જાણ તમને અને જાહેર સત્તામંડળને લેખિતમાં કરવી જોઈએ. જો અપીલીય અધિકારી તમારી અરજીનો અસ્વીકાર કરે, તો તેમના નિર્ણયની નોટિસમાં કેન્દ્ર અથવા રાજ્ય માહિતી આયોગને અપીલ કરવાના તમારા અધિકારનો ઉત્સેખ કરેલો હોવો જોઈએ.

નોંધનીય છે કે, માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ જ્યાં માહિતી અધિકારનો અમલ બરાબર થયો નથી તેવું સાબિત થયું હોય તો પણ અપીલીય અધિકારીને જાહેર માહિતી અધિકારીઓને દંડ કરવાની સત્તા નથી. માત્ર માહિતી આયોગને જ દંડ કરવાની સત્તા છે. તેનો અર્થ થયો કે જો અપીલીય અધિકારી તમારા પક્ષમાં નિર્ણય આપે તો, દંડ કરવા માટે તમે કેસ માહિતી આયોગને સૌંપવા દઈછો છો તેવું કહી શકો છો. બીજો વિકલ્પ છે કે માત્ર દંડ બાબતે તમે સીધી માહિતી આયોગને ફરીયાદ કરી શકો છો. (વધુ વિગતો માટે જુઓ પેજ-૩૫)

### બીજુ અપીલ માહિતી આયોગને

જો તમે અપીલીય અધિકારીના નિર્ણયથી નાખુશ કે અસંતુષ્ટ હોવ, તો માહિતીનો અધિકાર અધિનિયમ તમને નવા રચાયેલાં કેન્દ્ર કે રાજ્ય માહિતી આયોગ સમક્ષ બીજુ અપીલ કરવાનો વિકલ્પ પૂરો પાડો છે. અપીલીય અધિકારીના નિર્ણય વિરુદ્ધ માહિતી આયોગને બીજુ અપીલ નિર્ણય લેવાય અથવા નિર્ણય મળ્યાની તારીખથી ૮૦ દિવસની અંદર કરવી જોઈએ. પરંતુ સમય ગાળો પૂરો થઈ ગયા પછી અપીલ સ્વીકારવી કે નહીં તે માહિતી આયોગ નક્કી કરી શકશે.<sup>૫૬</sup>

## માહિતી આચોગો - ખુલ્લાપણાના સમર્થક

માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સ્તરે સ્વતંત્ર અને સ્વાચ્યત માહિતી આચોગની રચના કરવી જરૂરી છે.<sup>૫૦</sup> નવા નિમાયેલા માહિતી કમિશનરોની અદ્યક્ષતામાં કામ કરનાર આ નવા આચોગની રચના બધા રાજ્યોમાં કરવામાં આવી છે. મોટા ભાગના રાજ્યોમાં આચોગની રચના થઈ ગઈ છે, પરંતુ હજુ પણ અમુક રાજ્યો એવાં છે જ્યાં માહિતી આચોગ શરીર થયું નથી (વધુ વિગત માટે જુઓ પરિશિષ્ટ-૪). માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ આચોગ એવાં ઘણાં કાર્યો કરવાના છે જેનાથી લોકોને માહિતી મેળવવા માટે માહિતીનો અધિકાર અધિનિયમ અસરકારક માદ્યમ બની રહે. સામાન્ય રીતે દરેક માહિતી આચોગ નીચે મુજબની બાબતો માટે જવાબદાર રહેશે :

- ફરિયાદો અને અપીલો પર કાર્યવાહી કરવી : અધિનિયમ હેઠળ માહિતી માંગી હોય અને પૂરી પાડવામાં ન આવી હોય તે બધા નાગરિકોને આચોગ સમક્ષ ફરિયાદ અથવા અપીલ કરવાનો અધિકાર છે. નિર્ણય લેતી વખતે, માહિતી આચોગને વિશાળ સત્તાઓ છે- જેમાં મુક્તિ આપવામાં આવેલ માહિતીને લગતા દસ્તાવેજોના નિરીક્ષણ કરવાનો અધિકાર, જાહેર સત્તામંડળો પાસે કાયદાનું પાલન કરાવવાની તેમને વિશાળ સત્તાઓ - જેમાં માહિતી જાહેર કરવાનો આદેશ, જાહેર માહિતી અધિકારીઓની નિમણૂક, રેકર્ડની વ્યવસ્થિત ગોઠવણી, વળતરની જોગવાઈ અને દંડ કરવાનું સામેલ છે.<sup>૫૧</sup>
- અમલીકરણ પર દેખરેખ રાખવી : દરેક વર્ષના અંતે કેન્દ્રીય અને રાજ્ય માહિતી આચોગોએ એક વાર્ષિક રિપોર્ટ તૈયાર કરી સંસદ/રાજ્ય વિધાનસભા સમક્ષ રજૂ કરવાના રહેશે. દરેક રિપોર્ટમાં અરજી અને અપીલની સંખ્યા તેમજ કાયદાના અસરકારક અમલ અને વધારે સારું કરવા માટેના અભિપ્રાયો સામેલ હોવા જોઈશે. આચોગનો રિપોર્ટ તેમના ક્ષેત્રમાં આવતા જાહેર સત્તામંડળોએ રજૂ કરેલ માહિતીના નિરીક્ષણના આધારે તૈયાર થયેલો હશે.<sup>૫૨</sup>
- ખાસ માનવ અધિકારોની દેખરેખ : અમુક જાસૂસી અને સુરક્ષા એજન્સીઓને અધિનિયમ હેઠળ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે, સિવાય કે જ્યાં ભ્રષ્ટાચાર કે માનવ અધિકારોના ઉલ્લંઘનને લગતી અરજીઓ હોય. માહિતી આચોગ માનવ અધિકારોના ઉલ્લંઘનને લગતી તમામ અરજીઓ ઉપર કામ કરવું જોઈશે.

અત્યાર સુધી રચાયેલા આચોગો તેમને આદેશાનુસાર પ્રાપ્ત થયેલ કાર્યો કરી રહ્યા છે. તેમણે એ સુનિશ્ચિત કરવા અગત્યની ભૂમિકા લજવાની છે કે માહિતીના અધિકાર અધિનિયમનો અસરકારક અમલ થાય અને આચોગ અસરકારક કાર્ય કરે તે દ્યાન રાખવા લોકોએ સતર્ક રહેવાની જરૂર છે.

<sup>૫૦</sup> પ્રકરણ ૩ અને ૪

<sup>૫૧</sup> કલમ ૧૮ (૮) અને કલમ ૨૦

<sup>૫૨</sup> કલમ ૪૮

સંબંધિત માહિતી આયોગને તમારે તમારી અપીલ લેખિતમાં મોકલવી જોઈએ. કેન્દ્ર સરકારના વિભાગોને લગતી બાબતો માટેની અપીલ કેન્દ્રીય માહિતી આયોગને અને રાજ્ય સરકારના વિભાગોને લગતી બાબતો માટેની અપીલ સંબંધિત રાજ્ય માહિતી આયોગને કરવી જોઈએ. પંચાયતો વિરુદ્ધ અપીલ રાજ્ય માહિતી આયોગને કરવી જોઈએ.

કેન્દ્ર સરકાર અને અમુક રાજ્ય સરકારોએ અપીલમાં શું સમાવવું જોઈએ તે અંગે નિયમો બહાર પાડ્યા છે. અપીલ સાથે (જુઓ નમૂના અપીલ ફોર્મેટ પાન-૩૦) તમારે કેટલાક સહાયક દસ્તાવેજો જોડવા જોઈએ, જેમ કે- જે આંદેશ / નિર્ણય સામે તમે અપીલ કરી રહ્યા હોય તેની સ્વપ્રમાણિત નકલ અને અન્ય જરૂરી દસ્તાવેજો જે તમારી અપીલને મદદ કરી શકે તેમ હોય.

અપીલની કાર્યપાદી કેન્દ્ર અને રાજ્ય માહિતી આયોગ સંબંધિત અપીલ નિયમોમાં દર્શાવ્યા મુજબ કરે છે. આયોગને લેખિત કે મૌખિક પૂરાવા સોગંદ / સોગંદનામા ઉપર લેવાનો ; દસ્તાવેજ કે નકલોની તપાસ કરવાનો ; જાહેર માહિતી અધિકારી તરફથી જેની વિરુદ્ધ અપીલ થઈ હોય તેનું સોગંદનામું સ્વીકારવું અને તેની સુનાવણી કરવી તેમજ તમારો પક્ષ સંભળવાની સત્તા છે.<sup>૧૩</sup> જો જાહેર માહિતી અધિકારી કે અપીલીય અધિકારીનો નિર્ણય આહિત પક્ષકારને લગતો હોય તો ત્રાહિત પક્ષકારને પણ આયોગ દ્વારા નિર્ણય લેવાય તે પહેલાં સુનાવણીનો અધિકાર છે.<sup>૧૪</sup>

### સાબિતીની જવાબદારી<sup>૧૫</sup>

કોઈપણ અપીલ પ્રક્રિયામાં માહિતી અસ્વીકાર કરવાનું કારણ થોડ્ય છે તે સાબિત કરવાની જવાબદારી જાહેર માહિતી અધિકારી કે ત્રાહિત પક્ષકાર જે માહિતીને ખાનગી રાખવા દર્શાવે તેના ઉપર છે. આનો અર્થ થયો કે જે વ્યક્તિ માહિતી છૂપાવી રાખવા મંગે છે તેની પૂછપરછ થઈ જાય તે પછી તમારે માત્ર માહિતી આયોગ સાથે જ સંપર્ક રાખવાની જરૂર છે, કારણ કે તેમણે આયોગને જણાવવાનું છે કે તેઓ સાચા છે. જો સુનાવણી રાખવામાં આવે, તો જાહેર માહિતી અધિકારી અથવા ત્રાહિત પક્ષકાર જેમને માહિતી ખાનગી રાખવાની જરૂરિયાત લાગતી હોય તેમને તેમની દલીલ રજૂ કરવા પહેલાં બોલાવવા જોઈએ. તમારે તમારી દલીલ ત્યારે જ રજૂ કરવી જોઈએ જો આયોગને લાગે કે જાહેર માહિતી અધિકારી કે ત્રાહિત પક્ષકારનો મુદ્દો અગત્યનો છે. તે સમયે તમારે માહિતી જાહેર કરવા અંગેની દલીલ કરવાની જરૂર પડે છે.

<sup>૧૩</sup> કલમ ૧૮ (૩)

<sup>૧૪</sup> કલમ ૧૯ (૪)

<sup>૧૫</sup> કલમ ૧૯ (૫)

માહિતી આયોગ સમક્ષ થતી અપીલ કાર્યવાહી અદાલતની કાર્યવાહી જેટલી ઔપचારિક હોતી નથી. માહિતી આયોગ સમક્ષ તમારા કેસની રજૂઆત માટે વકીલ રોકવાની જરૂર નથી. અહીં કાર્યવાહી અનૌપચારિક અને વિરોધ વગરની હોય છે. જો કે આયોગને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ દિવાની અદાલત જેવી સત્તા આપવામાં આવી છે.<sup>૫૫</sup> પરંતુ આયોગે અદાલતની જેમ કાર્ય કરવાનું નથી. જો અપીલ કે ફરિયાદ પ્રક્રિયા દરમ્યાન તમને કચ્ચાં રજૂઆત કરવાનું ન ફાવે તો તમે માહિતી આયોગને જાણ કરી શકો છો. તેઓ સુનાવણીમાં તમને મદદરૂપ થઈ શકે. ગમે તેમ તોથ્ય, માહિતી કમિશનર પારદર્શિતામાં માનનાર છે અને કમિશનર તેમજ તેમના કર્મચારી માહિતી જાહેર કરતી દલીલોનું દ્યાન રાખે છે. તેથી તમે વકીલ નથી રોકયો તેના કારણે તમને ઓછી માન્યતા મળે તેવું નથી.

માહિતી અધિકાર અધિનિયમમાં અપીલનો નિર્ણય માહિતી આયોગે કેટલા સમયમાં આપવો તે અંગેની કોઈ સમયમર્યાદા દર્શાવવામાં આવી નથી તેમજ અત્યાર સુધી બહાર પડાયેલા અપીલ નિયમોમાં પણ કચ્ચાં સમયમર્યાદા દર્શાવવામાં આવી નથી. પરંતુ આ બાબતમાં કાર્ય કરવાની સારી રીત એ છે કે માહિતી આયોગે અપીલીય અધિકારીની જેમ રૂપ દિવસમાં નિર્ણય આપી દેવો જોઈએ.

જો માહિતી આયોગને લાગે કે તમારી અપીલ વાજબી છે, તો આયોગે તમને લેખિતમાં નિર્ણય આપવો જોઈએ. આયોગને વિશાળ અને બંધનકર્તા સત્તાઓ છે જેવી કે :

- (અ) જાહેર સત્તામંડળોને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ સોંપવામાં આવેલ જવાબદારીઓ માટે ચોક્કસ પગલાં લેવાનો હુકમ, જેમકે તમે માંગલ માહિતી પૂરી પાડવી અથવા તમારે આપવાની થતી ફી માં ઘટાડો કરાવવો<sup>૫૬</sup>
- (બ) પ્રક્રિયા દરમ્યાન તમને કાંઈ નુકશાન થયું હોય તો તેનું વળતર ચૂકવવાનો આદેશ;<sup>૫૭</sup>
- (ક) અધિનિયમ હેઠળ તેમની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા હોય તેવા જાહેર માહિતી અધિકાર ઉપર દંડ નાંખવો.<sup>૫૮</sup>

જો માહિતી આયોગ નક્કી કરે કે તમારા કેસમાં કોઈ આધાર નથી, તો તે તમારી અપીલનો અસ્વીકાર કરી શકે છે.<sup>૫૯</sup> આવા કેસમાં આયોગે તેના નિર્ણયની નોટિસ તમને અને જાહેર સત્તામંડળને આપવી જોઈએ, જેમાં આગળની અપીલ અંગે જો કોઈ અધિકાર હોય તો તેનો સમાવેશ કરવો જોઈએ.<sup>૬૦</sup> માહિતી અધિકાર અધિનિયમમાં દર્શાવ્યા મુજબ સીધી અદાલતોમાં અપીલ કરવાની મનાઈ છે, છતાં બંધારણ હેઠળ તમને હાઇકોર્ટ કે સુપ્રિમ કોર્ટમાં જવાનો અધિકાર છે, કારણે કે માહિતીના અધિકારને બંધારણીય મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો છે (વધુ વિગતો માટે જુઓ પેજ-૩૭).

<sup>૫૫</sup> કલમ ૧૮ (૩)

<sup>૫૬</sup> કલમ ૧૮ (૮) (એ) (૧) (૨) (૩)

<sup>૫૭</sup> કલમ ૧૮ (૮) (બી)

<sup>૫૮</sup> કલમ ૨૦

<sup>૫૯</sup> કલમ ૧૮ (૮) (સી)

<sup>૬૦</sup> કલમ ૧૮ (૮) (એ)

## વિકલ્પ ૨ : ફરિયાદ કરો

જો તમને જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી સંતોષ ન હોય અથવા તમને લાગે કે જાહેર સત્તામંડળ આ અધિનિયમ હેઠળ માહિતી પૂરી પાડવાની તેમની જવાબદારીમાં નિષ્ફળ ગયું છે, તો અપીલીય અધિકારીને અને તે પછી માહિતી આયોગને અપીલ કરવાને બદલે, તમે અધિનિયમની કલમ ૧૮(૧) હેઠળ સીધી માહિતી આયોગને ફરિયાદ કરી શકો છો. જો તમે ઈચ્છા હો કે જાહેર માહિતી અધિકારીને તાત્કાલિક દંડ થાય અથવા તમને વળતર મળે તો આ જ ચોગ્ય રસ્તો છે. અપીલીય અધિકારીને આ બંનેમાંથી કોઈપણ પગલાં લેવાની સત્તા નથી, પરંતુ માહિતી આયોગ કરી શકે છે. સીધા માહિતી આયોગ પાસે જઈને તમે અપીલીય અધિકારીને બાયપાસ કરી શકો છો, છતાંચ માહિતી આયોગ માટે નિર્ણય આપવાની કોઈ સમય મર્યાદા નક્કી નથી, તે આ પ્રક્રિયાની ખામી છે. અપીલીય અધિકારીએ તેમનો નિર્ણય વધારેમાં વધારે જ્ય દિવસમાં આપવાનો હોય છે. તમારા કેસમાં કઈ પ્રક્રિયા ચોગ્ય છે તે તમારે ખૂબ કાળજીપૂર્વક નક્કી કરવાનું છે.

માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવામાં તમને કોઈ મુશ્કેલી ઊભી થાય તો તમે ફરિયાદ <sup>૭૨</sup> કરી શકો છો; ઉદાહરણ તરીકે :

- (ક) તમે અરજી કરી શક્યા નહીં, કારણ કે તે વિભાગમાં જાહેર માહિતી અધિકારીની નિમણૂક થઈ નહોતી, અથવા મદદનીશ જાહેર માહિતી અધિકારીએ તમારી અરજીનો અરસ્વીકાર કર્યો;
- (ખ) તમે માગેલ કોઈપણ માહિતી આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો;
- (ગ) તમે માગેલ માહિતીનો નક્કી સમય મર્યાદામાં કોઈ જવાબ આપવામાં ન આવ્યો અથવા માહિતી પૂરી પાડવામાં ન આવી;
- (ધ) તમને જે ફી ભરવાનું કહેવામાં આવ્યું તે તમને ગેરવાજબી લાગી;
- (ચ) તમને લાગ્યું કે જે માહિતી આપવામાં આવી તે અધૂરી, ગેરમાર્ગ દોરતી કે ખોટી છે;
- (ઇ) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવામાં આ સિવાય તમને અન્ય કોઈ મુશ્કેલી આવી હોય.

આ છેલ્લી જોગવાઈને દરાદાપૂર્વક વધારે વિશાળ રાખવામાં આવી છે જેનાથી અસરકારક રીતે માહિતી મેળવવામાં તમને કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે તો તમે માહિતી આયોગને ફરિયાદ કરી શકો છો. જેમાં-ર્યેચિષ્ટક જાહેર કરવાની માહિતીમાં જાહેર સત્તામંડળની નિષ્ફળતા, જાહેર માહિતી અધિકારીઓની નિમણૂક, અધિકારીઓની જરૂરી તાલીમ ગોઠવવી અથવા અધિનિયમ હેઠળ જરૂરી માર્ગદર્શિકા તૈયાર થવામાં નિષ્ફળતા વગેરેનો સમાવેશ થાય છે.

---

<sup>૭૨</sup> કલમ ૧૮ (૧)

માહિતી આયોગને અપીલ કે ફરિયાદની સુનાવણી કરવા, તપાસ અને નિર્ણય માટે એક સરળી સત્તા છે (માહિતી આયોગને અપીલ કરવા સંબંધી વધારે વિગત માટે જુઓ- પાન ૩૧-૩૪). ટૂંકમાં, માહિતી આયોગને તપાસ કરવા સંબંધી વિશાળ સત્તા છે, કારણ કે તેમને દિવાની અદાલતને હોય તે બધી સત્તા છે.<sup>૭૩</sup> માહિતી આયોગ દ્વારા અપીલના નિકાલ માટેની સમયમર્યાદા અત્યારે માહિતી અધિકાર અધિનિયમમાં દર્શાવિલ નથી. ફરિયાદની તપાસ પછી, જો માહિતી આયોગને તમારી ફરિયાદ વાજબી લાગે તો, જાહેર સત્તામંડળ અથવા સંબંધિત અધિકારી પાસે માહિતી અધિકારનું પાલન કરાવવાની તેમને વિશાળ અને બંધનકર્તા સત્તા છે. જેમકે- તમે માંગેલ માહિતી પૂરી પાડવાનો આદેશ કરવો, અરજી સ્વીકારવી અને તેના ઉપર આગળની કાર્યવાહી કરવા જાહેર માહિતી અધિકારીની નિમણૂક કરાવવી અથવા માહિતી રૈએચ્યાન્ડ રીતે જાહેર કરવા આદેશ આપી શકે છે. માહિતી આયોગ માહિતી ન મળવાના કારણે તેમને કાંઈ નુકસાન થયું હોય તો જાહેર સત્તામંડળને તેનું વળતર ચૂકવવાનો આદેશ કરી શકે છે. તેઓ અધિનિયમનું પાલન ન કરનાર અધિકારી ઉપર દંડપણ નાખી શકે છે. <sup>૭૪</sup> તેવી જ રીતે, જો માહિતી આયોગને એવું લાગે કે તમારી ફરિયાદ વાજબી નથી, તો તે તમારી અરજી નકારી શકે છે. આવા સમયે, તમે રાજ્યની ઉર્ચય અદાલત કે દેશની સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકો છો.

### માહિતી આયોગને દંડ કરવાની સત્તા છે

માત્ર માહિતી આયોગને-અપીલીય અધિકારીઓને નહીં- શિસ્તબંગના પગલાં <sup>૭૫</sup> અને નાણાકીય દંડ <sup>૭૬</sup> દિવસ મુજબ રૂ.૨૫૦ થી વધારેમાં વધારે રૂ.૨૫,૦૦૦ સુધી નાખવાની સત્તા એવા અધિકારીઓ ઉપર છે જેમણે :

- અરજી સ્વીકારવાનો દંડકાર કર્યો હોય;
- અધિનિયમમાં દર્શાવિલ સમયમર્યાદામાં માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ ગયા હોય;
- માહિતી માટેની વિનંતીનો ખોટી રીતે અસ્વીકાર કર્યો હોય;
- જાણી જોઈને, ખોટી, અધૂરી કે ગેરમાર્ગ દોરતી માહિતી આપી હોય; અથવા
- માહિતી આપવામાં કોઈપણ રીતે મુશ્કેલી ઊભી કરી હોય.

દંડ કરતા પહેલાં, અધિકારીને તેની રજૂઆત કરવાની તક આપવી જોઈએ. અધિકારીએ માહિતી આયોગ સમક્ષ સાબિત કરયું જોઈએ કે તેણે માહિતી પૂરી પાડવા વાજબી અને યોગ્ય મહેનત કરી છે.

### વિકલ્પ-૩ : અદાલતમાં અપીલ કરો

તમારી સામે જયારે એવી પરિસ્થિતિ આવે, જ્યાં તમારી અપીલ અથવા ફરિયાદ માટે માહિતી આયોગ આપેલ નિર્ણયથી સંતુષ્ટ ન હો, તો તમે રાજ્યની ઉર્ચય અદાલત અથવા સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી

<sup>૭૩</sup> કલમ ૧૮ (૩)

<sup>૭૪</sup> કલમ ૧૮ (૮) અને કલમ ૨૦

<sup>૭૫</sup> કલમ ૨૦ (૨)


<sup>૭૬</sup> કલમ ૨૦ (૧)

શકો છો. માહિતીના અધિકાર અધિનિયમ<sup>૭૭</sup> હેઠળ દાવો, અરજી કે અન્ય કોઈ પ્રક્રિયા માટે ચોક્કસ રીતે અદાલતોને દૂર રાખવામાં આવી છે. જો કે, એ ચાદ રાખવું જોઈએ કે માહિતીના અધિકાર અધિનિયમને મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો છે તેથી બંધારણ અનુસાર ઉર્ચ અદાલતને (અનુચ્છેદ ૨૨૪) અને સર્વોચ્ચ અદાલતને (અનુચ્છેદ ૩૨ હેઠળ) નાગરિકોના મૂળભૂત અધિકારને લગતી કોઈપણ બાબતને તપાસવાનો અધિકાર છે. તેથી નિયમ અનુસાર, જે પણ કેસમાં તમે માહિતી આયોગના નિર્ણયથી સંતુષ્ટ ન હો તો, તમને ઉર્ચ અદાલત અને સર્વોચ્ચ અદાલત પાસે જવાનો અધિકાર છે.

---

<sup>૭૭</sup> કલમ ૨૩

## ફ્લો ચાર્ટ-૨ : અપીલ પ્રક્રિયા



# ભાગ-૬ : માહિતીના અધિકારને આગળ વધારવામાં હું કેવી રીતે મદદરૂપ થઈ શકું ?

માહિતીનો અધિકાર અધિનિયમ માહિતી મેળવવા માટે કાયદાકીય માળખું પૂરું પાડે છે, પરંતુ કાયદાની ખરી સફળતા તમારા હથમાં એ રીતે છે કે તેનો સુશાસનના માદ્યમ તરીકે ઉપયોગ કરો. નાગરિકોની મૂળભૂત ફરજ છે કે તેઓ માહિતીનો અધિકાર અધિનિયમનો ઉપયોગ કરે અને દચ્ચાન રાખે કે જાહેર સત્તામંડળો આખા દેશમાં તેમની જવાબદારીઓ અને ફરજો પૂરી કરી રહ્યાં છે કે નહીં, જે માહિતી મેળવવાના વિસ્તાર અને નાગરિક તરફી અભિગમને વિકસિત કરશે. તમારી મદદરૂપ માહિતીનો અધિકાર શક્તિશાળી અને જીવંત અધિકાર બની શકે છે.

## માહિતી માટે અરજી કરવી

માહિતીનો અધિકાર અધિનિયમ બ્લષ્ટાચારને રોકવા અને સરકારી કાર્યમાં સુધારાનું અસરકારક માદ્યમ બની રહે તે દચ્ચાનમાં રાખવું જોઈએ, લોકોએ સરકાર પાસેથી માહિતી માંગવામાં તેનો ઉપયોગ કરવો જોઈએ. લોકજવાબદાર સરકાર બનાવવા માટેનો આ એક અસરકારક રસ્તો છે.

વ્યક્તિગત અને નાગરિક સમાજ જીથોએ બ્લષ્ટાચાર અને સરકારની ગેરીતિઓને બહાર પાડવા માહિતીના અધિકાર અધિનિયમનો ઉપયોગ શરૂ કરી દીધો છે, એ સુનિશ્ચિત કરવા કે સરકારી યોજનાઓ અને આયોજનનો અમલ બરાબર રીતે થઈ રહ્યો છે કે નહિ, સરકાર પાસેથી જવાબ માગવો અને પૂછવું કે આખા દેશ માટે કેવી રીતે નીતિઓ ઘડવામાં આવી અને તેનો અમલ કેવી રીતે થયો.

## સરકારની દેખરેખ રાખવી

જરૂરી માહિતીની અરજી કરવી અને મેળવવી તે માત્ર પ્રથમ પગથિયું છે. તમને મળેલી માહિતીનો ઉપયોગ તમે કેવી રીતે કરશો તે વધારે અગત્યાનું છે. ઉદાહરણ તરીકે, તમે મેળવેલ માહિતી ગેરીતિ, બ્લષ્ટાચાર અથવા ગેર વહીવટનો પૂરાવો છે, તો એ જરૂરી છે આ બાબત તમે માહિતી આયોગ, પોલીસ, અદાલત અથવા બ્લષ્ટાચાર નાબૂદી એજન્સીના ઉર્ચ અધિકારીઓ અને લોકોના દચ્ચાનમાં લાવો. જો કે માહિતીના અધિકારની દેખરેખ પણ આ રીતે જ કરવાની જરૂર છે. તમે આ કાયદાના અમલીકરણની દેખરેખ એ રીતે પણ રાખી શકો કે શું જાહેરસત્તામંડળોમાં અધિકારીઓ કાયદાનું પાલન કરવા પ્રયત્ન કરે છે અને શું સરકાર માહિતીનું પ્રકાશન કરવા, જાહેર માહિતી અધિકારીઓની નિમણુંક કરવા અને માહિતી સુધી પહોંચ ઉપલબ્ધ કરાવવાની તેમની જવાબદારી પૂરી કરી રહ્યા છે કે નહીં. તમારા અનુભવોના આધારે સરકાર સાથે તેના અમલીકરણમાં સુધારા લાવવા દેખરેખ અને ચર્ચા-વિચારણા કરી શકો છો.

## અધિનિયમનો ઉપયોગ : માહિતી અધિકાર અધિનિયમના કાર્યકર્તાએ સરકારમાં ચાલતા બષ્ટાચારને ખુલ્લો પાડ્યો ૭૮

જાન્યુઆરી ૨૦૦૪થી, મદ્ય પ્રેટેશ સરકાર પાંચ જિલ્લામાં ઈન્ડસ બાળ મજૂરી પ્રોજેક્ટ ચલાવી રહી છે, જે આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા (ILO) દ્વારા ફંડ કરવામાં આવે છે. ઈન્ડસ પ્રોજેક્ટનો હેતુ બાળ મજૂરોને પ્રાથમિક શિક્ષણ પૂરો પાડવાનો છે. તેનો અમલ રાષ્ટ્રીય બાળ મજૂર પ્રોજેક્ટ (NCLP) નામની રજિસ્ટર્ડ સંસ્થા દ્વારા થાય છે. તે રાજ્ય સરકારની મદ્યસ્થિથી આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા પાસેથી નાણાં મેળવી ખર્ચ કરે છે. જિલ્લા કલેક્ટર રાષ્ટ્રીય બાળમજૂર પ્રોજેક્ટના પ્રમુખ છે અને જિલ્લા મજૂર અધિકારી મંત્રી છે. વધારામાં ચાલી રહેલ પ્રોજેક્ટની દેખરેખ રાખવા પાંચ પ્રોજેક્ટ ડાયરેક્ટરની નિમણૂફ કરવામાં આવી છે. ખૂબ મોટું નાણાંકિય ભંડોળ આ પ્રોજેક્ટમાં રોકાયેલું છે- માત્ર કટની જિલ્લામાં જ ઈન્ડસ પ્રોજેક્ટના અમલ માટે રૂ. ૩૧,૮૦,૭૫૦ ફાળવવામાં આવેલા છે.

શરૂઆતથી જ, આ યોજના બષ્ટાચારની અફવાઓથી ઘેરાયેલી રહી છે. ડિસેમ્બર ૨૦૦૫માં, એક માહિતી અધિકારના સંક્રિયા કાર્યકરે ઈન્ડસ પ્રોજેક્ટના જાહેર માહિતી અધિકારીને એક અરજી આપી, જેમાં તેમણે કટનીમાં ઈન્ડસ પ્રોજેક્ટ હેઠળ ચાલતા શિક્ષણ કેન્દ્રોમાં ફાળવવામાં આવેલ પ્રાથમિક સારવાર આપવામાં આવેલ કિટની સંખ્યા : શું ભાવે કિટ ખરીદવામાં આવી હતી ; કિટમાં કઈ સામગ્રી રાખવામાં આવી છે અને પ્રોજેક્ટ હેઠળ આપમેળે જાહેર કરેલ માહિતીની વિગત મંગી.

જાહેર માહિતી અધિકારીએ તેના જવાબમાં કહ્યું કે-તૃ.૩૫૦૦ના ભાવે ૪૦ પ્રાથમિક સારવારની કિટ ખરીદવામાં આવી છે. આવી જ પ્રાથમિક સારવારની કિટ બનાવતી કંપનીઓના બજારભાવ સ્થાનિક વિતરકો પાસેથી જાણતાં, અરજદારને રૂ.૭૫૦થી વધારેમાં વધારે રૂ.૮૭૦નો ભાવ જાણવા મળ્યો. અરજદારને લાગ્યું કે પ્રોજેક્ટમાં કિટ જે ભાવે ખરીદવામાં આવી છે તેની કિંમત બજાર ભાવ કરતાં ધારી વધારે છે. અમલીકરણ એજન્સીએ રૂ.૩૫૦૦ના ભાવે ૪૦ કિટ ખરીદવાના રૂ.૧,૪૦,૦૦૦ ચૂકવ્યા હતા. જો એજન્સીએ બજારમાંથી સૌથી મૌંધા વિતરક પાસેથી રૂ.૮૭૦માં કિટ ખરીદી હોત, તો પણ તેમાં રૂ.૩૮,૮૦૦ ખર્ચ થયો હોત.

આ માહિતીથી સજ્જ થઈ કાર્યકર ૧૦ શિક્ષણ કેન્દ્રમાં કિટની તપાસ માટે ગયો, જેમાં તેમણે જોયું કે એક પણ કીટ પર કોઈ કંપનીનો લોગો ન હતો. ત્રણ કેન્દ્રોમાં કિટ એકદમ ખાલી હતી અને બાકીનાં સાત કેન્દ્રોમાં જે સામગ્રી હતી તે દર્શાવિલ ગુણવત્તા કરતાં એકદમ નીચી ગુણવત્તાની હતી. આ કૌભાંડને સ્થાનિક છાપામાં દર્શાવવામાં આવ્યું. પરંતુ અત્યાર સુધી જિલ્લા વહીવાતીતંત્રએ કોઈ પગલાં લીધા નથી. કાર્યકર હવે તેમણે મેળવેલી માહિતીના આધારે આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા અને મદ્યપ્રેટેશ સતર્કતા સત્તામંડળને ફરિયાદ મોકલવાનું આયોજન કરી રહ્યો છે.

<sup>૭૮</sup> મદ્યપ્રેટેશ સૂચના અધિકાર અભિયાન (૨૦૦૭)

## બીજાઓને શિક્ષણ અને માર્ગદર્શન આપવું

આજે, આખા દેશમાં, અમુક જ લોકો જાત્રત છે કે એક સશક્ત કાયદો અમલમાં આવ્યો છે અને તેઓ તેનો ઉપયોગ કરી શકે છે. રાજ્ય સરકારની જવાબદારી છે કે તેઓ માહિતીના અધિકાર અધિનિયમ વિશે લોકોમાં શિક્ષણ અને જાગૃતિ ફેલાવે, પરંતુ તેઓ ખૂબ ઓછા પ્રયત્ન કરે છે. માહિતીના અધિકારનો સંદેશ આખા દેશમાં દૂર-દૂર સુધી અનેક ભાષાઓમાં અને શક્ય તેટાં માદ્યમોથી ફેલાય તે જોવાની દરેક નાગરિકની ફરજ છે. જો તમે માહિતીના અધિકારનો ઉપયોગ કર્યો હોય અને તમારો પ્રયત્ન સફળ રહ્યો હોય કે નિષ્ફળ-તમારે તમારો અનુભવ લોકોના દ્યાનમાં લાવવો જોઈએ. તે માટે -તમારે છાપામાં લેખ લખવો, ઇન્ટરનેટ પર પ્રકાશિત કરાવવું અથવા તમારા મિત્રો કે સાથી કાર્યકર્તાઓને તમારો અનુભવ કહેવો જોઈએ. આવી રીતે તમે લોકોને માહિતીની અરજી કરતી વખતે શું પૂછ્યું, ડેવી રીતે લખવું અને કોને આપવું વગેરે સમજ પૂરી પાડવા મદદરૂપ થઈ શાખો છો. માહિતીના અધિકાર અધિનિયમને ઉપયોગ કરવાનો તમારો અનુભવ બીજાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની શકે છે અને આ અનુભવ બીજા સુધી પહોંચાડવો ખૂબ જરૂરી છે કારણે આવી રીતે માહિતીનો અધિકાર અધિનિયમ લોકોના દિલ અને દિમાગમાં અંકાઈ જશે.

### જુઓ, મુંબઈની જેલમાં શું થઈ રહ્યું છે <sup>૭૯</sup>

મહારાષ્ટ્રમાં નિયમિત રીતે મીડિયામાં ખબર આવતી રહે છે કે મુંબઈની આર્થર રોડ જેલમાં, કેદીઓ પાસેથી જબરદસ્તીથી પૈસા પડાવી, ગેરકાનૂંજી અને સંભવિત ભયજનક કામો માટે મોબાઇલ ફોનના ઉપયોગની પરવાનગી અપાય છે. ઓક્ટોબર ૨૦૦૧માં, મોબાઇલ ફોનના ઉપયોગને અટકાવવા માટે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝને જેલમાં ઝા.૯,૦૧,૭૩૯ની જામર લગાડવાનો પ્રસ્તાવ મૂક્યો. ચાર વર્ષ સુધી, આ પ્રસ્તાવ ઉપર કોઈ પગલાં લેવાયા નથી અને મોબાઇલ ફોનનો ઉપયોગ ચાલુ રહ્યો.

૨૦ ડિસેમ્બર ૨૦૦૫ના શેલેશ ગાંધીએ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ એક અરજી કરી. જેમાં તેમણે પૂછ્યું કે આ બાબતની કાર્યવાહીના કાગળો કયા અધિકારીઓ પાસે છે અને તેમાં શું પ્રગતિ થઈ છે. તેમની અરજીના ૯ ટિંગસમાં જ ૨૯ ડિસેમ્બર ૨૦૦૬ના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝને જામર લગાવવાનું કહેતો આંદોશ આપવામાં આવ્યો. ૧૦ જાન્યુઆરી ૨૦૦૭ના શેલેશ ગાંધીની અરજીના એક મહિનાથી પણ ઓછા સમયમાં જ લાખના ખર્ચે જામર લગાવવામાં આવ્યું.

છેલ્લાં ચાર વર્ષમાં સરકાર જે નહોતી કરી શકી, અથવા કરવા નહોતી દર્શાતી તે હવે માહિતીના અધિકારે થોડા દિવસોમાં કરી બતાવ્યું. સરકાર અને તેમનાં નબળા પ્રદર્શનની દેખરેખ માહિતીના અધિકાર અધિનિયમથી અસરકારક રીતે રાખી રાખાય છે અને આ રીતે અધિકારીઓને જરૂરી પગલાં લેવા જવાબદાર બનાવી શકાય છે.

૭૯ શેલેશ ગાંધી (૨૦૦૬)

## ઇન્ડિયન એક્સપ્રેસ રોજગાર બાંહેદરી યોજના કૌભાંડને ખુલ્લું પાડે છે<sup>૧૦</sup>

મહારાષ્ટ્ર રાજ્યના થાળે જિલ્લામાં અમુક સહૃદી ગરીબ અને અવિકસિત તાલુકાઓ છે. જવાહર અને મોખાડા તાલુકાઓમાં, હપ ટકા જેટલા પરિવારો ગરીબી રેખા નીચે જીવે છે. મહારાષ્ટ્ર રોજગાર બાંહેદરી યોજના આવા વિસ્તારમાં રહેતા લોકોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવી છે. તાજેતરમાં જ આ યોજનાનો અમલ કેવી રીતે થઈ રહ્યો છે તે જાણવા માહિતીના અધિકાર અધિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ બાબત સામે આવી કે આખી પ્રણાલી ભ્રષ્ટાચારથી ભરાયેલી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ થાળેના જાહેર કામો વિભાગ (પી.ડબલ્યુ.ડી.) પાસે મસ્ટરરોલની નકલો માંગી. ઇન્ડિયન એક્સપ્રેસને ખાસ રૂસ જિલ્લામાં થયેલ બોપદારી-ચાંદોશીને જોડતા રોડને લાગતા મસ્ટરરોલ વિશેની વિગતો મેળવવામાં હતો. આ રોડ મહારાષ્ટ્ર રોજગારી બાંહેદરી અધિનિયમ હેઠળ એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે તે આ વિસ્તારના સૌથી ગરીબ લોકો માટે જીવનરેખાનું કામ કરે. મસ્ટર રોલ મુજબ ગંગા ઘાટલ નામના એક ગ્રામવાસીને બોપદારીનો માર્જ ખોદવા બદલ ૧૧ દિવસના રૂ.૮૮૯ ચૂકવવામાં આવ્યા હતા. જેને મસ્ટરલ રોલ પર તેના અંગુઠાથી પ્રમાણિત પણ કરવામાં આવ્યું હતું. મસ્ટર રોલમાંથી મેળવેલ માહિતી સાથે, ઇન્ડીયન એક્સપ્રેસ બોપદારી ગામ ગયા અને ત્યાંથી તેમને જાણવા મળ્યું કે-ગંગા ઘાટલે ૨૦૦૪માં આત્મહત્યા કરી છે અને તેણે અથવા તેના પરિવારને અત્યાર સુધી કોઈ રૂપિયા મળ્યા નથી. ગંગા ઘાટલ એવા અનેક મૃત લોકોમાંથી એક હતો જેને રોજગારી બાંહેદરી યોજના હેઠળ પેસા લેતો બતાવવામાં આવ્યો હતો. મસ્ટર રોલમાં આવી અનેક ખોટી માહિતી હતી તેમજ સરકારી અધિકારોને લાભાર્થી તરીકે દશવિલા હતા. આ પુરાવાથી, રાજ્યના રોજગારી બાંહેદરી યોજનાના મંત્રીને આ બાબતની તપાસ કરવા દબાણ થયું.

## માહિતી અધિકાર અધિનિયમની ચળવળમાં જોડાવવું

આખા દેશમાં, અનેક સક્રિય કાર્યકરો અને નાગરિક સમાજ જૂથો માહિતીના અધિકારને આગળ વધારવા માટે કાર્ય કરી રહ્યાં છે. આ જૂથો આખા દેશના પુરુષો, સ્ત્રીઓ અને વંચિત સમુદ્દરોના લોકો માટે માહિતીનો અધિકાર અસરકારક બને તે માટે વિવિધ રસ્તાઓ શોધી રહ્યાં છે. તેનાથી નોંધનીય પરિણામો અને સફળ વાતાવરો પણ તૈયાર થઈ રહ્યી છે. તે સિવાય, અનેક ઓનલાઈન ચર્ચા જૂથો અને સ્થાનિક સમૂહો છે જે અરજીઓ અને માહિતીના અધિકાર અધિનિયમના અમલીકરણ અંગે દેખરેખ રાખી રહ્યા છે. તમે કદાચ આવા કોઈ જૂથમાં અને / અથવા તમારા રાજ્યમાં માહિતીના અધિકાર પર કામ કરતી કોઈ સંસ્થામાં જોડાઈ શકો છો (માહિતીના અધિકાર અધિનિયમ ઉપર કામ કરતા કેટલાક જૂથોની વધારે વિગત માટે જુઓ- પરિશિષ્ટ ૫)

## માહિતી અધિકાર અધિનિયમના પ્રચાર અભિયાનમાં જોડાવવું

સમગ્ર દેશમાં માહિતીના અધિકાર અધિનિયમનો યોગ્ય રીતે અમલ થાય તે માટે સરકાર ઉપર દબાળ કરવા અને તેમાં મેળવેલ ઉપલબ્ધાઓની આપ-લે કરવા અનેક જીથો એક બીજાનાં જોડાણથી કાર્ય કરી રહેલ છે. ઉદાહરણ તરીકે -નેશનલ કેમ્પઈન ફોર પીપલ્સ રાઇટ ટુ ઇન્ડોમેશનની રચના ૧૮૮૫માં રાખ્ટીય સ્તરે માહિતીના અધિકાર માટે વકાલત કરવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી. તેઓએ માહિતીના અધિકારના અમલ માટે રજૂઆતો કરી અને હવે તેના યોગ્ય અમલીકરણમાં દ્વારા આપી રહ્યા છે. તે સ્વિવાય દેશમાં એવાં અનેક જીથો છે જેઓ ઓનલાઈન ચર્ચાઓ કરે છે અને તેમના અનુભવોની આપ-લે કરે છે. ઉદાહરણ તરીકે, દેશભરના માહિતીના અધિકાર સમર્થકોએ ‘હમ જાનેંગે’ નામથી એક વેબ આધારિત ચર્ચા જુથની રચના કરી છે, જે અનુભવોની આપલે, મુશ્કેલીઓની ચર્ચા અને કાયદાના ઉપયોગમાં પડતી મુશ્કેલીઓના ઉકેલ માટે વિશે વિચારણા અને માહિતીના અધિકારને આગળ લઈ જવા માટે પ્રવૃત્તિઓનું સંકલન કરે છે. તેવી જ રીતે કણ્ણાટકમાં, પેરવી કરનારાઓએ ‘ફિચાક્ટે’ નામનું ચર્ચા જુથ તૈયાર કર્યું છે. આવી ઓનલાઈન ચર્ચા જુથોમાં જુદા-જુદા અનુભવો અને જગ્યાઓના લોકોને લેગા કરી સંકલિત ચળવળ ચલાવવી એક અસરકારક રસ્તો છે.

## પરિશાષ્ટ - ૧

### માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫

અનુકૂળ ફોર્મ

પ્રકરણ ૧  
માર્ગબિક

કલાન

૧. ટૂંકી સંશોધન, વાર્તા અને આરોગ્ય.
૨. વ્યાખ્યા.

પ્રકરણ ૨  
માહિતીનો અધિકાર અને જાહેર સત્તાંદળોની જવાબદારીઓ

૩. માહિતીનો અધિકાર.
૪. જાહેર સત્તાંદળોની જવાબદારીઓ.
૫. જાહેર માહિતી અધિકારીનોને મુકરૂર કરવા બાબત.
૬. માહિતી મેળવવા માટે વિનંતી કરવા બાબત.
૭. વિનંતીનો નિકાલ.
૮. માહિતી જાહેર કરવામાંથી સુધીત.
૯. અનુક ડિસ્ટ્રિક્શનર માહિતી આપવાનો અસ્વીકાર કરવા માટેના આવાગો બાબત.
૧૦. વિભાગીયતા.
૧૧. ગાહિત પદ્ધતિને લગતી માહિતી.

પ્રકરણ ૩  
કેન્દ્રીય માહિતી પંચ

૧૨. કેન્દ્રીય માહિતી પંચની રચના.
૧૩. હોદાની મુદ્દત અને સેવાની શરતો.
૧૪. મુખ્ય માહિતી કમિશનર અથવા માહિતી કમિશનરને હોદા ઉપરથી દૂર કરવા બાબત.
૧૫. રાજ્ય માહિતી પંચની રચના..
૧૬. હોદાની મુદ્દત અને સેવાની શરતો.
૧૭. રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અથવા રાજ્ય માહિતી કમિશનરને હોદા ઉપરથી દૂર કરવા બાબત.

પ્રકરણ ૫  
માહિતી પંચની સત્તા અને કાર્યો, અપીલ અને દંડ.

૧૮. માહિતી પંચ ની સત્તા અને કાર્યો.

૧૯. અપીલ.

૨૦. દંડ.

પ્રકરણ ૬

પ્રક્રિયા

૨૧. શુષ્ઠ બૃંઘથી લીધેલા પગલાને રક્ષણ.

૨૨. આવિનિયમની ઉપરથિત અસર.

૨૩. ન્યાયાવયની હકૂમતને ભાગ્ય.

૨૪. અમૃત સંગઠનોને આવિનિયમ લાગુ ન પડવા બાબત.

૨૫. દેખરેખ રાખવા અને આહેવાલ આપવા બાબત.

૨૬. સમુચિત સરકારે તૈયાર કરવાના કાર્યક્રમો.

૨૭. નિયમો કરવાની સમુચિત સરકારની સત્તા.

૨૮. નિયમો કરવાની સહકાર સત્તાપિકારીની સત્તા.

૨૯. નિયમો મુજબ બાબત.

૩૦. મુશ્કેલીઓ દ્વારા કરવાની સત્તા.

૩૧. રદ કરવા બાબત.

પહેલી અનુસૂચિ

બીજી અનુસૂચિ

## માહિતીનો અધિકાર અધિનિયમ ૨૦૦૫

( સન ૨૦૦૫નો અધિનિયમ ક્રમાંક.૨૨)

[૧૫મી જૂન, ૨૦૦૫]

પ્રત્યેક આહેર સત્તામંડળના કર્મકાજમાં પારદર્શિતા અને જગ્યાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી આહેર સત્તામંડળના નિયમગ્રાહી ડેક્ષના માહિતી નાગરિકો મેળવી શકે તેવા માહિતીના અધિકારના વાવલાદુ સંપત્તનની રથના કરવા, કેન્દ્રીય માહિતી પંચ અને દાખલ માહિતી પંચોન્હા રથના અને તેની સાથે શંકુણાવેલી અથવા નેને આનુષેધિત બાબતો માટેની જોગવાઈ કરવા, બાબતનો અધિનિયમ.

આરતાના સંવિધાનો લોકશાહી ગણરાજ્યની સ્થાપના કરેલ છે;

અને લોકશાહીની જરૂર આવશ્યક કામગીરી માટે નાગરિકોને માહિતગાર રાજ્યા અને માહિતીની પારદર્શિતા જરૂરાય તે જરૂરી છે અને ભાષ્યાચારને નિયમગ્રાહી રાજ્યા અને સરકારો અને તેના સાથ્યમાં પ્રજાને જરૂરાયાદ રહે તે પણ જરૂરી છે;

અને ખરેખર વ્યવહારમાં માહિતીને આહેર કરવાથી સરકારના કર્યાક્રમ સંચાલન, મર્યાદિત નાણાડીય સાપનોનો મહત્તમ ઉપયોગ અને સંવેદનશીલ માહિતીની ગુંગનીયતાની જાગ્રત્તા સહિતના ઓળા આહેર રિતો સાથે સંવર્ધ થાય તેમ છે;

અને લોકશાહી આદર્શની સર્વોપરિતા જાળવતી વખતે આ સંવર્ધમાં આવતા ડિતો વચ્ચે સંવાદિતા સામદ્ય પહેલ જરૂરી છે;

તेथी, હે, જે નાગરિકો માહિતી મેધિવા માગતા હોય તેને અમૃત માહિતી ગૂર્હી પડવા માટેનો કોઈવારું કરવી ઠણ છે.

સંસ્કે, ભારતના ગાંધારજદ્દા ષષ્ઠનમાં વર્ષમાં નીરિનો અધિનિયમ કર્યો છે :-

#### પ્રકરણ ૧

##### પ્રદર્શિક

૧. (૧) આ અધિનિયમ માહિતીનો અવિકાર અધિનિયમ, ૨૦૦૫  
કરેલાંથી.  
(૨) તો અમૃત ઓન્ટ કાશ્મોર રાજ્ય સિવાયન્ના સમગ્ર ભારતને બાધુ પડું છે.  
(૩) કલમ ૪ ની પેટા-કલમ (૧), કલમ પણી પેટા-કલમ(૧) અને (૨), કલમ ૧૨,૧૩,૧૫,૧૬,૨૪,૨૭ અને ૨૮ની લોગાંથીઓ તરત જ અમલમનું આપણે જોંચી જાએ અધિનિયમની ભાગીની ઓગવાઈઓ તોણા આધિનિયમના એકથી વાસ્ત્વમાં કેવું જ મલમાં આપણે, વ્યાખ્યા,
૨. આ અધિનિયમમાં, સંબંધિત અન્યથા અપેક્ષિત ન હોય હો,-  
(૫) "અમૃત સરકાર" એટાં-  
(૧) કેન્દ્ર સરકાર અથવા સંબ્ધ રાજ્યને લઈનું કરા માથ્યા અથવા પરોલ દ્વારા સ્થપાયેલા, માલિકીવાળા, નિયંત્રણવાળા અથવા કેડ રૂપે મોટા પણ પ્રિરાજ મેધિવાની અનુભૂતિ અને સત્તામંડળના સંબંધમાં, કેન્દ્ર સરકાર;  
(૨) રાજ્ય સરકાર દ્વારા પ્રલાષ્ટ અથવા પ્રરોજા રીતે સ્થપાયેલા, રાયાયેલ, માલિકીવાળા, નિયંત્રણવાળા અથવા કેડ રૂપે મોટા પણ પ્રિરાજ મેધિવાની આલોર સત્તામંડળના સંબંધમાં, રાજ્ય સરકાર;  
(૫) "કેન્દ્રાય માહિતી પંચ" એટાં કલમ ૧૨ની પેટા-કલમ(૧) એટાં સાધેં કેન્દ્રાય માહિતી પંચ;  
(૬) "કંન્યાય જાહેર માહિતી અધિકારી" એટાં કલમ ૮ની પેટા-કલમ(૫) એટાં મુફત લેલ કેન્યાય જાહેર માહિતી અને તેમાં પેટા-કલમ (૮) હેઠળ તે તરીકે મુફત લેલ કેન્દ્રાય માહિતીનીએ. આહેર માહિતી અધિકારોને સ્થપાયેલા થાય છે;  
(૭) "મુખ્ય માહિતી કંપનીનાર" અને "ગાંધીની કમિશનાર" એટાં કલમ ૧૨ની પણ કલમ(૩) હેઠળ નીમાયન કુંઝ માહિતી ઇમિશનનર અને માહિતી કેમિશનનર;  
(૮) "સંબળ સત્તાવિકારી" એટાં-  
(૧) લોકસભાના અથવા રાજ્ય વિધાનસભાના અથવા જોવી વિધાનસભા પરાવતા સંબળ રાજ્યને ત૱ન કિઝાંપણું અભાવ અને રાજ્યસ્વભાવ અથવા રાજ્ય વિધાન પરિષદના કિર્ત્તામાં અધ્યાત્મ  
(૨) ઉભાજમન ન્યાયાલયના કિર્ત્તામાં, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ;  
(૩) ઉભાજમન ન્યાયાલયના કિર્ત્તામાં, ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ;  
(૪) ન્યાયાલયી અથવા તે હેઠળ સ્થપાયેલા અથવા દશાયેલા બોજા સત્તામંડળના, કિર્ત્તામાં, રાયાયેલ અથવા રાજ્યસ્વભાવ;  
(૫) સાંબળનાની કલમ ૨૭થી હેઠળ નીમાયના પહીનટદાર;  
(૬) "માહિતી" એટાં રૈકર્ડ, દસ્તાવેજો, મેરી, છં-મેરી, અભિગ્રાહી, સૂચના, અનાનશી-યાદી, પરિપત્ર, લુફ્ટનો, દોષસૂક્ષ્મ, કરાશી, અહેવાલો, કાગળો, નમૂના, મોંઝ્ય, શીઠ છલેક્ટ્રોનિક સ્વરૂપમાં માહિતી-સ્થાનશી અને રાસન્કે અમલમની હોય તેવા કોઈ સભ્યના હેઠળ જોવી કરીએ ગાંધીની કિર્ત્તાને વળતી માહિતી ન કિર્તાની કિર્ત્તા સર્વરૂપમાં જોવીએ સામની;  
(૭) "દરનેનું" એટાં સમૂહિત સરકારે અથવા પણાર્સન, ગાંધીની અધિનિયમ કેવી તરીકે નિરૂપિત કરાવેલું;

- (૩) "જાહેર સત્તામંડળ" એવુંલે-
- સંવિગ્રહાચી અથવા તે ડેઝા;
  - સંસદી કરેલા કોઈ બીજા કાયદાઓ;
  - ચાજ્ય વિધાનમંડળે કરેલા કોઈ બીજા કાયદાઓ;
  - સમૃદ્ધિત સરકારે લાલાર પડેલા કોઈ જાહેરનામાંની અથવા ઉર્દૂલા કોઈ છુફણી,
- જ્ઞાપેલ અથવા રચાયેલ કોઈ સત્તામંડળ ગાથવા મંડળ અથવા લ્યાલ્યુનાની સર્વેષા,  
અને તેમાં બમુદ્દિત સરકારે પૂર્ણ પારેલા કુંભી પ્રાયશ રીતો અથવા પરોંદે શીરે,
- માહિતીના, નિયંત્રિત અથવા ગોટો પાણી પિરાણ મેળવેલ નંબર;
  - મોટા પાણે વિરાસત મેળવતા જિન-સરકારી સંગ્રહનાં, પડ. સનાપેશ થાય છે.
- (૪) "કેર્લ" માં નોંધનાંનો સમાવેશ થાય છે:-
- કોઈ ફસ્ટાફા, લલાપાણ અને કાર્ટલા;
  - કોઈ કર્સાનેજની માર્ટકોડિલમ, માર્ટકોડીએ અથવ. કેસીમાર્ટલ  
નાના;
  - આની માર્ટકોડિલબાં ચમારિએ મતિકૂનિ અથવા પ્રતિકૂનિનીં (માંટો કેલીની હોલ કે ના કોષ ના જીએ)
- (૫) કેસ્યુટર અથવા બીજા કોઈ સાધનથી રજૂ કરેલી બીજી કોઈ ચામગ્ની;
- (૬) "માહિતીનો અધિકાર" એટલે અનુભિનિયમ ડેક્લ કોઈ જાહેર સત્તામંડળ પાસેની અથવા તેના નિયંત્રણ દંડનાં.  
માહિતી મેળવવાનો અધિકાર અને તેમાં-
- કાયદાજ, દસ્તાવેજો, રેકર્ડની તપાસ, ક્રેવાના;
  - દસ્તાવેજો અથવા ડેક્લની નંબર, ઊદ્યા અથવા પ્રાયશ નંબરના લેવાના;
  - ચામગ્નીના પ્રમાણિત પુરાણા લેવાના;
  - દિક્કેસ્ટ, લાંબોપી, ટેપ, વિલ્યુનો ડેસેટના સ્યર્ક્યુપમાં અથવા બ્રાંશ કોઈ કેલેક્ટર્સિંક  
પ્રથ્મ અથવા જરૂરે આવી માહિતી કોઈ કોષ્યુટરમાં અથવા બીજા કાર્ટ  
સાધનનો સંગ્રહિત હોય તારે બ્રિન્ડ આઉટની મારકસે નેજાતવાના;
- અધિકારનો સમાવેશ થાય છે,
- (૭) "રાજ્ય માહિતી પંચ" એટલે કલમ ૧૫ની પેટા-કલમ(૧) હેઠળ રચાયેનું રાજ્ય માહિતી પંચ;
- (૮) "રાજ્યના મુખ્ય માહિતી કાર્યક્રમ" અને "રાજ્ય માહિતી કાર્યક્રમ" એટલે કલમ ૧૫ની પેટા  
કલમ(૩) હેઠળ નં.માર્કેટાં રાજ્યના મુખ્ય માહિતી કાર્યક્રમનાર અને રાજ્ય માહિતી કાર્યક્રમ;
- (૯) "રાજ્યના જાહેર માહિતી અધિકારી" એટલે કલમ ૧૫ની પેટા-કલમ(૧) હેઠળ મુજબ એવું  
રાજ્યના જાહેર માહિતી અધિકારી અને તેમાં ડેક્લ-કલમ (૨) હેઠળ અનુભાવ રાજ્યના મદ્દનાંશ  
જાહેર માહિતી અધિકારીનો પડ. સમાવેશ થાય છે;
- (૧૦) "ત્રાહિત પદકાર" એટલે માહિતી માટે વિનંતી કરનાર નાશરિક રિટ્રાયની કોઈ વ્યક્તિ અને તેમાં  
જાહેર સત્તામંડળનો સમાવેશ થાય છે.

## પ્રકરણ ૨

માહિતીનો અધિકાર અને જાહેર સત્તામંડળનો જવાબદીનો

૩. આ અધિનિયમની જોગવાનુંઅનો જ.પીન રહીને, તમ.મ નાગરિકોને માહેતીનો અધિકાર રહેશે। માહિતીનો  
અધિકાર
૪. (૧) દેશ જાહેર સત્તામંડળેજાહેર  
(૨) પોતાના તમામ, દેક્લ અનુભિનિયમ ડેકાન માહિતી મેળવતાનાસંસ્કરણનીં  
જવાબદારીનો
- અધ્યક્ષરને સુચિદાપૂર્ણ બનાવે તોની રીતે અને તેના સ્બરૂપમાં યોગ્ય રીતે, પત્રકમાં નોંધાને

અને અનુકૂળમાણિકા કરીનો જીવનના જોઈશે અને એને સ્ત્રોમ્યુલારિઝડ કરવા (સ્ત્રોમ્યુલારિઝડ ચાખવા) ઉપયોગ ક્રેદ તેવા તમાં રેકર્ડને, વાજની સુસ્પન્સની બંદર અને સર્પનીની. ઉપલબ્ધપાને અધીન રહીને ક્રોમાટ્રોફિક કરાતાવાનું મૃગીઓન કરવું જોઈશે ગાડે જુદી જુદી પથ્યતિથી સમગ્ર કેશમાં નેટવર્ક માર્કેટ જોડવાનું મુનેશ્વર કરવું જોઈશે, કેથી અનુદેશ કેટાં મેળવામાં સંશોધના રહેશે;

- (૫) આ અધિનિયમના અધિનિયમનાં એકસે વારું હિયેની અંદર,-  
 (૧) પોતાના અધિયાત્મા, કાર્ય અને ફરજોની વિષાઓ;  
 (૨) પોતાના અધિકારોનો અને કર્મચારીઓની જીતા અને કરાણે;  
 (૩) હેલેન્ઝ અનું જીવાભાગીના માયમ રાણિ નિર્ણય તેવાની અભિયાનાં અનુભૂતયાની કાર્યરીતિ;  
 (૪) પોતાના કાર્ય બાધાવા માટે પોતે નક્કી રેખા પોંચણો;  
 (૫) પોતાના કાર્ય બાધાવા માટે પોતાની પરિસા જીવા પણાં નિયાત્રણ હેઠળના જીવા બાંનાં કર્મચારીઓ હારા ઉપયોગમાં બેચતા નિયમો, વિધિયાં, સૂચનાઓ, નિયમસંક્રાન્તિ અને રેકેટ;  
 (૬) પોતાની પાસે અધિયાત્મા પોતાના નિયાત્રણ ડેટા કોષ તેવા દસ્તખેત્રોના રજોનું પણક;  
 (૭) તેની નીતિ બદલનાના અધિયાત્મા તેના અમલાકરણના સંસ્કરણમાં જીતાનાં મખ્યા ગાંધે દિવિ દવિનિયમ આટ અધિયાત્મા રોમાં છારા રજૂઆતા માટેની વિધાનની કાર્યરીતિ અધિયાત્માની વિધાનાં;  
 (૮) તેના ભાગ તરીકે અધિયાત્મા તેની બાબાદાના હેતુ નક્કે એ અદાન રેઢી નાનું અભિકારનો જાંબાં, બાંનો, ડાઉન્સિલો, સમિતિઓ અને બોર્ડ મંદોનું પત્રક અને ન બોર્ડ, સાઉન્ડિન્સ, સમિતિઓ જેને બોર્ડ, મંડળોની બંકડો લોકો ગાડે બુલ્લી છે કે એ અધિયાત્મા તેવી નુકસાની કાર્યરીતિની રેકેને ગણાયું છે કે કેમ;  
 (૯) તેના અધિકારીઓ અને કર્મચારીઓની પાહિની પુષ્ટિકા;  
 (૧૦) તેના વિભાગમાં જોગાચાર કરું પ્રયત્નો વાગ્યાંની ગણિતા તેના રેકેટ અધિકારીઓની અને કર્મચારીઓની મળાણી માટેક નંબરાંના;  
 (૧૧) ચામાં પોતાનાઓ, સૂચિત અર્ચ અને ચૂક્યેદા નાકા પરના અંદરાલાંના રેકેટ, દર્શાવના, તેના રેકેટ એજન્સીને ફાળવેલ અંદરાલપત્ર,  
 (૧૨) કાળાંબ, રદ્મો અધિકત જાલસીની કાર્યક્રમનોની અમલાકરણાંના રીત અને અધિક અર્થકર્માંના કાળાંબનોના વિધાનો;  
 (૧૩) દેશી વાપેલ શુટટાયો, પરચાનગરીઓ અધિયાત્મા અધિકૃતિઓ મેળવાયાની વિશાની;  
 (૧૪) હેલેક્ટ્રોનિક સ્વસ્પદમાં તેને ઉપલબ્ધ, અધિયાત્મા તેની પરિસા પાહિને લગતી વિશાની;  
 (૧૫) જાહેર ઉપયોગ માટે નિયાત્રણાં જીવતા હોય, તો તેથી ક્રેષટાય અધિયાત્મા તેના પરચાનગરાના કાળાંબના કલાકો જીતાની માલીની ગેણલા, માટે નાગરિકને ઉપલબ્ધ રૂપરિયાઓની જેણ ની;  
 (૧૬) જાહેર માદિતી અધિકારીઓના નામો, લાંદા અને બાળ વિગતની;  
 (૧૭) ચાચાનામાં આંકે તેથી નોંધ માદિતીની;  
 પ્રશ્નિક રહ્યા લોઈશે અને ત્યારપણી દર વર્ષ જીએ પ્રકાશનોની આધાર, કરવા જોઈશે.  
 (૧) મહત્વની નીતિશાખા કરુંનો અધિયાત્મા લોકોનો અસર કરા રિશેખે જાહેર કરાની રૂખો અનુભૂતિની તમામ લીફોની પ્રક્રિયા કરવા જોઈશે;  
 (૨) રેકેટ જાહેર જાતામણી પેટા-કલાન(૧)-૨ પંડાની અફ્ટરિયાનો અનુસૂચ, ઈટ્યનેટ સંચિના સંક્રાન્તાયારાના જુદા જુદા દ્વારાની માર્કેટ નિયમિત સમાજાંને આપણેને વધુનું વધુ અધીકી ઘરી પાણા માટે પરચા દેનાંનો સતત પ્રયાસ કરવો જોઈશે, જેથી લોકોનો માહિતી મેળવનું માટે આ અધિનિયમના ઉપયોગના ઓછા માં હોક્કી જુગ્દ પડે.  
 (૩) પેટા-કલાન(૧)-ના હેતુનો નાટે, રેકેટ માહિતીની લોકો સહેલાઈથી જોઈ માટે તે સ્વરૂપે અને ને સીતે બાંધાં કરાની જોઈશે.  
 (૪) (મહિતાની)સમામ સામગ્રીનો પ્રચાર, નવ્યની અસરકરકત., અધિનિયમના અને તે સ્થાનિક વિસ્તારમાં સંદેશાલ્યાંકારી સીધે, અસરકરક પથ્યતિને આંતર લઈને કરનો જોઈશે અને તે માહિતી, કન્વીય જાહેર માહિતી અધિકારી અધિયાત્મા યથપસંગ, રજ્યાના જાહેર માહિતી અધિકારી

गाये विनामूले अथवा द्वारा उपर्याप्तां आये तेवा भाष्यमन्तरी डिप्टेत अथवा इत्यामुद्दिता अर्थात् शक्य होय तेवेति शब्दी ठिक्कटोनिक च उपर्याप्तां संस्कारी भाष्य होवी ऐसंगे.

સ્પષ્ટીકરण: પેટ-કલમો (૩) અને (૪)ના ઉત્તુળો માટે, "ન્રસાર ક્રદ્યો" એવું કોઈ જોડે સત્તાન્દિંદાની ક્રેદિત અનુભાવ નથી. આજેના નાગરિકોને નોટિસ આઈ, કર્ત્વમાનાની, આડેડ ડિલ્યુઓફાનો, પ્રશાંત નાયકોની દ્વારા અસારદાચી, ઈન્ટરનેટ અધ્યાત્મ કોઈ બોજા મ.ધનો મારુને જ્ઞાનવિદી અથવા પહોંચાડી.

- (५) (६) દેશક આહેર સત્તામંડળને, અનુ અધિનિયમભાનુ અધિનિયમનથી એકોસ દિવસની અંદર, અ. અધિનિયમ હેઠાં માહિતી માટે વિનંતી કરતી વ્યક્તિઓને માહિતી પૂરી પાત્રના નામે રેઝિસરનાના. તમામ ચહેરાંની એકમો અથવા કંગેનીઓમાં કેન્દ્રીય આહેર માહિતી. અધિકારીઓને ખલાય થથપ્રસંગ, રાજ્યના આહેર માહિતી અધિકારીને, તરીકે જરૂરી હુંણ રેલવા અધિકારીઓને મુક્તર કરવ. જોઈશે.

(૭) પેટ્રો-ક્રિલમ (૧)ની શોભાગરીઓનો અથવા તિનાયા દેશક આહેર સત્તામંડળના, અ. અધિનિયમના અધિકારીની એકોસ દિવસની અંદર, અ. અધિનિયમ હેઠાં માહિતી. અથવા ગૈરીબાની ખરાખાંનો સ્ટેટ્સિકરાવા અને તેને તાત્કાલિક કેન્દ્રીય આહેર માહિતી અધિકારી અધિકારી અધિકારી અથવા કલગ એન્ટી એપા કલમ (૧) હેઠાં નિર્ધિષ્ટ કરેલા વાર્ષિક અસેલાંની અગ્રવા કેન્દ્રીય માહિતી પણ અથવા યથપ્રસંગ, રાજ્ય માહિતી પણને બોલલા પાટે દેશક ગેટા-વિભાગન્ય રહેવે અથવા બોલ્યા પેટ્રો-ક્રિલમ સર્કે, કેન્દ્રીય મદદનનીસ આહેર માહિતી અધિકારી અથવા યથપ્રસંગ, રાજ્યના કંદનનિય આહેર માહિતી અધિકારી. તરીકે એક ક્રિયાશીને મુક્તર હુંણ જોઈશે :

પરંતુ કેન્દ્રીય મદદનનીસ આહેર માહિતી અધિકારીને અગ્રવા યથપ્રસંગ, રાજ્યના નિર્ણયની જ્ઞાતેર માહિતી અધિકારીને માહિતી નાનીની અરજી અથવા અપીલ આપવાન. જાણો હોય ત્યારે કલમ અની પેટ્રો-ક્રિલમ (૧) હેઠાં નિર્ધિષ્ટ કરેલ પ્રમુખતર આપવ. માટેના જુદાની વકારની વરતી વાંચે ગયો દિવસની જુદું ઉમેશ્વરો જોઈશે.

(૮) દેશક કેન્દ્રીય આહેર માહિતી અધિકારીને અથવા યથપ્રસંગ, રાજ્યના આહેર માહિતી અધિકારીને માહિતી માગતી વ્યક્તિઓની વિનંતીનો નાગે તજીવી કરવી જોઈશે અને એચો માટેની વિનંતી વકારાને વાજીની સહાય કરવી જોઈશે.

(૯) કેન્દ્રીય આહેર માહિતી અધિકારી અથવા યથપ્રસંગ, રાજ્યના. આહેર માહિતી અધિકારી, નેની અધિનિયમની ઇરાસીની ઘોણ બજુચાસી માટે તેને અથવા તેઓને જરૂરી જાણક કેવ. કંઈ બાળ અધિકારીની અથવા માટીની શકરી.

(५) पेटा-कडम(४) डेण्ठ केनी शहाय भांगवामो आवा सोय तंगा डोईगरा अधिकारीने, तेनी अवया तेव्हीनी शहाय भंटता देन्द्रीय आहेत माहिती अधिकारीने अवया यथाप्रसंग, राज्यपाल आहेत माहिती आविधानाने तमाम शहाय कडवी आहेत अनेक, अधिकारीनी जोगवाऱ्हकेनोना कोणी उल्लेखनना केंद्रुकी भाटे, आवा बंज अधिकारी, देन्द्रीय आहेत गाहित. अधिकारी अवया, यथाप्रसंग, राज्यपाल आहेत नाहिती अधिकारी नाही गाहिश.

- |   |  |
|---|--|
| <b>માહિતી મેંટનાનુભવ માટે વિનંતી કરવા બાબત.</b> | <p>(૧) જા અધિનિયમ હેઠળ કોઈ માહિતી મેંગવા માંગી બિકાને, મંગણ કરવા હિન્દો લખય. કે નિસ્તારમાં અરજ કરવામાં આવતું, કોષ તેની રાજકોચાલમાં વેન્ઝિતમાં કથવા હોલેડ્રોનિક માયન મારકનું અને કથવાનામું આવે તેટલી ફી શાંશ, તેથો કથવા તેથોએ માંગેલી માહિતીની રિપોર્ટ કરીને</p> <p>(૨) સંબંધિત જાહેર સાંભળણનું કન્નીય જાહેર માહિતી અધિકારીને,<br/>કથવા પથ્યાપસંગ, રાજ્યના જાહેર માહિતી અધિકારીને;</p> <p>(૩) કન્નીય મદદનિયો જાહેર માહિતી અધિકારી કથવા પથ્યાપસંગ, રાજ્યના મદદનિયો જાહેર માહિતી અધિકારીને,</p> <p>વિનંતી રિપોર્ટ કરીને :</p> |
|---|--|

પરંતુ આવી વિનાંની દેખાવથ્થાં કરી ન શકાય ત્યારે, કેન્દ્રાં અને માહેર માહેર અધિકારોએ જચાયા અધ્યાત્માં, રાજ્યના જાહેર માહિતી અવિકારોએ, મીટિંગ વિનંતીની બેંચિત અગ્ર આપણાની તમાર વાજથી સદ્ગમ કરવી જોઈશે.

- (૨) માહિતી માટે વિનંતી કરતા અરજારને, તૌને સંપર્ક કરતા માટે જરૂરી હુદ્દ તે વિનાય માહિતીની અંદે વિનંતી કષયાનું કોઈ કારણ અથવા આજ કોઈ ગંગત વિનંતો આપણા ફરજ જાતી શકાય નાથે.
- (૩) કોઈ જાહેર સત્તામંજૂની માહિતી માટે વિનંતી કરતી અરજી ફરજાનું આપો હોય અને તે નાહિની,-
  - (૧) બીજા જાહેર સત્તામંજૂના પાસે હોય; અથવા,
  - (૨) તૈની વિષય-વસ્તુ બીજા જાહેર આપણેની કર્તાની ચાંપો વિનિયોગદાર, સત્તામંજૂના હોય નથી.

એવી ભરજી જે જાહેર સત્તામંજૂની કરતામાં જાર્યી હોય તેણે તે અરજી અધ્યક્ષ તંત્રી અરજાની પોતે યોગ્ય ગણે તેનો બાગ તે બીજા જાહેર સત્તામંજૂનાનું તથાદીદા ફરજી પોત્થેને અને એવી તથાદીની અંગેની જગ્યા અરજારને તથત આ કરવી જોઈશે:

પરંતુ આ પ્રદાન-કલાય અનુભાવની, રારજની, તગડાલી, અનુષ્ઠાનિક, લાય તથાદી જગ્યાની ફરજી, જોઈશે પરંતુ કોઈપણ ડિસ્ટ્રિક્ટ અથડાની અરજી મધ્યાની તાર્થાની પણ હિન્દુ ફરજા મિશ્ર હોય જોઈશે નથી.

- વિનંતી ૭. નિકાય**
- (૧) કલમ પણી પેટા કલમ(૨)-ના પરંતુ અથવા કલમ દની પેટા-કલમ (૩)ના પરંતુને અધ્યાન રહીને, કેન્દ્રાં અને માહેરની અવિકારીએ અથવા પણી-કલમ, રાજ્યના જાહેર માહેરની અવિકારીએ, કલમ ત સેટા વિનાંની મંજૂય, શક્ય હોય ટેટાનું જલ્દી, અને કોઈપણ ઉલ્લંઘનાં વિનાંની મધ્યાના વિનિયોગ કરી દેખાની, અંદર, ફરજાવાના આપે તેણે કોઈ કોઈ કુદ્દાની કર્મ માહિતી પૂરી પણી જોઈશે અથવા કલમો ક અને દાંનો વિનિયોગ કરીનું કરાશાર વિનંતોનો અનુભાવ ફરજી જોઈશે :

પરંતુ માંગવાનું આવેલી માહિતી, કોઈ અનુભાવની જિદ્દાની અથવા સ્વતંત્રતા સંબંધિત હીય, ત્યારે વિનાંની યાસાના આપ્યાલીની કલાકની અંદર તે (માહિતીની પૂરી પાડણી જોઈશે),

  - (૨) કેન્દ્રીય જાહેર માહિતી અવિકારી અથવા પણીસંસ્કરણ, રાજ્યમાં જાહેર માહિતી આપે પણી, પેટા-કલમ (૩) કેટા નિકિંગ કરેલ મુદ્રાની અંદર સ્ટાન્ડિંગ માટેની વિનંતી પરે નિશ્ચાર હેઠામાં ચૂકું કરે, તો કેન્દ્રીય જાહેર માહિતી અવિકારી અથવા પણીસંસ્કરણ, રાજ્યના જાહેર સ્ટાન્ડિંગ અવિકારીનો વિનંતોના અનુભાવ કર્યો છે, ગણાશે.
  - (૩) માહિતીની પૂરી જગ્યા નાદેનું નિર્બંધ જગ્યાપત્રી પણીનાં કોઈ કોઈ કુદ્દાની કર્મ, માહિતીની પૂરી પાડાવાનાં નિર્ણય વેનામાં આપે, ત્યારે કેન્દ્રીય જાહેર માહિતી ગાંધીની અવિકારી અથવા પણીસંસ્કરણ, રાજ્યના જાહેર માહિતીની અવિકારીએ વિનાંની કરાશાર વિનિયોગ -
  - (૪) પેટા-કલમ (૧) દેખા કરાયેલી કોઈ કર્મ નક્કી કરવા માટે કરેલ કર્તાની સંબંધિત માહિતી પૂરી પણી જાહેર માટેનું હીય, જાહેરની તેણે નક્કી કરેલી કંઘાસના ઝાંનો રક્ષા, જગ્યા, કરતા, અને જાહેર તેણે વિનંતો કરવી જોઈ તે પેટા-કલમમાં ઉલ્લંઘન કોરા હિન્દાનો રસ્તાનો કરવાના હતું માટે શદ્ધાનું જગ્યા કર્યાની અને ઝાંના કુદ્દાની વિનોના મુદ્રત બાબત રાંધી જોઈશે તેણી વિગત;
  - (૫) અપાલિય સત્તામંજૂના, સમય-અધ્યાત્માં, અંકિતા અને ગોઈ કંજા સર્વાં રાહિત લંનાના આવેલ ઝાંની રક્ષા અથવા પૂરી પાડાવાનાં આવેલ માહિતીનું સ્ટ્રુપ કોરા નિકિંગના સંબંધનાં તેના અથવા દેશીના કક સેન્ટેન્ટ માહેરીની અધ્યાત્માને તેને જગ્યા કરવી જોઈશે.
  - (૬) આ અનીનિયત હેડળ કોઈ રેન્કિં અથવા તેના વ્યાપક માહિતીની પૂરી પણી કરમાણું હીય અને જેણે માહેરી પૂરી પણીનાં હોય તે માહિતી રાંદેનામક અશક્ત હીય, ત્યારે કેન્દ્રીય જાહેર માહેરી અવિકારીએ અથવા પણીસંસ્કરણ, રાજ્યના જાહેર માહિતી અવિકારીએ તપાસણી માટે હોય હીય તેણી રુદ્ધાનું પૂરી પણીનાં હોય ત્યારે, પેટા કલમ(૩)ના અનુભાવની અધીન રહીને, અરજારાં, હશવાનાં આવી રેટાની ઝૂલુની જોઈશે :
  - (૭)

- (प) पर्युष कलम ह नी पेटा-इकम (५) अने इतन ज्ञान गोडा-  
कलगो(१) अन(प) हेतु द्वारेवाली वा वाक्याभी छोर्वे जोहरें अने भयमुक्ति सरकार नक्की उर रोवे,  
उरली उपा नायनी शी रोवी व्यक्तित्वो पासेवी ब्रिन्दी वा बेवी लोहरी नष्टि.

(इ) पेटा-इकम(प)मां वामे ते मध्यकुर छोर्व ते छाना, आठार आतामंजा, पेटा-इकम(१)पां (भिन्निह अदेव  
समयमध्यांदु वाचन इत्यामो चृक्ष कर्ते त्यारे, भाविती भाटे चिनांती इत्यो व्यक्तित्वे आविन्द  
केपाएम्पूर्वे पूर्वे पातवी लोहरी,

(ब) पेटा-इकम(१) उंठा गोर्न निर्माप लेवा पावेलां, डेन्वीय लाडेर भाठेनी  
आविकारी अथवा अथवाप्रसंग, रातना लाडेर भाविती अविकारांने इकम ११ उंठा गाविता  
पक्कारे करेली रक्खुआनने विश्वव्यापाना देवी लोहरी,

(च) पेटा-इकम(प) उंठा, विनांनीनी अस्त्रीकार इत्यावाचो आज्ञो होय, त्यारे डेन्वीय लाडेर भाविती  
अविकारी अथवा अथवाप्रसंग, शाळयन, लाडेर भाविती अविकारांने विनांनी इत्यो अविकार-

(१) आवा अस्त्रीकार माटेना प्रसरणी;

(२) अथवा अस्त्रीकार सामे कु मुक्तानी अविकार अविकार कर्ते ने नुदा; अने

(३) अपीलीय सत्तामंजाना विश्वानी ज्ञान इत्यो लोहरी.

(छ) आमान्य रोते नाहिती ले स्वरूपामां मांगवाचो आवी होय ते इत्यावाचो ज चृक्ष पातवी लोहरी,  
सिवाय के तेनवाचो लाडेर सत्तामंजाना लोहो अभ्यासासर यीते अद्याय अथवा, विवादशसा  
रेक्षांपूर्वी साधामर्ही अनी आगदीनी लानि वाच तेवे होय.

નાનાલી જાહેર

४. (१) आ अधिनियममां अपेक्षा छोटे थे इनमें, संविधान नाशकितने-

(३) के महिली ज्ञानेर धर्माद्वय, आरतना सार्वलोकन और आग्नेयता, राष्ट्रनी संवर्धनी, व्युत्पन्नक, वैश्वानिक अथवा आग्नेयक हितों, दिवेशी धर्म चार्यना संबंधने प्रतिकृद्ध असर

धर्म अथवा सोई जूनाने उद्देश्यों आवश्यकता परिवर्तने तेम छोटे तो तेवी माहिति आवश्यकी ज्ञानाभास्त्री रहेणे नहिं;

(५) धर्मदाना प्रोटो न्यायालये अथवा डिप्युनें प्रबन्ध करनानी स्पष्ट स्तरानी इरण्यवी स्त्रेय अथवा के अडें द्यावी न्यायालयनों तिक्ष्णक वर्ष शके तेम छोटे तेवी शोई नाहिती आपवानी ज्ञानाभास्त्री रहेणे नहिं;

(६) के प्रगट वाचायी संसद अथवा राज्य विधानसभाना विशेषाधिकारनों विंग वर्ष शके तेवी शोई महिली आपवानी ज्ञानाभास्त्री रहेणे नहिं;

(७) सरकार सत्ताधिकारीने जातीय धर्म के विवाह लाडें डेटम, आवी महिलों प्रशंस करनी जुरुद्दी छे, ते सिवाय वालाजियक गोपनीयत, धाराप्राप्त दृढ़त्वे अथवा बीजिंग रोपनानो समाजिंग करना नाहितो, के लाडें अथवायी त्राईत पक्षकारनी स्पर्धात्मक विधिने न्युआना वर्ष शके तेम छोटे देवी, शोई महिली आपवानी ज्ञानाभास्त्री रहेणे नहिं;

(८) शोई महिलों विशाल अडें एटमां लाडें इरवी जुरुद्दी ते तेवी शक्त रातांकिताने जातीय धर्म ते सिवाय विश्वसनीय संबंधोंने आपारे व्यक्ति पासेनो उपलब्ध आवी महिलों आपवानी ज्ञानाभास्त्री रहेणे नहिं;

(९) विदेशी संसदार पासेनो विज्ञानां लाठों भेजेवेकी माहिती आपवानी ज्ञानाभास्त्री रहेणे नहिं;

(१०) शोई अडितनी तिक्ष्णी अथवा दशरीरिक स्वामीनी शोभग्रामं खुदे अथवा, प्रमाणनो अन्वलग्नज्ञानी नांट अथवा दुरुक्षाना लेतुसर खान-जी राहे आपेक्षा माहित, अथवा सहानों झोता गोगानां लाय तेवी शोई माहिती आपवानी ज्ञानाभास्त्री रहेणे नहिं;

(११) युनेनारोनो लातार अथवा धर्मपक्ष अथवा तेमनी सांगेना शोजडारी क्लमनी प्रक्रियामां अवशेष दिनों करे तेवी शोई माहित, आपवानी ज्ञानाभास्त्री रहेणे नहिं;

(१२) मंत्री परिषद, सचिवी अथवा अन्य अधिकारीज्ञाना मंत्रविभाना देवर्क संक्षिप्त केविनेटां, ऐपर आपवानी ज्ञानाभास्त्री रहेणे नहिं :

नरसु भंगी परिषद्वा निर्वाची, देवा शास्त्रों अने ए आजतने आपारे निर्वाच्या दंतवामां आप्या होय ते, निर्वाच्य लाता भंगी अन्य आजत पूर्वी अथवा संपूर्वी नाही गई होय, त्याएं ज्ञानेर इरवी भोजिणे:

વિનિયોગ, આ કલમનાં નિર્હિત કેદી મુક્તિત હેઠળ કે બાબત આપત્તિ હોય તે જરૂરે કરવો જરૂરો નથી;

- (૬) વિકિપાના અંગત કૃત્તિવનને લગ્ની હોય તેવી માહિતીની કેને વિશ્વાસ જાહેર હેતુનાં પ્રગટ કરવી યોગ્ય છે તેવી કેન્દ્રીય જાહેર માહિતી અવિકારી અધ્યાત્મા સાજાયના જાહેર માહિતી અવિકારી અધ્યાત્મા યથપ્રાપ્ત, અપીલીય રત્નામંડળને ખાતરી થાય તે વિશ્વાસ, ગ્રેઇડ જાહેર ગતિવિધિ અધ્યાત્મ હેતુ સર્વે પ્રેરણ પ્રકારનાં શંખય ધરાવતી ન હોય તેવી અધ્યાત્મ ગોઈ વિકિપાના અંગત જીવામંડળ વિનિયોગ દાખલ થાય કેવી અંગત જીવામંડળને લગતી ગોઈ માહિતી આપવાની જગતબાદી રહેણો નથી.

પરંતુ સંતુષ્ટ અધ્યાત્મા રજાય વિનિયોગને કે આપવાનો એન્ટ્રેડ કરી શકાય નથી નંબાં ગ્રેઇડ માહિતી માટે ગોઈ વિકિતાનો હંકાર કરવો જોઈએ નથી.

- (૭) કશકારી શુસ્ત આબત અધ્યનિયમ, ૧૯૨૩માં ગમે તે પણકૂરુ હોય તે જીતાં અધ્યાત્મ પેટા-કલમ (૧) અનુયાદ ૩૧ પરચાનગીયાન કોઈ મુક્તિત હોય તેમ અતિં, રહિત ડિનેને દુસ્કાન કરાઈ (માહિતીની) આહેચાલ કરતા જાહેર ૧૯૨૩માં ૧૫૩ વિનિયોગ વિનિયોગ જાહેર કરી શકતામંદળ માહિતીની પૂરી પાડવાની છુટ આપે શકે.

- (૮) પેટા કલમ (૧)ના ઘરે (૫), (૬) અને (૭)ના જોગવાઈઓને અધ્યાત્મ શરીને, કલમ ૬ દેણા શ્રેષ્ઠિયા વિનિયોગ કરવામંદ અની હોય તે તાતીનાંથી તીવ્સ વર્ષ અશ્વાઈ કોઈ પ્રકાર, બદના અધ્યાત્મ કોઈ આંત ઉત્ત્રવાલા હોય, બદન હોય અધ્યાત્મ અની હોય તે તેના સંબંધી નાહિતી, તે કલમ હેઠળ વિનિયોગ કરનાર વિકિતને પૂરી પાણી જોઈએ:

પરંતુ સંતુષ્ટ વીસ વર્ષની મુક્તિ કરી દાખલાયા ગવાનો તે વિષે ગોઈ પ્રકાર ઉભો થાય નથી, આ અધ્યનિયમમાં જોગવાઈ કરવામંદ આવેલ આજાયા અપીલીય અધ્યાત્મોને બદન રહીને, કેન્દ્ર લદ્દારા નિર્ધારિત આપવારી ગણાયે.

- e. કલમ ૮ની જોગવાઈઓને બાબત આયા વિશ્વાસ, કેન્દ્રીય જાહેર માહિતી અવિકારી અધ્યાત્મ વિશ્વાસના, રજાય જાહેર માહિતી અવિકારી માહિતીની પૂરી પાડવાની અની ગોઈ વિનિયોગી રજાય વિનિયોગની ગોઈ વિકિત પાસે રહેલ કેન્દ્રીયાઈટને, લંગ વાદ તેમ હોય નથી, માહિતીની પૂરી પાડવા માટેની અની વિનિયોગ અશ્વાકાર કરી શકતો.

અમૃત  
વિસ્તારમાં  
માહિતી  
આપવામાં  
અસ્વાકાર  
કરવા માટેના  
આપારો  
બાબત.

૧૦. (૧) માહિતીની આપવાની ગોઈ વિનિયોગને ચેવા આપાર ઉપર અસ્વોકાર કરવામંદ આપ્યો હોય કે તે માહિતી જોને કરેલે કરવામંદી મુક્તિત મંણલ છે તેવી માહિતી હોય, નથી આ અધ્યનિયમમાં ગમે તે પણકૂરુ હોય તે જીતાં, આ અધ્યનિયમ હેઠળ જાહેર કરવામંદી મુક્તિત આપેલી હોય તેવી ગોઈ માહિતીની ન કરવાના અને જાહેર કરવામંદી મુક્તિત આપેલ ગોઈ બાગથી બાજારી શીતે અધ્યાત્મ, થઈ શકે અન્યા દેક્કના તે બાગથીની ગાહિતીની પૂરી પાડવાની શીતોંને,

- (૨) પેટા-કલમ (૧) હેઠળ રેકર્ડ ગોઈ બાબતીની માહિતીની પૂરી પાડવામંદ આપ્યી હોય નથી, કેન્દ્રીય જાહેર માહિતીની અધ્યાત્મ વિશ્વાસંગ, રજાય જાહેર અવિકારી અધ્યનિયમને

- (૩) જાહેર કરવામંદી મુક્તિત મંણલ હોય તેવી માહિતી પશવતા કેર્લંડાંશી અબજ જાદ્ય, જાહેર વિનિયોગ કરેલા કરેનેને બાદીનો બાગ જ હૂંચો પાજામાં બાબો રહ્યો છે;

- (૪) જેમાં હસ્તીકાતોના સીન મહાલવના મશ્વાના નિર્ધાર અને આગા વિશ્વાસ હેતુ પર આધારિત હોય તેવી માહિતીના ઉત્ત્રેખ રહીતના નિર્ધાર પાટેના શરીરો;

- (૫) નિર્ધાર કરનાર વિકિતનું નામ અને લોદો;

- (૬) તેણે અધ્યાત્મ તેણેને ગણતર્દ, હેઠળ કોની ની વિશ્વાસ અને અરજુ કરનારે જમા કરવામંદી થાયી હોય તે કોના રદ્દુ; શાંતો

- (૭) આપવામંદ આંદેલ માહિતીની મેળવાના નમૂના, માહિતી આપવામંદ આજાયા મંદ્યાદા, માહિતી, અને માહિતી મેળવાના બીજી સીન નમૂના, કલમ ૧૮ની પેટા-કલમ (૧) હેઠળ અદદના કેન્દ્રીય માહિતી પંચ અધ્યાત્મ વિશ્વાસંગ, રજાય માહિતી ગેંબ હેઠળ નિર્હિત રહેલ વરિઝ અવિકારીના વિશ્વાસો

સહિત માહિતીના કોઈ લુણને આહેર ન કરવા સંભેદી નિયંત્રણી રીતીઓ, કરવાના સંકેરણમાં હાંગ અથવા તોષોના હક, પાર્શ્વ કરવામાં આવેલ કીની રક્ખ સંગે જાળ કરતી નોટિસ નસ્તજાહારને આપવા જોઈશે.

- ૧૧. (૧) ડેન્નીય જાહેર માહિતી આવેકારી અથવા બથાપ્રસંગ, રાજ્યના જાહેર માહિતી અધિકારી, આ અધિનિયમ હેઠળ કરવાના આનેલ વિનંતી પરબી બેચી ગોઈ માહેતા અથવા દેકો અથવા તેનો સોઈ ભાગ જાહેર કરવા કોષ્ટકા હોય, ત્યારે એવી માહિતી કોઈ આહિત પદકારનો કાગાં હોય અથવા તેના કાગા પડ્યો પાછાં આવો હોય અને તે ત્રાંડિત પદકાર તેને જાણતી ગાહિતી તરીકે ગોઈ હોય હાં, તો, કન્નીય જાહેર માહિતી, અધિકારી અથવા બથાપ્રસંગ, રાજ્યના જાહેર નાહિતી અધિકારોને આવો વિનંતી મખાના પાંચ દિવસનાં અંદર ત્રાંડિત પદકારને આવી વિનંતી અને ફેન્ડરિય જાહેર નાહિતી આપિયારી, અથવા બથાપ્રસંગ, રાજ્યના જાહેર માહિતી અધિકારી તે માહિતી અથવા રેકૉર્ડ અથવા તેથી ગોઈ વાગ જાહેર કરના, માંચ છે તેવી લડીકાંદા, બણિત નોટિસ આપવી જોઈશે અને માહિતી જાહેર હોઈને નદી તે અંગે જાહેર પદકારનો બિધિત બચવદ મૌખિક રજૂઆત કરના બોલાવવા જોઈશે અને ગાહિતો જાહેર કરવા અંગેને, નિર્ણય હશે અને ત્રાંડિત પદકારનાં આવી રજૂઆત આપણાં લેવી જોઈશે-**
- પરંતુ ક્ષમાદારી સંદર્ભિત હોય તેવી દેખાર અથવા વાણિજ્યિક ચુક ભાવનાના ડિસ્કાઉન્ટ સાંચ તે રિટાય, આવા જાહેર પદકારનો બનાર ગોઈ સેન્ટ્રાલિન નૃકુમાન અથવા સાનિ કરતા તે જાહેર કરવાનું જાહેર ડિસ્કાઉન્ટાનું હોય, તો તે જાહેર કરવાની યુદ્ધ જાણી શકશે.
- (૨) ડેન્નીય જાહેર માહિતી અધિકારી આવેલ બથાપ્રસંગ, રાજ્યના જાહેર નાહિતી અધિકારીને, પદકારને, સોઈ ગાહિતી અથવા રેકૉર્ડ અથવા તેના જાણના સંભેદ્યાં, પેટા-કલામ, (૧) હેઠળ, નોટિસ જાણી હોય, ત્યારે આહિત પદકારને આવી નોટિસ મખાના ચારોથેબી હશે હિન્દુનાં કંદર જાહેર કરવા આવેલ એવી માહિતીની જાહેરત ભાગે રજૂઆત કરવાની તક આપની જોઈશે.
- (૩) જાહેર પદકારને, પેટા-કલામ (૨) હેઠળ રજૂઆત કરવાની નક આવેલાં આવી હોય હી, કલામ ક ના જને તે મજદૂર હોય તેમ છાં, ડેન્નીય જાહેર માહિતી અધિકારીને, અથવા બથાપ્રસંગ, રાજ્યના જાહેર માહિતી અધિકારીને, કલામ હ ડેઢા વિનંતી આપ્યા ગયોના જાણી કરિયાને, અંદર, માલેલી અથવા રેકૉર્ડ અથવા તેના સોઈ વાગ જાહેર કરતો કે નિષ્ઠ તેને નિર્ણય દર્શાવે, જોઈશે, જેવે જાહેર પદકારને, બેખીતના તેના નિર્ણયાં જાણ કરતી નોટિસ આપવાનું આવ્યો છે તેને કલામ વિદેશ હેઠળ નિર્ણય ગામે, આપીય કરવાની કક રહેશે.
- (૪) પેટા-કલામ (૩) હેઠળ આપેવાનાં અંગતી નોટિસમાં ચેતું નિર્દેશ દાનું જોઈશે કે એ જાહેર પદકારને નોટિસ આપેવાનાં આવ્યો છે તેને કલામ વિદેશ હેઠળ નિર્ણય ગામે, આપીય કરવાની કક રહેશે.

### પદકાર ત ડેન્નીય માહિતી પંચ

- ૧૨. (૧)** કેન્દ્ર સરકાર, રાજ્યનમાં જાહેરનામાંથી આ અધિનિયમ લેણ હોને સંગેદી સત્તાઓ જાપાનના અને સોઓપામ, આવેલા કાર્યો બજેટના માટે ડેન્નીય જાહેરીની પંચ તરીકે આવેલાના મંડળાની રચના કરશે.
- (૨) ડેન્નીય માહિતી પંચ નોચેનાનું જનશે :
- મુખ્ય માહિતી કલિશનસ; અને
  - જાહેરી અધિકારી હોય, દસ્તી વધુ નદી તેઢાના કેર્નાય માહિતી
- (૩) રાજ્યકૃત નોચેના સભ્યોની બેચેની સમિતિની લખામન, પરથી મુખ્ય માહેતા કર્મચારના અને નાહિતી ક્રમિશનરીના નિયંત્રક કરી શકશે.
- પ્રધાનમંત્રી, કે સમિતિના અધિકાર રહેશે,
  - લંડસનના વેર્સાપક્ષના ગેતા; અને
  - ગ્રાનાર્થીની નામનિયુક્ત કરવાના ડેન્નીય કેલિનોટ મંત્રી.

**સ્વરૂપક્રિયા =** શરીરના નિવાસના હેતુ માટે, આખો જાહેર કરવામાં આવે છે કે લોકો વડાં તેઓએવાં નન્દાની તે તરોક માન્યતા આવી ન છોડ, ત્યારે બેંકનામાં ચરકારની જાનના સૌથી ગોઠા રંગુકા પિરની કૃદના એવા વિરોધપથના નેતા જગતથો.

- (૩) મન્ત્રીની નાહિતી પંચના ક્રમકાર ડિપ્લોમાન ફેફદ્દબ, માર્ગદર્શન અને વ્યવસ્થાપન મુખ્ય માહિતી કર્મશાળને  
નિર્દિષ્ટ થશે. કેમને માહિતી કર્મશાળે સહાય કરશે અને અ. આધીનિયમ  
ક્રિય કોઈ બીજી સત્તાવિકારીના સુધીનાંથી આપીની રહ્યા રિસ્ટાન્ડ, કંપાય માહિતી પંચ દાડ. સ્વયત્ન રીતે  
વાપરી કરાય અથવા કરી રાખાય એવી તાત્કાલ રહ્યા વાપરી શકશે અને એવા તમામ કર્તાઓ અને બાબ્દો કરી  
શકશે.
- (૪) મુખ્ય માહિતી કર્મશાળ અને માહિતી કર્મશાળનો કાગળો, વિજ્ઞાન અને ગૈરીધારીની(કર્ણાલોં), સ્વાસ્થ  
સેવા, વિજ્ઞાન, પન, પત્રકારસ્ત્વ, સમૂહ માધ્યમી અથવા વહીવટ અને સંચાલનમાં જરૂરી શાન અને અનુભવ  
પરસ્પરી આહે જીવનની નામાંકિત વિકિતનો હોલી જોઈશે.
- (૫) મુખ્ય માહિતી કર્મશાળ અથવા માહિતી કર્મશાળ સંભાળના અથવા જોઈ રાજ્યા નથવા યથાર્થસ્થાન, સંચ  
રાજ્યથોત્ત્રાના વિનાનગૃહના સભ્ય અથવા જોઈ વાભદ્ધાયી હોદ્દો પણવા અદ્યા કોઈ રાજકીય વલ સ્થાન  
સંકલણથી અથવા હોઈ વંદે: કરના. અથવા વ્યવસાય કરાય હોવા જોઈશે નહિ.
- (૬) કેન્દ્રીય માહિતી પંચનું મુખ્યમાન ડિપ્લોમાન આતે રહેશે અને કેન્દ્રીય ગા.કાન્ફીની પંચ કેન્દ્ર રાઝકારાનો પુરસ્કૃતીનાં  
લાદનમાં બીજી સ્થાનનોએ ઉચ્ચોનો રૂપાની રહણે.
૧૩. (૧) મુખ્ય માહિતી કર્મશાળ પોતાનો હોદ્દો સંભાળો તે તરફાની પંચ વર્ષની મુદ્દત સુધી હોદ્દો પદાર્થો અને  
તેઓ કેરનિમજૂને પાઠ વંદે નહિ:
- પરંતુ કોઈપણ મુખ્ય માહિતી કર્મશાળ, તેઓ પાંચક વર્ષની વધ્યા ધયા પડો, તે તરીકે હોઈ પણની રહણે  
નહિ.
- (૨) ડિપ્લોમાન કર્મશાળ પોતાનો હોદ્દો પાંચ વર્ષની મુદ્દત સુધી હોદ્દો પદાર્થો અને  
પાંચ વર્ષના ઉપર પૂરી કરે, એ બનાયો એ વહેલું લોય, તેટાં મુદ્દત સુધી હોદ્દો બધાયશે અને  
આવા માહિતી કર્મશાળ તરીકે કેરનિમજૂનો પાઠ વંદે નહિ :
- પરંતુ હેઠે માહિતી કર્મશાળ, જા પેટ-કલમ હેઠા પોતાનો હોદ્દો પાઠી કર્યો, કલમ ૧૨  
ની પેટા-કલમ. (૩)ના નિર્દિષ્ટ કરેલા શરીર મુખ્ય માહિતી કર્મશાળ તરીકની નિમજૂન નાં પાઠ  
વંદે:
- વધુમાં, માહિતી કર્મશાળનો મુખ્ય માહિતી કર્મશાળ નરીક નિમજૂન વાપસાનું નાચી  
હોય, નારે માહિતી કર્મશાળ અને મુખ્ય માહિતી કર્મશાળ અને નિમજૂન સહાય, અ. હેતુ માટે પ્રથમ અનુસૂચિમાં  
નિયમ કરેલ નમૂના અનુશરાર, સોંગન અથવા પ્રતિજ્ઞા કેવી જોઈશે અને પ્રતેકાર્યત ઉપર રોગની  
ગાણી કરવી જોઈશે.
- (૩) મુખ્ય માહિતી કર્મશાળ અથવા માહિતી કર્મશાળ પોતાનો હોદ્દો પરંતુ કરે, પહેલા રાદ્રોપતિ  
અથવા તેમણો તે અદ્ય નિમ્નુકત કરેલ નોંધ જોઈ વિકિત સહાય, અ. હેતુ માટે પ્રથમ અનુસૂચિમાં  
નિયમ કરેલ નમૂના અનુશરાર, સોંગન અથવા પ્રતિજ્ઞા કેવી જોઈશે અને પ્રતેકાર્યત ઉપર રોગની  
ગાણી કરવી જોઈશે.
- (૪) મુખ્ય માહિતી કર્મશાળ અથવા માહિતી કર્મશાળ, કોઈપણ જમયે રાદ્રોપતિને રંગોચીને પોતાના  
ક્લાક્સરમાં લેખિતાનું, પોતાના હોદ્દો પરંતુ રાજ્યાનું આવો શકશે:
- પરંતુ મુખ્ય માહિતી કર્મશાળ અથવા માહિતી કર્મશાળને ડલમ ૧૪ હેઠા,  
દરાવેલી શરે દૂર કરી શકશે.
- (૫) મુખ્ય માહિતી કર્મશાળને યુદ્ધવાપદ્ર પગાડ અને લખણ અને રોણી રંગાનો બોલી અંબે  
અને શરેનો મુખ્ય ચુંટણી કર્મશાળના જેવી જ રહેશે;

છોટાની મુદ્દત  
અને સેવાની  
જરણો.

(૭) માહિતી કમિશનરને ચુકવાયાનાં પગાર અને બ્લ્યાન્ડ અને તેના સેનાની બેઠીની જાણ શરતો બ્લ્યાન્ડ કમિશનરનાં ફેની જ રહેશે:

પ્રશ્ન મુજબ માહિતી કમિશનર અથવા ગાહિતી કમિશનર, પાતાના નિભાગના બખરે ભારત સરકાર સેક્રટની અથવા રાજ્ય સરકાર હેઠળની પોતાની અગ્રાઉન્ડ સેનાના લોન્ગ્સમાં, અશક્તતા અથવા હજા પેનાન લિનાલનું કોઈ દેન્શન બેલવાના લોય, તો સ્ટ્રેચ માર્ગેની કમિશનર અથવા માહિતી કમિશનર નાંડીની એન્સી સેનાના પ્રારંભોલી રૂપાંતરેત રેલ્લા પેનશનન. હોઈ લાગ સાંજના એન્સી રકમ આં નિરૂપિતી બ્લ્યાન્ડને સ્ટ્રેચ પેનશન સિવાયના નિવૃત્તિના બીજા લાલોને સમકક્ષ પેનશનની રકમ છેઢવી રકમની રૂપના રૂપના જોગ્યે જોંથેશે:

વધુંનું, મુજબ માહિતી કમિશનર અથવા ગાહિતી કમિશનર, તંત્તી નિન્દ્રાળા જરૂરે, કેન્દ્રીય અધિનિયમ, અથવા રાજ્ય અધિનિયમની અથવા તે હેઠળ સ્થપાયેક કોઈ કોર્ટનેથન અથવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની માર્ગીડાન, અથવા તેન. દ્વારા નિરૂપિતી સરકારી કુન્ડાની તેણે અગાઉ જાપેલ કોઈ સેનાના સંબંધના નિવૃત્તિના બાબો નાથવાના લોય, તો સ્ટ્રેચ માહિતી કમિશનર અથવા માહિતી કમિશનર હોઈની તેણી સેનાના પર રખાની નિવૃત્તિના લાલોને સ્ટ્રેચ પેનશની રકમ જેટલી રકમની કષાત રકમી જોંથેશે:

વળી, મુજબ માહિતી કમિશનર અને માહિતી કમિશનરના, પગાર, બ્લ્યાન્ડ, સેનાના, બીજી શરતોમાં રૂમના નિમણું બાદ તેમને વેરવાલા થાય દેવા કરેલું રકમ જોંથેશે નહે.

(૮) કેન્દ્ર સરકારે મુજબ માહિતી કમિશનર અને માહિતી કમિશનરના આ અધિનિયમ હેઠળ તેના ડાટો કાર્યક્રમ રીતે અનુસાર ઘણે અગ્રાઉન્ડ લોય રેન. અપેક્ષાઓનો અને કમરસીઓનો પૂર્ણ પણ્ણા જોંથેશે અને આ અધિનિયમના હેતુ સાંચ નિદૂંકન કરાયેલા અવિકાશોનો કંન્ટ કમરસીઓનો બૂકવાયાન પગાર અને બ્લ્યાન્ડ અને તેમની સેનાના બોલાઓ અને શરૂતે, હૃત્વાં જીવે રેનો પરિણામો હેઠળે.

૧૪. (૧) પેટો-કલામ(ગ)-નો જોગવાઠુંબને અધીન રહીને, સ્ટ્રેચ માહિતી કમિશનરનાં અથવા પાહિતી કમિશનરને રાજ્યપત્રિયાં ઉત્તેનમ ન્યાયાબધિન રેન, કદલે પરદી, તંત્તી (ઉત્તેન ન્યાયાબધિ) તપાસ કરીને અહેવાલ નાયાદો હોય કે સ્ટ્રેચ ધયેલ નિરૂપર્ણ અન્યાય અસર્માંતાના કારણોથી સ્ટ્રેચ નાથવાને અથવા પણાપરંગ ગાહિતી કમિશનરને દૂર રકમ જોંથેશે, તો કરેલોસર, કરત રાખ્યુંતિના હૃકથી તેનો રોમા દોષપરંગ હૃક કર્યો શક્યો.

(૨) રાજ્યપત્રિ, આદા સંદર્ભ પરદી ઉત્તેન ન્યાયાબધિ આદેલા અંગેન હૃકમોન કરે તાં સૂરી, પેટો-કલામ(૧) હેઠળ, ફેના સંબંધમાં ઉત્તેન, ન્યાયાબધિ રાહબંન આદીં હૃક નાહિતી કમિશનર અથવા માહિતી કમિશનરના, સંબંધમાં આનો રંડર્ન, દરાયેલ હોણ રેન દીપ પરદી કરજ્ઞમોહૃક કરી શકો અને જરૂરી જાહ્યાન તંત્તી તપાસ કરાયાયાન કરીશોના કાંઈ રહેતા અને સન્નાઈ કર્યાયી શક્યો.

(૩) સ્ટ્રેચ માહિતી કમિશનર અથવા પણાપરંગ, માહિતી કમિશનર-

(ક) નાદાર ટેલ લોય; અથવા  
(ન) શાલ્ફાપત્રિના અભિપ્રાય પ્રમાણે નેતૃત્વ અપાયતાન રાજ્યાય તેણા રૂનામાં દોષિત કરીએ; અથવા

(ગ) પોતાના હીંદાની મુદુત દરનિયાન પોતાના હીંદા પરની હેઠળ સિવાયના કોઈ સ્વેચ્છા,

(ઘ) શાલ્ફાપત્રિના અભિપ્રાય પ્રમાણે માનસિક અથવા શારીરિક અશક્તતાના કાંઈ કોઈ પર અનુભૂ રહેતા અસર્માં અન્યો હોય; અથવા

(૩) સ્ટ્રેચ માહિતી કમિશનર અથવા ગાહિતી કમિશનર તરીકે પોતાના કાંઈને પ્રદિક્ષા અસર થવાનો સંભવ હોય તંત્તી રેને અનુભૂ કોઈ નાશકોયા અસર બિજુ હિત ગ્રામ કર્યુ હોય તો,

- પેટા-કલમ (૧)** માં ગેરે ને ગજીકુર હોય તે જીવાં રાજ્યની હડમ કરીને, મુખ્ય માહિતી કભિશનર અથવા કોઈ માહિતી કભિશનરને તેમના લોદ્યા પરથી હૂં કરું શક્યો.
- (૨) મુખ્ય માહિતી કભિશનર અથવા માહિતી કભિશનર કોઈપણ રીતો બારા સરકારે અથવા તેના વાંચ કરવામાં જીવેલા કોઈ કરાર અથવા કાલું...તનામું સાચે સંકાળેનું વાંચ અથવા તેમના છિંઘનીએ પરથવતા હુંયે અથવા કોઈ એક સંબંધ તરીકે અને સંખ્યાઓની કંપનીના બીજા જગ્યાને કાગણ હોય તે શિથાથ નેમાંથી થયાં કોઈ નફા અથવા કોઈ બીજા લાભ અથવા મહત્વાર્થ ગાળોધાર એને, તો પેટા કલમ(૨)ના હેતુ માટે ને ગેરવતસ્થુક માટે ઘોષિત થાયાં.

### માનવ ર રાજ્ય માહિતી પંચ

૧૫. (૧) દરેક સાજ્ય સરકાર, રાજ્યની જાહેરનામાં હાયા, આ અનુભિનિયમ ડેકા તોં સંચાલનાં આવલો રાજ્ય સરના વાપરવા એને કાર્યો અનુભવવા મટે.....(રાજ્યનું નામ) માહિતી પરંપરા નામે જોગનાતા નામના માહિતી પંચના દશના.
- (૨) રાજ્ય માહિતી પંચ નીંબના સંખ્યાનું બનણો-
- (ક) રાજ્યના મુખ્ય માહિતી કભિશનર, કાર્યો
- (ખ) જુદુંશી જાણ્યાં તોટલી સંખ્યામાં, હલ્લાં વધું નહિ તેટાં, રાજ્ય
- માહિતી કભિશનનો.
- (૩) નીંબના સંખ્યાની બજોલો સમિતિનો બલાન્યા પરથી, રાજ્યકાલ, રાજ્યના મુખ્ય માહિતી કભિશનર અને રાજ્ય માહિતી કભિશનનોની નિયુક્તિ કરશે-
- (૧) મુખ્યમન્ત્રી, કે સમિતિના અધ્યક્ષ રહેશે;
- (૨) વિધાનસભાની વિશેષજ્ઞાના નેતૃાં એની
- (૩) મુખ્યમન્ત્રી દ્વારા નામનિયુક્ત ડરવાયાં આવે તેવા ડેઝિનેટ મંત્રી.

**સ્વાચ્છીકરણ-** શક્નાના નિવારણના હેતુ મટે, જ્યાથી આદેર કરવામાં આવે છે કે વિધાનસભામાં ડિશેયપકના નોટનો તો તથીકે માન્યતા આપેની ન હોય, રૂપરે વિધાનસભાની શરકારની સામેના રીત્થા મોટા સંબૂજ વિરોગી જૂદુંા નેતા વિરોધપકના નોટાં શક્યાણે.

- (૪) રાજ્ય માહિતી પંચના કભિશનર ઉપર સામાન્ય હેઠળેન, માર્ગદર્શન અને વયવસ્થાન, રાજ્યના મુખ્ય માહિતી કભિશનરનાં નિહિત થશે. જેમને રાજ્ય માહિતી કભિશનરે રજૂધ કરશે અને તે કા અનિન્યિત છેણ કોઈ બોલ અત્યાર્પિતારીની રૂચનાનોને અરીની રહયા વિધાય, રાજ્ય માહિતી પંચ દ્વારા સ્લાઇન શીને વાપરને, શક્ય અથવા કરી શક્ય અન્યાં ત્યાં વાપર્યો શક્યાં અને નેવા તંત્રાં કાયોં અને કૃત્યાં કરીશે.
- (૫) રાજ્યના મુખ્ય માહિતી કભિશનર અને રાજ્ય માહિતી કભિશનરો, શાબ્દ, વિશ્વાન અને ટેકાંપોલોજી, રસાયન, વિવાતાપન, પત્રપારસ્ય, સંસ્કૃત માધ્યમો અથવા વર્ણિક અને સંખાળનન, બેન્ટો, બાંધણ શાન અને અનુભૂતિ પરાવળી જાંચર જનનમાં નામાંકિત હોય એવી વિકિતાઓ હોવી જોશેનો.
- (૬) રાજ્યના મુખ્ય માહિતી કભિશનર અથવા રાજ્ય માહિતી કભિશનર, જાંસુદ્ધ સભા અથવા કોઈપણ રાજ્ય અથવા વિધાયસંગ, સંઘ રાજ્ય નોંધના વિધાયમનુંના સંયુક્ત હાંયા લોઈશે નહિ અથવા નશાદરક ગીલ કોઈ લોઈશે પરાવતા. અથવા બીજા યાજીકીય પક્ષ સાથે સંકષારેલા અથવા બાય કોઈ થશે કે વ્યાદ્યાય ફરના દેવા જાણશે.
- (૭) રાજ્ય માહિતી પંચનું મુખ્ય મધ્યક, રાજ્ય સરકાર, રાજ્યપત્રમાં જાહેરનાગાથી નિર્દિષ્ટ કરે તેવા સ્વાં, રહેશે અને રાજ્ય માહિતી પંચ, રાજ્ય સરકારની પૂર્વ મન્જૂહીદી રાજ્યમાં બીજા સ્વાં, નાતુ કરેશેનો, રહેશે.

શોદાની મુદ્દત  
અને સેવાની  
શર્તો.

૧૬. (૧) રાજ્યના મુખ્ય માહિતી કોર્પોરેશનને પોતાના હોદ્દા સંભાળો તે તારીખની પાંચ વર્ષના કુદાની હોદ્દો પરાવરી અને રોગો કેરણમશૂલુને પાત્ર થણે નહિએ:

પરંતુ રાજ્યના ગોર્ખિયાના મુખ્ય માહિતી કમિશનર, તેઓ પાંચ વર્ષની વધના થણી ગઈની તે તરીકે હોદ્દો પરાવી રહેશે. નહિ.

(૨) દરેક રાજ્ય માહિતી કમિશનર, તેમની હોદ્દો પારણ કરે તે તારીખની પાંચ વર્ષની મુદ્દત માટે અથવા પાંચ વર્ષની તથમાર્ગાં પૂરી કરે તાં સુધી, જે અમાંથી કે વહેલું હોય તેટાં સમય હોદ્દો પણનો શક્ય અને આથી શાખાના ગોર્ખિયાની કેરણમશૂલુનું માટે પાત્ર થણે નહિ:

પરંતુ દરેક રાજ્ય નાહિતી કમિશનર, આ પેટો-કલમ હેઠળ ટેમની હોદ્દો થિએ, ત્યારે કલમ ૧૩નું દ્વારા  
કલમ (૩) માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર નીકું કેરણમશૂલુનું માટે પાત્ર થણે :

દ્વારાં, રાજ્ય માહિતી કમિશનરના રાજ્યના મુખ્ય માહિતી કમિશનર નીકું નિર્ણયકૃત પણ, ત્યારે  
રાજ્ય માહિતી કમિશનર અને રાજ્યના મુખ્ય માહિતી કમિશનર તરીકે ટેનના શોદાની કુદા, મુદ્દત, પાંચ  
વર્ષથી વધુ હોલ્ડ કોઈશે. નહિ.

(૩) રાજ્યના મુખ્ય નાહિતી કમિશનરને અથવા, રાજ્ય ગોર્ખિયાની કમિશનર, તેમની હોદ્દો પાથ્ય કરે તે મંડળા  
રાજ્યપાલ સમજી અથવા તે અર્થે તેમનો નિર્માણકું કોણે કોઈ બીજી વ્યક્તિકું સમજી પ્રથમ અનુસૂચિંગના હંતુ  
માટે જીવાલાન-સ્કૂલા અનુચાર સોંચાં અથવા ગનિતા લેવા જોઈશે.

(૪) રાજ્યના મુખ્ય માહિતી કમિશનરને અથવા, રાજ્ય માહિતી કમિશનર, કોઈ એવા સમયે, રાજ્યપાલને સંબંધિતને  
પોતાના છલ્લાશરમાં બેખિતમાં પોતાના હોદ્દા પરથી રાજ્યનામું આપી શકો:

પરંતુ રાજ્યના મુખ્ય માહિતી કમિશનરને અથવા રાજ્ય માહિતી કમિશનરને ડાન ૫૦ લેખન  
નિર્દિષ્ટ કર્યા પ્રમાણે કોઈ પરથી દૂર કરી શકાશે.

(૫)(ક) રાજ્યના મુખ્ય માહિતી કમિશનરનો ચૂકુવાયાત્ર પગાડ અને અથવા અને તેમની સેવાની બીજી બોલીની અને  
અને શરતો ચૂકુવી કમિશનર જેવી, જ રહેશે;

(૫) રાજ્ય માહિતી કમિશનરને ચૂકુવાયાત્ર પગાડ અને અથવા અનો સેવાની બીજી બોલીની અને  
ગરતો રાજ્ય સરકારના મુખ્ય સહિત જેવી, જ રહેશે:

પરંતુ રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અથવા રાજ્ય માહિતી કમિશનર, તેમની નિર્માણનું  
સમયે, અન્યકારી અથવા ઇજા એન્સન સિવાય, સાલત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળની અધિકારી, કેન્દ્ર  
પાણી સેવા માટે પેન્શન પેણવાના હોય, ત્યારે રાજ્યના મુખ્ય નાહિતી કમિશનર અથવા રાજ્ય માહિતી  
કમિશનર નીકુંની પેન્શન સેવાના સંચરણની, તેમનો પગાડ, ગાણતરી કોણ પેન્શનના કોઈ લ્યાન સહિતારી તે  
પેન્શનાની રકમ અને નિવૃત્તિ બેંબુરૂટીની સમજી પેન્શનને બાધ કરતા નિર્દૂતોના અથવા પ્રકારના રામકાળ  
પેન્શનાની રકમ એટલો શરૂઆતો જોઈશે:

વધુમાં, રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અથવા રાજ્ય માહિતી કમિશનર, રોગનો નિર્માણના  
સમયે, કોઈ કેન્દ્રાય અધિનિયમ કે રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ લયન દેખાન અથવા કેન્દ્ર  
સરકાર કે રાજ્ય સરકારની માધ્યમીની અથવા તેના નિર્યાત્રા દેખાનની કૃપનીમાં અગ્રહ કોઈ રૂપ  
આપી હોય તેના સંદર્ભમાં મળતા નિવૃત્તિ કાન્યે મેળવતા હોય, ત્યારે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર  
અથવા રાજ્ય ગોર્ખિયાની કમિશનર પરથીને તેમની સેવાના સંદર્ભમાં તેમનો પગાડ, નિર્દૂતે લાગેને રૂમકલ  
પેન્શનની રકમ એટલો શરૂઆતો જોઈશે:

વળી, રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અને રાજ્ય ગોર્ખિયાની કમિશનરાંના પગાડ, અથવા અને  
સેવાની બીજી સહ્યોમાં, તેમની નિર્માણનું પરી તેમનો જેરાયાદી થયે તેવી રૂટે કેરણમાં દરમાને જોઈશે નહિએ.

- (५) શાલ્ય સરકારે રજીયના મુખ્ય માહિતી કમિશનરને અને શાલ્ય માહિતી કમિશનરોને, આ અવિનિયમ હેઠળ રોમાં કાર્યોની અભ્યાસકારક બજ્યાલી માટે આવયક હોય હોવા અન્તિકારીઓને અને કમેચાઈઓ પૂર્ણ પાડવા જોઈશ અને આ અવિનિયમના હેતુ માટે નિયમગુરુ કરેલા અન્તિકારીઓને અને અન્ય કર્મચારીઓને બુકવરાપાત્ર પગાર અને અછાં અને સેવાની બોકીઓ ગાંઠે શરૂ હોયાના અવે તેવા રહેશે.
૧૭. (૧) પેટા-કલમ(૩ની) જોગવાઈનોને અનીન રહીને, રજીયના મુખ્ય માહિતી કમિશનરને અથવા રજીય માહિતી કમિશનરને અથવા રજીય માહિતી કમિશનરને રજીયપાંચ ઉચ્ચતમ ન્યાયાલયને કરેલા કંઈને પરદી, હોંગ (ઉચ્ચતમ ન્યાયાલય) તપાય કરીને અદેવાલ આપ્યો હોય કે આપિત ક્રેચ વેરવાનાનિ અસર્વત્તોના કાશકોસર રજીયના મુખ્ય માહિતી કમિશનરને અશ્વા, યધારાસંથ, રજીય માહિતી કમિશનરને દૂર કરવા જોઈએ, તો તે કાશકોસર, કક્ત રજીયનાના હુકમની અને તેમના ટાઇપરની દૂર કરેલા હોય; શક્યો,
- (૨) રજીયાલ, રજીયના મુખ્ય માહિતી કમિશનરને અથવા શાલ્ય માહિતી કમિશનરનો, પણ કલમ (૧) હેઠળ ઉચ્ચતમ ન્યાયાલયનો સંદર્ભ કરીને હું તેવી તપાસ દરમિયાન અને રજીયના લં નાંદી ભાવામાં પરનો ઉચ્ચતમ ન્યાયાલયનો અદેવાલ ગેણત્વા આપ્યો હુકમો અર્થ ન હોય તાં તુંથી હોય પરદી કર્જભોકૃ કરી શકશે અને જરૂરી જાણ તો હોય કર કરાડ થતા અનુભૂતિ શક્યો.
- (૩) રજીયના મુખ્ય માહિતી કમિશનર અથવા પવાપ્રસંબંધ, રજીય માહિતી કમિશનર,
- (૪) નાદાર જાહેર થયા હોય; અથવા
- (૫) રજીયાલના અલિપ્રાય મુજબ નૈતિક અધ્યપત્રન ગજાય અંબા શુના માટે ગુનોઝાર કરાવાનું, આપ્યા હોય; અથવા
- (૬) પોતાના હીંદાની કર્ણો ઉપરાંત અન્ય અસેતન રોજગારમાં પોતાના લંઘાની મુદ્દત દરમિયાન રોકાયેલા હોય; અથવા
- (૭) રજીયપદના અલિપ્રાય મુજબ માનાયિક અદ્યારા શારીરિક રીતે અદ્યાત્તમન, ડાફફર નોંઠ, ગરુ રહેલા માટે જાયોય હોય; અથવા
- (૮) અંબા નાદાંઝીય અથવા અન્ય અભિવ્યક્તિ હોય કે તે રજીયના મુખ્ય માહિતી કમિશનર અથવા રજીય માહિતી કમિશનર અથવા રજીય માહિતી કમિશનરને તેમના અધીન વિધિરિત અસર કરીયા શકે,
- તો પેટા-કલમ (૧)માં શરીર નજીબુદ્ધ હોય તો છાંટ, રજીયાલ, હુદ્દમાં રજીયન, મુખ્ય માહિતી કમિશનર અથવા રજીય માહિતી કમિશનરને દોહરા પરદી દૂર કરી શકશે.
- (૯) રજીયના મુખ્ય માહિતી કમિશનર અથવા રજીય માહિતી કમિશનર, રજીય સરકારે નાયાના તંત્ત્ર કંબને કે કલ્યાણતાનામાંની હોંટયજુ રીતને સંબંધિત હોય કે હિત ખરાતતા હોય અથવા મંસ્થપત્રન ક્રમાંગાં સત્ય સિદ્ધાય અને બોજા સાધાનથ સંબંધની માફક તેના નન્દમાં અથવા તેમાંથી ઘતા કાલ કે પણારાં કેરે રીતે રહ્યાની થાય, તો તે, પેટા-કલમ (૧) ના હેતુનો માટે જેરનિનું માટે હોયની જગ્યાથી

#### પ્રકરણ ૫

માહિતી ગંયની સત્તા અને કાર્યો, અપીલ અને હંડ

૧૮. (૧) આ અવિનિયમની જોગવાઈનોને અધીન રહીને, કેન્દ્રાય માહિતી પંચ અનુભા યથપ્રકાશ, રજીય માહિતી પંચની, હોંગ વ્યક્તિન-

- (૧) કે કે આ અવિનિયમ હેઠળ આવા જોઈન્દું આવા જોઈન્દું આવિકારોના નિયમશુદ્ધ કલ્યાણાં અ.ર્ટ. નર્ચ. તં કરણથી અથવા કેન્દ્રાય મદદગીથ જાહેર માહિતી અધિકારી અથવા યથપ્રકાશ, રજીયના મદદગીથ જાહેર માહિતી અધિકારીને, આ અવિનિયમ હેઠળની તેના અભિવા હોંગની માટીની અભિવા અભિવા

માટેની અરજી, કલમ એ ની પોતા- જીવન. (૧) એ સિંહિષ્ઠ ઝર્ણ મુજફ. કેન્દ્રથી જાહેર નાઈટ્સ અધિકારીની કે શાયયના. કાઢેર માણિની અર્પિતાની કે વાયિક (શીર્ષાભદ્ર) અધિકારીને અચ્છા કેન્દ્રિય માણિની પંચો અચ્છા બદ્ધપ્રસંગ, રાજી માણિની પંચો શવાના કરવા માટે સ્લૈફરવાળાને ન જાડી હોય તે કારણથી કેન્દ્રિય આડેર માણિની અધિકારીને અચ્છા બદ્ધપ્રસંગ, રાજ્યના જાંદર માણિની અધિકારીને ચિનની કરી શકી ન હોય;

- (५) के जें आ अधिनियम हेठा विनापीशी अंतर्गतामं अपेक्षा श्रेष्ठ मालिति व्यवस्थामें उनकार करतामां आयो छोय;

(६) के जें आ अधिनियम देखा रेक्टर करतामां अपेक्षा सप्तप्रयोगानी अंदर मालिति व्यवस्था अथवा प्राप्त करतामी विनापीशी अंतिमात्र चारप्रयोग शाल्मो न छोय;

(७) तेन अथवा तेजाने गेवनाएवी जाहाजी हीय लेवी शीनी रुक्म नुक्म नु रक्मात्यु रेख;

(८) तेन अथवा तेजाने आ अधिनियम हेठा अधूरो, वेसार्वी दोलारी अथवा भोटो मालिति अप्यवस्थामें आयो, छे तेपु मानव छोय; अने

(९) के जा अधिनियम हेठा रेक्टर नागवा अथवा भेगवता संभाला बोक्क जेन वाक्तामा संतुष्टमा, तं-री करियाक झाँजारदानी अने तं अगे तपास करताना करुङ रेहेह.

उन्दृष्ट भालिति पंच अथवा वयाप्रसंग, राज्य भालिति पंचने भालती थाय के श्रेष्ठ उल्लतमां तपास करता पतते, नाजेनी आबोलोना संभाप्तां शोवानी कार्यसाहि अधिनियम, १९८८ हेठा दायो शबावनी तपासे, दीवानी व्यापालयनां निहित थयेक्त रेता केनी छ रेता रेतेह-

(१) अडितज्ञाने बोधवता अने लाइर रेता भाटे इक्क पात्तवी अने संनांक १२ प्रैमिल अथवा दोजित पृष्ठावा आपवा याटे अने दक्षतावेक्षण अथवा याडिनी पृष्ठी पात्तवा इक्क थाइदानो;

(२) हस्तावेलो प्रगट करता अने तपास-डी अर्वा हस्ताववानी;

(३) सौंगठनामा पर तुरावो मेजवतानी;

(४) कोई न्यायालय अथवा द्येवीभवेशी तेना जाहेट रेक्टर अथवा तेनो ग्रटोनी मारदाना करतानी;

(५) साक्षीबो अथवा दस्तावेजेनी तपास भाटे क्षमता शावतानी, अने

(६) क्षाववामां आवे तेजो बोक्क रेक्टर भालत.

संसद अथवा व्याप्रसंग, राज्य विश्वानंउणा श्रेष्ठ लीज अधिनियमां जमे तो असंज्ञा दोय तो इत्ता, उन्दृष्ट भालिति पंच अथवा व्याप्रसंग, राज्य भालिति पंच, आ अधिनियम हेठा श्रेष्ठप्रब फिरियाक जेजेनी तपास इस्यान, आ अधिनियम लागु पात्ते छोय तेता श्रेष्ठ रेक्टर्ना के छे अहेर ज्ञानामेण्डा नियंत्रक देहा दोय तेनी तपास इसी शक्तो अने आपा श्रेष्ठप्रब रेक्टर्ने श्रेष्ठप्रब अन्दृष्ट अथवा शाल्मो नहि.

૧૮. (૧) ક્રોણપદ વિક્રિ કેને કલમ કાંઈ પેટા-કલમ(૨) અથવ વેદા-કલમ(૩) પદ્ધતિ (૫) માં નિર્દિષ્ટ  
૬૫. મુજબના સમર્પયાની અંદર નિર્દેખાની જાત થઈ ન હોય અથવા તેનીએ અંદર પાહિને  
અપિકારી અથવા પદ્ધતિ, શાખાના લાગેર પાહિને અપિકારીના નિર્માણો નાચાય થઈ છોય, તે  
આની મુજબ પૂરી થયાના કથાના અંદર નિર્ધારિત ભાગીદારનું અંદર, રેખા લાગેર  
સતતમેળની અંદર, તેનીએ અંદર પાહિનેના અપિકારી અથવા અથ પ્રાણિ, રાજ્યબના લાગેર પાહિને,  
અપિકારી કરતું કિંબાં દરજીએ પરાવતા શીખ તેવા નાયિકારીનાં આપીલ કરી શકે:

परंतु आवा अविक्षीने जोड़ी घाटशी चाय के अपील करनार चुका ग्राम्योंसे सम्पर्क अपील की शक्ति न हो, तो तै त्रीस डिव्हेसी चुका दीवी चाय पहुँच अपील स्थिक्षी ग्रहण।

- (२) केंद्रीय आठेर माहिती अधिकारीने अद्वा यथाप्रसंग, राज्यना आठेर माहिती, गोविन्दीने उद्देश दुष्मनी सामें, क्षम ११ लंडण गोडित पलशटनी माहिती आठेर करवा भाटे अपील दरवाजां आपील छैय, त्यारे शेखपित गोडित पक्षकार दुष्मनी तारीखदी शेव. हिवतनी बंदर अपील उरवी जोहरी.
- (३) पेटा-क्षम (१) डेकना निर्णय रामेनी झोळ अपील, ते नाशांडे निर्णय इव्वे. ओळोंगो छातो अधवा भरेन्वर मध्ये छोय ते तारीखदी नेवु डिव्सांगी अंदर केंद्रीय माहिती, तेच अथवा राज्य माहिती पंच समक्ष इव्वी जोहरी:
- पर्वु केंद्रीय माहिती नवर्न अथवा यथाप्रसंग, राज्य माहिती नवर्न आनदी थाय के अपेक्ष करनार पूज्या शारदोलार सम्यक्ष अपील द्वारा शको न डो, तो ते नेवु डिव्सांगी नुदृत वैता गवा भाटी अपील श्वीकारी वाक्ये.
- (४) फेन्नीय लाठेर माहिती अधिकारीना अथवा यथाप्रसंग, राज्यना आठेर माहिती अधिकारीना निर्णय, विकार, कर्मेल अपील, भाइत पक्षकारनी माहिती संबंधी लोप, तो केंद्रीय माहिती पंच अद्वा, यथाप्रसंग, राज्य माहिती पंच, ते गोविन्द पक्षकारनो सुनावणीमी वाजवी तडे व्यापको जोहरी.
- (५) शोळ अपीलनी कार्यवाहीमो विनंतीनो अस्वीकार दायडेसर देने इव्वर्वां आपो. डोतो ते शामिल करनारी घ्याबाटां लंगो विनंतीनो अस्वीकार द्वारा छोय ते केंद्रीय लाठेर माहिती अधिकारी अथवा यथाप्रसंग, राज्यना आठेर भालिती अधिकारीनी रहेशे.
- (६) पेटा-क्षम (१) अथवा पेटा-क्षम (२) डेकना, अपीलांगो डिकाल, अपील मध्याना गोन तेन्माना अंदर अथवा यथाप्रसंग, तेन्मां अपील इभाल कर्मांगी तारीखदी हुव विस्तारात्मा डिव्सांगी व्यु नाहि तेक्षण लाभावेला सन्यगागानी अंदर, लेहिताना कारणोनी नोंप करीन, करवी जोहरी.
- (७) केंद्रीय माहिती पंच अथवा यथाप्रसंग, राज्य माहिती पंचनो निर्णय भेपाकर्ता रहेश.
- (८) तेन्मा निर्णयां, केंद्रीय नाहिती पंचने अथवा यथाप्रसंग, राज्य माहिती पंचनो, निर्णयी अश्वानी. संबोध्यां शता रहेशे-
- (९) आ अधिनियमनी जोगवार्ड्सोना धारानो सुनिश्चिता करव. माटे अवश्यक होय नेव. निर्णय उल्लेख सहितना कोइ व्याख्या देणा-
- (१) जो आवा विनंती करवानो आपील छोय, तो आस स्वरूपे माहिती पूरी घाउवा,
- (२) केंद्रीय आठेर माहिती अधिकारी अथवा यथाप्रसंग, राज्यना आठेर माहिती अधिकारीनो निमांगु अद्वा,
- (३) अमुक माहिती अधवः माहितीना प्रकारे प्रतिष्ठ करवा,
- (४) डेकनी आगवाही, संवालन अने तेन्मा नाशना संदर्भमां द्वारा पध्यरिमां जहारी करकारे इव्वा,
- (५) माहितीना अधिकार शाको तेन्मा अधिकारीनो माटे तारीखदी जोगवार्ड विस्तु राज्य,
- (६) क्षम उना पेटा-क्षम (१) ना भेट्याना ना पावल माटे वार्षिक अहंवासनी जोगवार्ड करवा. आठेर सत्तामंडलाने रहमाववानी;
- (७) शोळ नुक्खाना अथवा थेवेल लोळ दानि माटे शरिकाठीनो राज्य आपवा आठेर सत्तामंडलाने रहमाववानी;
- (८) आ अग्नियम छहाल जोगवार्ड करेल शोळ द्वारा द्वारा आठवारी;
- (९) अरञ्जने-पामझूर करवानी.
- (१०) केंद्रीय माहिती पंचे अद्वा यथाप्रसंग, राज्य माहिती पंचे करिमाहीने अने जाठेर सत्तामंडलाने, अपील अंजेना शोळ अधिकार सुहेतना तेन्मा निर्णयांनी नोंटिक आपदा लोहो.
- (११) केंद्रीय माहिती पंचे अथवा यथाप्रसंग, राज्य माहिती पंचे द्वारा व्यापवामो अने तेवी कार्यरीति अनुसार लापोवानो निर्णय इव्वो जोहरी.

૨૦. (૧) કેન્દ્રીય માહિતી પંચનો અથવા યથાપ્રસંગ, રાજ્યની માહિતી પંચનો કોઈ ફરિયાદ અથવા આર્થિકનો નિર્ણય કરતી વાપરો જેનો અભિપ્રાય હોય કે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથાપ્રસંગ રાજ્યના જાહેર માહિતી અધિકારીને શોરી પાજબો કારણ નિનું માહિતી માટેના અરજી સ્વીકૃતાવાળો ના પારી છે અથવા કલમ તું ની નેટા કલમ(૧) હેઠાં નિર્દિષ્ટ કરેલ ચંચળનું અંદર માહિતી પૂરી પારી નથી અથવા પાદેતો માટેના વિનંતીનો બદલાયાપૂર્વક અખ્લાકાર શરીરો છે અથવા આર્થિકાંકને ગોઠી, અધૂરો અને બેસનાળો દોસનારી માહિતી આપી છે અથવા વિનંતીનો વિષય સૌંચ નેટા પાદેતીનાં નાશ કર્યો છે અથવા માહિતી પૂરી પદ્ધતિમાં ગાંઠે ક્રાંતિકારી રીત નાયરોમાં કર્યા છે, તો તે ને અરજી સ્વીકૃતાવાળાનું આચેલ હોય અથવા માહિતી પૂરી પદ્ધતિ દેસ ન્યારથી રહેક દિનસ માટે અસૌધારાસ રૂપિયાનો દુડ કરી શકતો, રેન્સ છતો તેવા રૂલ્ન, કુલ રસમ પચોડ, કાલા રૂપિયા કરતો વાપરી જોઈશે નહે :

પરિણતું કેન્દ્રીય જાહેર માહિતી, અધિકારી અથવા યથાપ્રસંગ, રાજ્યના જાહેર માહિતી અધિકારી પર હેઠો દુઃખાપણ પહેલા તેનું સુનાવાશીલી વાણીનો તક આપવી જોઈશે:

વધુમાં, તે વાજભોપકો અને ખંતપૂર્વક વર્ત્યો હતો તેવું સામિત્ર કરવાનો જોખો કેન્દ્રીય જાહેર માહિતીની અધિકારી, અથવા યથાપ્રસંગ, રાજ્યના જાહેર ગોલેટી અધિકારી પર રહેશે.

(૨) કેન્દ્રીય માહિતી પંચનો અથવા યથાપ્રસંગ, રાજ્ય, માહિતી પંચનો જોઈ ફરિયાદ અથવા આર્થિકનો નિર્ણય કરતી વધતે એવો એ અભિપ્રાય હોય કે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથાપ્રસંગ, રાજ્યના જાહેર માહિતી અધિકારીએ કોઈ પાજબો કશ્યત્વ નિનું દૂરાંદરાયુર્વક માહિતી માટેની અરજી સ્વીકારી નથી અથવા કલમ તું ની નેટા કલમ(૧) હેઠાં નિર્દિષ્ટ કરેલ ચંચળનું અંદર માહિતી પૂરી પારી નથી અથવા માટેની ગોઠી વિનંતીનો બદલાયાપૂર્વક અસ્તીકાર કર્યો છે અથવા આંદોલને ઘોશી, અમૃતી જાં રેઝાર્ન દોસનારી માહિતી આપી છે અથવા વિનંતીનું વિષય સૌંચ નેટા માહિતીની નાશ કર્યું છે અથવા માહિતી પૂરી પદ્ધતામાં ગોઠીપણે દીનતે અભરાતી કર્યો છે, તો તેને વાયુ પડતા સેના નિયમો હેઠાં કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અધિકારી અથવા યથાપ્રસંગ, રાજ્યના જાહેર માહિતી અધિકારીની વિરુદ્ધ વિરુદ્ધનિષ્યક ગણાં લેવાના તે (૧૩) અંગુઠા કરી રહ્યા.

### પ્રકરણ દ પ્રક્રિયા

૨૧. આ અધિનિયમ અથવા તે દેખા કરેલા કોઈ નિયમ, હેઠળ દુઃખભૂષણીયો કરેલ, અથવા કરેલ નાંદેલા કોઈ કુલ્ય માટે કોઈપણ વિકિત જામે કોઈ થયો, ફરિયાદ અથવા બીજી કર્યા કર્યાવાણી થઈ શકતો નહિ.

અને ૧૯૮૩ નો ૧૯૮૦	૨૨. સરકારી ચુંબ આપત અધિનિયમ, ૧૯૮૩ અને તાત્કાલીન અનબલેન્સ હોય રેલા પ્રોજેક્ટ ક્રાંતાવાં અથવા આ અધિનિયમ વિચારાની બીજી કોઈ કાયડાની રૂપે આપાયેલ હોય તેના કોઈ કોણમાં હોય અસંગત હોય તેવો કોઈપણ અજ્ઞાત કોઈ શોધ તે છતાં આ અધિનિયમની જોગવાઈઓના અસર રહેશે.	અધિનિયમ ની ઉપરથિત આજ્ઞા.
ન્યાયાધ્યક્ષની હક્કીની વાધ.	૨૩. કોઈપણ ન્યાયાધ્યક્ષ, આ અધિનિયમ હેઠાં કરેલા કોઈ કુલ્યમાં સંબંધિત હોલ્ડિંગ દાતા, અનજી અથવા બીજી કાર્યાલાયી દાતાની કરી શકતો નહિ એનો રેલા કોઈ કુલ્ય જામે આ અધિનિયમ, કર્યા જાપાણના રીત વિચારની બીજી કોઈ રીતે વાંચો ઉદ્ઘાટની શકતો નહિ.	

અમુક  
સંગ્રહનોને  
અધિનિયમ  
લાગુ ન પડવા  
બાબત.

૨૫. (૧) આ અધિનિયમમાનો શોઠપણ કાજકુર, કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા હોય તેવા, ખાંડ અનુસૃતિઓની નિરીષા કરેલા ગુસ્થદ અને સભામાટી સંગ્રહનો અથવા જ્ઞાવા સંગ્રહનોને સરકારને પૂરી પાઠેલા કોઈ માહિતોને  
લાગુ પડાયો નથી :

પરંતુ ભાષાચાર અને માનવ અવિજ્ઞાન ઉત્ક્ષેપના અંતર્ગતના અંતર્ગતને લગતી ગઢિયો,  
આ પેટો-કલમ દેખાયા કરતા રાખવામાં આવણી નથી :

વધુંમાં, માનવ અવિજ્ઞાના ઉત્ક્ષેપના આંતર્ગતના સંગ્રહમાં માર્ગદર લેખ, દેખો  
માહિતીના ડિસ્સાનો, કેન્દ્રીય માહિતી પણની મંજૂરી પછી જ માહિતી પૂરી ગત્ત્વાની કોઈએ  
અને કલમ ઉંમાં થએ તે મજાકુર હીથી તે છત્તાં, ચોંદો માહિતના, ચિનતાની ગણ્યાની જારીમાટી  
પ્રિયાર્થસ દિવસની અંદર પૂરી પાઠેલી જોઈશે.

- (૨) કેન્દ્ર સરકારે, રાજ્યપત્રના આંકડેનામાંથી, તે સરકારે સ્વચ્છતા વેદ્ધિબળ વીજી ગુનબદર રાખવા  
સભામાટી સંગ્રહનોનો અનુસૃતિમાં સમાવેશ કરીને જ્ઞાવા જાગરૂકી તરફાં નિરીષા  
કરવામાં આવેલા કોઈપણ સંગ્રહનો તંદ્રાંથી કંઈ કરીનો, અનુસૃતિમાં રહ્યાંને, કરી શકાયેને  
અને જાતું જાહેરનામું પ્રસિદ્ધ થયેલો, કાન્પ, સંગ્રહનો અનુસૃતિમાં સમાવેશ થયેલો,  
હોલાનું અથવા ધ્યાપ્રસ્તો, તેને તેમાંથી કરી દરાવેલ હોલાનું ગાંડાં
- (૩) પેટો-કલમ (૨) દેખાય કાઢવા પડ્યાનું જાવેલ દેખક જાહેરનાં સંચાલન દેખક રૂદ્ધ સમાજ  
મુકું જોઈશે.

- (૪) આ અધિનિયમમાં થએ તે મજાકુર હીથી તે છત્તાં, રાજ્ય સરકાર રાજ્યપત્રમાં  
જાહેરનામાંથી, રાજ્ય માહિતી પણની મંજૂરી પછી જ માહિતી પૂરી પણ્ણો જે હોય  
અને કલમ ઉંમાં ગર્દી તે મજાકુર હીથી તે છત્તાં, ચોંદો માહિતના, ચિનતાની ગણ્યાની જારીયાની  
પ્રિયાર્થસ દિવસની અંદર પૂરી પાઠેલી જોઈશે.

વધુંમાં, માનવ અવિજ્ઞાના ઉત્ક્ષેપના અધ્યાત્માના સંબંધમાં જાંબાળ હીથી તેવી  
માહિતીના ડિસ્સાનો, રાજ્ય માહિતી પણની મંજૂરી પછી જ માહિતી પૂરી પણ્ણો જે હોય  
અને કલમ ઉંમાં ગર્દી તે મજાકુર હીથી તે છત્તાં, ચોંદો માહિતના, ચિનતાની ગણ્યાની જારીયાની  
પ્રિયાર્થસ દિવસની અંદર પૂરી પાઠેલી જોઈશે.

- (૫) પેટો-કલમ(૫) દેખાય કાઢવા પાડ્યામાં જાવેલ દેખક જાહેરનાં સંચાલન સાથે મુકું જોઈશે.

૨૫. (૬) કેન્દ્રીય માહિતી પણે અથવા ધ્યાપ્રસ્તો, રાજ્ય માહિતી પણે, દેખક વર્ષ પૂર્ણ  
થયા પછી, વચ્ચાદાર્ય હીથી તેટદ્વારા જરૂરી, તે વર્ષે દરમિયાના આ અધિનિયમની જોંગવાઈનાંના  
અભિનિર્દસ ઉપરનો આંકડાં હોવાર કરવો જોઈશે અને સમૃદ્ધિ, સરકારને તેમી અંક નાંબ  
મોકદ્દમાં જોઈશે.
- (૭) દેખક મંગાલદેશ અથવા વિનાશી, તેમનો છદ્દમતયાંના જહેર ચન્દ્રાંગીની, બાબતનાં, આ કલમ  
દેખાય અછેવાલ હોવાર કરવા માટે જરૂરી હીથી તેવી માહિતી એકદી કરવી જાહેરે અને કંપ્રૈસ  
માહિતી પણ અથવા ધ્યાપ્રસ્તો, રાજ્ય માહિતી પણેને પૂરી પાડ્યો જોઈશે અને આ દલના દેનુંનો  
માટે તે માહિતી પૂરી પાઠેલા અને રેકર્ડ રખવા સંબંધિત જરૂરિયાતાંનું માન કરવું જોઈશે.

દેખક  
રાજ્ય અને  
અભેદાદ  
આપવા  
બાબત.

- (૩) દરેક આહેવાલમાં, રોજગારથી વર્ષને બગતે હોય તે તર્ણના સંબંધમાં નિર્માણ બાબતો જગત્તાંકી હોવી જાઓશે,-
- (૪) દરેક હેડાર સત્તામંડળને કરવામાં આવેલી વિનંતીના સંખ્ય ;
- (૫) જ્યાં અરજદારી વિનંતી અનુસૂચના, દર્શાવેલો ગેયવા ડક્ટાઈ
- ના હોય તેવા નિર્ણયોની સંખ્યા, આ અધિનિયમના કે જગત્તાંકી હેડાર આ નિર્ણયની કરવામાં આવ્યા હોય તે જોગવાઈઓ જને કેટલી વાપત આ જોગવાઈઓનો ઉંઘાંના કરવામાં જાણ્યો હોય તે સંખ્યા;
- (૬) ડેન્ટિય માહિતીના પંચ અધ્યવા યથાપ્રસંગ, રાજ્ય માહિતી ગંભેરે ચુનાર્વીલીકાન કરવા માટે મોડલવાળ્યો નાવેલી અપોલની સંખ્યા, આપોલનો પ્રકાર એ.નો બાળાંનું પરિચાન;
- (૭) આ અધિનિયમના અમલના સંબંધમાં કાઠાપજા અધિકારીની સ્પાર્ટ, દેન્પામાં આવેલ કોઈ પણ પણ પિસ્ટાવિદ્યદ પગળાંની વિગતો;
- (૮) આ અધિનિયમ હેડાર દરેક આહેર સત્તામંડળ દ્વારા જોકડા કરવામાં અવેલ ચર્ચાની રૂપે;
- (૯) આ અધિનિયમના ભાવ અને હુદાદને લાદુ પાડવા અને અમલીકરણ માટે આહેર સત્તામંડળ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો દર્શાવીતી કોઈ પણ હક્કાત;
- (૧૦) આ અધિનિયમ અધ્યવા બાંધ કરવા અધ્યવા યથાપ્રસંગ, જ્યાં રાજ્ય વિધાનમંડળના કે શુદ્ધી હોય તથા રાજ્ય વિધાનમંડળના દરેક વૃદ્ધ ક્રમક અને જ્યાં રાજ્ય વિધાનમંડળનું એક ગૃહ હોય તથા તે ગૃહ ક્રમક મૂલ્યી રક્ખો;
- (૧૧) ડેન્ટિય માહિતીના પંચ અધ્યવા યથાપ્રસંગ, રાજ્ય માહિતી પંચને કેમ છાણવ કે આ અધિનિયમ ડેણાના આહેર સત્તામંડળના કાર્ય અધિકારીના સંબંધમાં આહેર સત્તામંડળના
- (૧૨) વ્યવહાર આ અધિનિયમની જોગવાઈઓ અધ્યવા ભાવ દ્વારે સુરોગત નથી તો, તેનીચે, સત્તામંડળને તેના, અધ્યવા કુઝન આવી સુસગતતાને પ્રોત્સાહ આપવા માટે દેવા જાવશ્યક હોય તેવા પગળાં નિર્દિષ્ટ દર્શાવી જાણ્યાં રહ્યો શક્યો;
- સમુચ્છિત ૨૯. (૧) સમુચ્છિત સરકાર, નાણાદીકી અને બીજા જોગણે તૃપ્તાભૂતાના પ્રમાણમાં,
- (૨) આ અધિનિયમ હેડાર નિર્ધારિત અર્થિશીલો હોવી રીતે વાપશવા તે કેવે જનતાના, ન.ક કરીને ઉપેક્ષિત સંસ્કુદનોની જાહેર રૂમજ વાપશવા માટે શૈક્ષણિક કાર્યક્રમ નિકલ્યાને શક્યો અને તેની વ્યવસ્થા કરી શક્યો;
- (૩) ખાલીએલ કાર્યક્રમનું વિસ્ત અને તેની વ્યવસ્થા કરવાનો જનતાની બચ માટે અને આવું કાર્યક્રમો પોતાની જીતે લાય પણ માટે આહેર સત્તામંડળનો પ્રોત્સાહ, જાપાની રાફતો;
- (૪) આહેર સત્તામંડળો કાર્ય રેઝોની પ્રવૃત્તિની રિશે આપદામાં આપતી ગોફરું મહિનીના સમયસર અને અગ્રકરક પ્રયાર માટે પ્રોત્સહના આવી શક્યો; અનો
- (૫) આહેર સત્તામંડળોના ડેન્ટિય આહેર માહિતી અધિકારીઓ અધ્યવા યથાપ્રસંગ, રાજ્યના જાહેર માહિતી અધિકારીઓની વાતાંમ અર્થ શક્યો અને જાહેર સત્તામંડળના પાત્રાના ઉપયોગ માટેના સંબંધિત નાલોમ ભાગચી તેથાર રહ્યો શક્યો.

- (2) સમુચ્ચિત સરકારે, આ અવિનિયમના આર્દ્ધનાના અંકર, આ અવિનિયમનાં નિર્દેશ કરેલ, કોંગ્રેસ અધિકાર વાપરવા ઈશ્વરી કોઈ વ્યક્તિ દ્વારા વાયબી શીતે જરૂરી હોય રેખે માહિતીઓ સુમારેથા કરીનો, સરળ રીતો સમજ રાખાય તેવા સ્વરૂપમાં બનો રેણો રીતે, પોતાના રાજ્યભાગના એક માર્ગદર્શિકાનું કંદળ કરવું જોઈશે;
- (3) સમુચ્ચિત સરકારે, જો જરૂરી હોય તો, પેટો-કલમ (ર)નાં હલેલે પ્રાર્વકારી, નિવિષિત સગયોત્તરે અધારવાટ કરવી જોઈશે અને પ્રાણિત કરવી જોઈશે, જેમાં, યાસ કરું ને અને પેટો કલમ (ર)ના અવાજતાને ફાય અપાય રિલાય, નીચેની ગાળતોની રૂમાંબર, કરવા જોઈશે.
- (4) આ અવિનિયમના ઉદ્દેશો;
- (૫) કલમ ૫ ની પેટો-કલમ (૧) ડેફા નીપાયેલ ટર્ક જાહેર કરતામંગળના કેન્દ્રીક આદેર માહિતી અધિકારી અથવા ધયાપરસંગ, રાજ્યભાગ જોઈએ ગાડિયારી અધિકારીનું પરવાનગારનું સરનામું ફોન અને કેંદ્રસ નાંસર બનો, જો રિસાય્ય હોય, તે લલોફ્ટોનિક રેલેન નિર્દેશ;
- (૬) કેન્દ્રીક જાહેર માહિતી, અધિકારી અથવા ધયાપરસંગ, રાજ્યભાગ જાહેર માહિતી અનુભાગને જો શીતે અને જે નમૂનામાં માહિતી મેળવના માટેની વિનિયોગ કરવો જોઈશે તે રીત અને નમૂનો;
- (૭) આ અવિનિયમ હેઠળના જાહેર સ્ટાન્ડાર્ડના કેન્દ્રીક જાહેર માહિતી અધિકારી કથવા ધયાપરસંગ, ૨.૩૪૮ના, આદેર માહિતી અધિકારી પાસેથી ઉપબાન સહાય નીચે તેમની કરશે;
- (૮) કેન્દ્રીક માહિતી રંગ અથવા ધયાપરસંગ, રાજ્ય નાહિતી રંગ પાસેથી ઉપબાન સહાય;
- (૯) પંચને અધીક કરવાની રીત સહિતના આ અવિનિયમના શંખાયનું અથવા આ અવિનિયમથી મોલા, અધિકાર અથવા નાંબિવામાં અંગેલા, કરજોની ગાળતગા, આ અવિનિયમના નિયકાળના સંબંધમાં ઉપબાન કાયદગાંના તસમ્ય, ઉપાય;
- (૧૦) કલમ ૫ અનુષ્ઠાન કેંદ્રસ વર્ગો સ્ટેટિક રીતે પ્રચાર કરવા માટે જોગવાઈ કરતું જોગવાઈથો;
- (૧૧) માહિતી મેળવત, માટેની વિનિયોગના સંબંધમાં ગૃહપવાનું થતો જીને સંબંધેત નોરિંગ્સ; અને
- (૧૨) આ અવિનિયમ અનુષ્ઠાન માહિતી પેણવાના શંખાયનું કરતાનાં આદેર રખાડના વિનિયમો અથવા અખાર પાલામાં આદેલ પરિફળો,
- (૧૩) સમુચ્ચિત રૂરકાઈ, જો જરૂરી હોય, તો નિયશિલ કાગાંનાં ગર્ડડડીક, આથી અધારત કરવી જોઈશે, અને પ્રસિદ્ધ કરવી જોઈશે.
૨૭. (૧) સમુચ્ચિત સરકાર, રાજ્યપત્રમાં જાહેર-પ્રમાણી, આ અવિનિયમની છોગનાઈથો અમલમાં મૂકવા માટે નિયમો કરી શકશે,
- નિયમો  
કરવાની  
સમુચ્ચિત  
સરકારની  
સત્તા.
- (૨) અથ કરીનો, અનો પૂર્વવર્ત્તી સત્તાનો આપકતાને બાબત આચ્ચા વિના, એવા નિયમોથી નીચેની રૂપમાં અથવા તે દેખાની કંઈપત્ર વાખત માટે જોગવાઈ કરી શકશો :-
- (૩) કલમ ૪ની પેટો-કલમ(૪) ડેફા પ્રસાર કરવાની સામદ્ધીના માધ્યમનું અર્વ અથવા મૂંડેન સમજીની પડતર ક્રમત:

		(૮) કલમ હની પેટા-કલમ (૧) કેટળા ચૂકવાયાનું હો;
		(૯) કલમ ઉન્હી પેટા-કલમો (૧) જાને (૫) કેટળા ચૂકવાયાનું હો;
		(૧૦) કલમ દાઢા પેટા-કલમ(૬) અને કલમ એહની પેટા-કલમ(૮) કેટળા અવિકારીનો અને આથ્ય કર્મચારીઓનો ચૂકવનાયાનું પણાર અને ભાસું અને તેગની સેવાના ગોવાઓ અને શરૂઆતો;
		(૧૧) કલમ એહની પેટા-કલમ(૧૮) કેટળા અવિકારીનો નિર્દ્ય કર્મચારીનું કેન્દ્રીય સાહિતી અથવા ધ્યાયપુસ્તક, રાજ્ય માલિતી પંચ દશ અનુષ્ઠાનિક કાર્યક્રમિ; અને કરાયકારી જરૂરી લોય તોની અથવા દરાવદમાં આવે તરીકે ગોલ કરી શકતો.
નિયમો	૨૮.	(૧) સક્રમ સત્તાવિકારી, રાજ્યપત્રમાં જાહેરા-માર્ગથી, આ અધિનિયમની ઓળખાઈઓ અય્યામાં ચૂકવા માટે [નિયમ] કરી શકશે.
કરવાની સંસ્કૃત અવિકારીની અધા.		(૨) આસ કરો કોઈ મુખ્યપાર્ટી સત્તાપી વ્યાપકતાનાં લાય આવ્ય, દિન, અને નિર્માણોથી નિયમની તથાય અથવા તે એકાંગી કેંઠપણ આપા માટે જીવનાંદે કરી શકશે:
		(૩) કલમ એહની પેટા-કલમ (૪) કેટળા ગ્રસદ કરવાની સામગ્રીના માયામણું અથ અથવા મુદ્દેન સામગ્રીના પદતર જીમત;
		(૪) કલમ હની પેટા-કલમ (૧) કેટળા ચૂકવાયાનું હો;
		(૫) કલમ ઉન્હી પેટા-કલમ (૧) કેટળા ચૂકવાયાનું હો; અને
		(૬) કરાયકારી જરૂરી હોય તોવી અથવા દરાવદમાં આવે તોવી ગોલ કેંઠપણ બાળતા.
નિયમો મુજબ બાબત.	૨૯.	(૧) આ અધિનિયમ હેઠળ કેંદ્ર સરકારે કરેલા દરેક નિયમને, તે કરવાના હોય તે પણ બાળતા ત્વરાને, સંસ્કૃત રાન ચાલુ હોય ત્યારે, સંસ્કૃતા દરેક ગૃહ સમસ્ય એક જ સત્તા અધિકાર કુશાગ્રાંશુભૂતિ અથવા વધુ સત્તાની માનની ઓળખાનો અને તે અત્ર અથવા ઉપર્યુક્ત લાગ્બાગ્લ સર્વો પદ્ધતીનું ચચાતું સત્તા ગુરું ધ્યા પહેલાં, બસે ગુરું તે નિયમણે ગુરું ફેરફાર કરવા સુંતો આય અથવા બને ગુરું અમે સેમત આય કે તે નિયમ ડસ્ટો ઓછાંની નિદ્રા, તો ત્વરાનાક તે અંદ્રા ડરકાર કરે તા સ્વરૂપના જ અમદામાં રહેશે અથવા વાતાવરણ, અમદામાં રહેશે નિર્દિ, તેમ કણાં, જાંડો તોંક પણ કેંદ્રાની અથવા રદ થાયાની તે નિયમ દેણા જગ્યાથી કરેલા કોઈ પણ પણ એવી કાન્કડેશરાને આપ જરૂર નની.
		(૨) આ અધિનિયમ હેઠળ શાલ્ય સરકારે કરેલ કરેલ નિયમને, તે આદેર કરવામાં આવે તે પણી અનાંત્રી ત્વરાને, શાલ્ય વિધાનસભાનું સમસ્ય મુજબો જોઈશે:
મુજબલીઓ દ્વારા કરવાની રીતા	૩૦.	(૧) એવા અધિનિયમની ઓળખાઈઓનો અય્ય કર્મચારીનું કર્મચારીનું કેંદ્ર પણ મુજબેલી ઉન્હી આય તો, કેંદ્ર સરકાર, રાજ્યપત્રમાં દૂરાં ગ્રાસિય કરોને, મુજબેલી દૂરાં કરવા માટે જરૂરી અથવા હાટ લાવે તેવાં, આ અધિનિયમના ઓળખાઈઓ આવે અસેન્ટ ન હોય તેવી ઓળખાઈઓ કરું શકશે:
		પરંતુ એ અધિનિયમન, આંદોલની તારીખથી કે વર્ષની મુદ્દત પૂરી આપ પહોંચાયે જાયાં તો એ મુજબેલી કરી શકશે નની.
		(૨) એ કલમ કરેલ કરેલ દૂરાં, તે કરવામાં આવે તે પણી અનાંત્રી ત્વરાને, સંસ્કૃતા દરેક જીવની સંસ્કૃત મુજબો જોઈશે.
રેટ કરવા બાબત.	૩૧.	માહિતી-સ્વાતંત્ર અધિનિયમ, ૨૦૦૨, અથવા રેટ કરવામાં આવે છે.
		સન ૨૦૦ અને પદો

## પહેલી અનુસૂચિ (જુઓ કલમો ૧૩(૩) અને ૧૬(૩))

મુખ્ય માહિતી કમિશનર / માહિતી કમિશનર / રાજ્ય મુખ્ય માહિતી કમિશનર / રાજ્યમાહિતી કમિશનરે લેવાના શપથ અથવા પ્રતિજ્ઞાનો નમૂનો

“હું....., મુખ્ય માહિતી કમિશનર / માહિતી કમિશનર / રાજ્ય મુખ્ય માહિતી કમિશનર / રાજ્ય માહિતી કમિશનર નિયુક્ત થવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે / ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે કાયદાથી સ્થાપિત ભારતનાં સંવિધાન પ્રત્યે હું સારી શ્રક્તિ અને નિષ્ઠા ધરાવીશ, હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડિતાનું સમર્થન કરીશ. હું યોગ્ય રીતે અને નિષ્ઠાપૂર્વક તેમજ મારી પૂર્વ શક્તિ, સમજ અને નિર્ણયશક્તિથી મારા હોક્કાનાં કર્તવ્યો ભય કે પક્ષપાત, રાગ કે દોષ વિના બજાવીશ અને સંવિધાન અને કાયદાઓનું સમર્થન કરીશ.”

## બીજુ અનુસૂચિ (જુઓ નિયમ ૨૪)

**કેંદ્ર સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ બાતમી અને સલામતી સંસ્થા**

૧. ઇન્ટેલિજન્સ બ્યુરો (આઈ.બી.)
૨. ડેફિનેટ (મંત્રીમંડળ) સચિવાલયની સંશોધન અને પૃથક્કરણ શાખા. (રી)
૩. રેવન્યુ ઇન્ટેલિજન્સ (મહેસૂલ બાતમી) નિયામકની કચેરી.
૪. ડેન્યુલ આર્થિક બાતમી કાર્યાલય (સી.ઈ.આ.ઇ.બી.)
૫. એન્ઝોર્સમેન્ટ નિયામકની કચેરી.
૬. કેફી પદાર્થ નિયંત્રણ કાર્યાલય. (એન.સી.બી.)
૭. વિમાન-સંચાલન (વિમાન વ્યવહાર) સંશોધન કેંદ્ર.
૮. ખાસ સીમાવતી દળ
૯. સરહદ સુરક્ષા દળ. (બી.એસ.એફ.)
૧૦. ડેન્યુલ અનામત પોલીસ દળ (સી.આર.પી.એફ.)
૧૧. ભારત-તિબેટ સરહદ પોલીસ (આઈ.ટી.બી.પી.)
૧૨. ડેન્યુલ ઔદ્ઘોગિક સુરક્ષા દળ (સી.આઈ.એસ.એફ.)
૧૩. રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (એન.એસ.જી.)
૧૪. આસામ રાઇફલ્સ.
૧૫. સ્પેશિયલ સર્વિસ બ્યુરો (ખાસ સેવા કાર્યાલય)
૧૬. વિશેષ શાખા (સીઆઈડી), આંદામાન અને નિકોબાર
૧૭. ગુનાશોધક શાખા- સી.આઈ.ડી.-સી.બી., દાદર અને નગરહૃવેતી.
૧૮. વિશેષ શાખા, લક્ષ્યીપ પોલીસ.

ટી. કે. વિશ્વનાથન  
ભારત સરકારના સચિવ.

# પરિચિચ-૨ : ફી નિયમ - તુલનાત્મક કોઠી

(૩૦ સપ્ટેમ્બર ૨૦૦૯ની સ્થિતિ મુજબ) \*

અરકાર	આરજી ફી	વધારણી ફી	નાણા ભરવાની રીત
કેળખ શાસ્ત્ર પ્રદેશ	રૂ.૧૦/-	<ul style="list-style-type: none"> <li>એઝ / એઝ પેપર - રૂ.૨/- - પાનાં દીન</li> <li>મોટા કાગળ - મૂળ રીમત</li> <li>કુંફિત-પ્રકાશન - નાક્ષી કરેલ કિંમતે</li> <li>ફ્રેશ રૂ.૨/- - પાનાં ટીન</li> <li>ફ્લોપી / ટિસ્ક - રૂ.૫૦/-</li> <li>નમૂળા / મોડલ - મૂળ રીમત</li> <li>રેકર્ડની તપાસ - પ્રથમ કલાક માટે વિનામૂલ્યે</li> <li>તે પછીના દરેક કલાકના રૂ.૫/-</li> </ul>	રસ્પીદ સાથે રોકડા / ડિમાન્ડ ફ્રેશ / બેન્કર ચેક
અંગ્રેન્ડશા	કોઈ ફી નાઈ તાલુકા સ્ટેરે રૂ.૫/-	<ul style="list-style-type: none"> <li>એઝ / એઝ પેપર રૂ.૨/- - પાનાં દીન</li> <li>મોટો કાગળ - મૂળ રીમત</li> <li>કિંમત નક્કી કરેલ પ્રકાશન, છાપેલ સામગ્રી,</li> <li>લખાયા, નકશાઓ, આયોજન, ફલોપી, સીડી</li> <li>મોડલ અથવા સામગ્રી - વેચાણ કિંમતે</li> <li>૧. જાહેર ચેમબલીની ફલોપી - રૂ.૫૦/-,</li> <li>૭૦૦ ચેમબલીની સીડી રૂ.૧૦૦/-, કીવીડી - રૂ.૨૦૦/-</li> <li>નમૂળા અને મોડલ - મૂળ રીમત</li> <li>ટપાલ ખર્ચ અલગાથી</li> <li>રેકર્ડની તપાસ - પ્રથમ કલાક વિનામૂલ્યે</li> <li>અને પછી દર ૧૫ મિનિટના રૂ.૫/-</li> </ul>	રસ્પીદ સાથે રોકડા / ડિમાન્ડ ફ્રેશ / બેન્કર ચેક

- જમ્બુ - કાર્યક્રમ દેમના વિશે બંધારાયી દરજાને કારણે માહિતી અધિકાર અધિનિયમના વિસ્તારમાં આપવું નથી અને એટલે તેમણે કોઈ લિયામો અનુભૂતિ નથી.
- આ ફી કોઠા સામાન્ય માર્ગદર્શન માટે છે. સીએચઆરઆઈ એવો કોઈ દાવો કરતું નથી કે આ માહિતીની બધી વિગત સાચી છે. જે તમને આ કોઠાચોમાં જીવાપેલ માહિતીમાં કચાંચ મુશ્કેલી પડે તો તમે તમારા રાજ્યના લિયમો જોઈ શકો છો.

સરકાર	આજી ઝી	વધારણી ઝી	નાથા ભરવાની રીત
અયુષ્માચાર પડેશ	રૂ.૫૦/- (ઇલેક્ટ્રોનિક અરજીમાં સાત દિવસમાં ઝી ભરવાની રહેશે.)	<ul style="list-style-type: none"> <li>કિંમત નક્કી કરેલ પ્રકાશન સિવાય અન્ય માટે - રૂ.૫/- - પાનાં દીન</li> <li>કિંમત નક્કી કરેલ પ્રકાશન - મૂળ કિંમત ટેકર સંબંધી ટાલવેલે /બીડ/ કવાઈશન /દંધાઈચ કરારોની માહિતી માટે રૂ.૫૦૦/-</li> </ul>	ફેજરી ચલાગ ફેજરી ચલાગ
આસામ	રૂ.૧૦/-	<ul style="list-style-type: none"> <li>ઓઝ/ઓડ પેપર - રૂ.૨/- - પાનાં દીન મોટા કાગળ - મૂળ કિંમત</li> <li>કિંમત નક્કી પ્રકાશન - નક્કી કરેલ કિંમત, ઝોઝ /હોલારા - રૂ.૨/- - પાનાં દીન</li> <li>ફોલી/કિસ્ક - રૂ.૫૦/-</li> <li>નમૂળા/મૉડલ - મૂળ કિંમત</li> <li>કેકની તપાસ - પ્રથમ કલાક વિના મૂલ્યે પછી દર ૧૫ મિનિટના - રૂ.૫/-</li> </ul>	રસીદ સાથે રોકડા / ડિમાંડ ફોફ /બેંકર ચેક
ગુજરાત	રૂ.૧૦/-	<ul style="list-style-type: none"> <li>ઓઝ/ઓડ પેપર - રૂ.૨/- - પાનાં દીન મોટા પેપર - મૂળ કિંમત</li> <li>કિંમત નક્કી પ્રકાશન - નક્કી કરેલ કિંમત ઝોઝ - રૂ.૨/- - પાનાં દીન</li> <li>ફોલી/કિસ્ક - રૂ.૫૦/-</li> <li>નમૂળા/મૉડલ - મૂળ કિંમત</li> <li>કેકની તપાસ - રૂ.૫૦ કલાક દીન</li> </ul>	રસીદ સાથે રોકડા / ફેજરી ચલાગ

નામ	અરજી રીત	બધારાની રીત	નામાં ભરવાની રીત
શરકાર જિલ્હાસગડ	અરજી રીત <u>બીપીએલ અરજીદારો માટે</u>	<ul style="list-style-type: none"> <li>નો માહિતી વ્યક્તિના શ્રદ્ધાન સંબંધી હોય તો તેને મારોલ સ્વરૂપમાં (ઉપલબ્ધ કરતાપણી જેએઝ).</li> <li>અગર પોતાના સંબંધિત નથી અને ૫૦ ટેનોલ કરેલા પાણમાં આપી શકાય છે અથવા માહિતી આપવાની કિંમત રૂ.૧૦૦ છે તો માહિતી ઘેરીજીત સ્વરૂપમાં આપવામાં આવશે.</li> <li>નો માંગવામાં આવેલ માહિતી ૫૦ ટેનોલ કરેલ પાણથી વધુ હોય અથવા તેને ઉપલબ્ધ કરતાની કિંમત રૂ.૧૦ થી વધુ છે તો માહિતી આ દિક્કર આ દીનેચેમની કલાક ૭(૮) મુજબ કારણ જળાવીને અરજદારને ફાઇલો / દસ્તાવેજોનું નિરીક્ષા કરવા માટે કરેટીમાં બોલાવવામાં આવશે.</li> </ul>	<ul style="list-style-type: none"> <li>નામાં ભરવાની રીત</li> </ul>
અનોરિઝસા	રૂ.૧૦/-	<ul style="list-style-type: none"> <li>એન/એન્ડ પેપર - રૂ.૨/- - પાનાં દીરઠ</li> <li>મોટા પેપર - મુણ કિંમત</li> <li>નકશા / ચોજનાઓ - મહેનાન અને સાધન સામગ્રી તેમજ અન્ય સંબંધિત ખરીલા આધારે જાહેર માહિતી આ દિક્કરી નક્કી કરે તે મુજબ,</li> <li>વિકિયો ડેસેટ/માઇક્રોફિલ્મ/માઇક્રોફિશ- મહેનાન અને સાધન સામગ્રી અથવા સંબંધિત ખરીલા આધાર</li> <li>જાહેર માહિતી આ દિક્કરી નક્કી કરે તે મુજબ ફલોપી ટિક્સ્ટ (૧.૪૪ એમ્બલી) / કપર સાથેની સીડી - રૂ.૧૦૦/-</li> <li>ટેકન્કની તપાસ - પ્રથમ કલાક વિનાક્ષેપણે પછી રૂ.૨</li> <li>૧૫ મિનિટના - રૂ.૫/-</li> <li>છપેલ પ્રકાશન - મુણ કિંમત</li> </ul>	<ul style="list-style-type: none"> <li>અરજી રીત:</li> <li>રોકડ/ફેજની અલાવા</li> <li>મધ્યરાની રીત:</li> <li>રોકડ</li> </ul>

સરકાર	અરજી ફી	વધારણી ફી	નાણા ભરવાની રીત
ઉત્તરપ્રદેશ	રૂ. ૧૦/-	<ul style="list-style-type: none"> <li>ઓરા/એર પેપર - રૂ.૨/- પાનાં દીન</li> <li>મોટા કગળ - મૂળ કિંમતે</li> <li>છપેલ પ્રકાશન - જનકી કેલ કિંમતે</li> <li>ફલોપી/ડિઝન - રૂ.૫૦/-</li> <li>નમૂના/મૉડલ - મૂળ કિંમતે</li> <li>ટેક્સ નિરીક્ષણ - પ્રથમ કલાક રૂ.૧૦ અને તે પછી દર ૧૫ મિનિટના - રૂ.૫/-</li> </ul>	ટેક્સ/ડિમાંડ ફ્રાફટ / બેંકર ચેક
ઉત્તરાખંડ	રૂ. ૧૦/-	<ul style="list-style-type: none"> <li>ઓરા/એર પેપર - રૂ.૨/- પાનાં દીન</li> <li>મોટા કગળ - મૂળ કિંમતે</li> <li>છપેલ પ્રકાશન - જનકી કેલ કિંમતે</li> <li>ફલોપી/ડિઝન - રૂ.૫૦/-</li> <li>નમૂના/મૉડલ - મૂળ કિંમતે</li> <li>ટેક્સ નિરીક્ષણ - પ્રથમ કલાક વિનામૂલ્યે પછી દર ૧૫ મિનિટના - રૂ.૫/-</li> </ul>	ટેક્સ/ડિમાંડ ફ્રાફટ / બેંકર ચેક / પોસ્ટલ ઓર્ડર / દ્રેઝરી ચલાયા અથવા નીન જ્યુટીશયલ સ્ટેમ્પ પેર
કાશ્મીર	રૂ. ૧૦/-	<ul style="list-style-type: none"> <li>ઓરા/એર પેપર - રૂ.૨/- પાનાં દીન</li> <li>મોટા કગળ - મૂળ કિંમતે</li> <li>છપેલ પ્રકાશન - જનકી કેલ કિંમતે</li> <li>ફલોપી/ડિઝન - રૂ.૫૦/-</li> <li>નમૂના/મૉડલ - મૂળ કિંમતે</li> <li>ટેક્સ નિરીક્ષણ - પ્રથમ કલાક વિનામૂલ્યે પછી દર ૧૫ મિનિટના - રૂ.૫/-</li> </ul>	ભારતીય પોસ્ટલ ઓર્ડર / ડિમાંડ ફ્રાફટ/બેંકના ચેક / કાર્યાલય સંહિતા મેજબ સરકારી તિળિયામાં ચૂક્યાયા

સરકાર	આરજી ફી	વધારણી ફી	નાણા॥ ભરવાની રીત
કરણ	રૂ. ૧૦/-	<ul style="list-style-type: none"> <li>● એઠ સાઇલની નકલ - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● તેનાથી મોટા કાગળમાં - મુણ કિંમતે</li> <li>● ફલોપી/સીડી - રૂ.૫૦/-</li> <li>● આપેલી નકલ - રૂ.૨/- નકલ દીઠ</li> <li>● નમેના/મૉડલ - મુણ કિંમતે</li> <li>● રેકડ નિરીક્ષણ - પ્રથમ કલાક વિના મૂલ્યે અને તે પછીના દર અદદા કલાકના - રૂ.૧૦/-</li> </ul>	રેકડ, કોઈ ફી દેખેમું, ફેઝી અલાય, ટિમાન ફ્રાઇટ અથવા નેકર રેક
ગુજરાત (હિનેકર્નીક અરજી - સત્ત દિવસની અંદર ફી જેમા કરાવવી જોઈએ)	રૂ.૨૦/-	<ul style="list-style-type: none"> <li>● એઠ/એઠ્ પેપર - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● તેનાથી મોટા કાગળ - મુણ કિંમતે</li> <li>● પ્રકશન - મુણ કિંમતે</li> <li>● ફલોપી/ટિક્સ્ટ - રૂ.૫૦/-</li> <li>● નમેના/મૉડલ / ડોટેગ્રાફ - મુણ કિંમતે</li> <li>● રેકડ નિરીક્ષણ - પ્રથમ અદદા કલાક વિના મૂલ્યે અને તે પછીના દર અદદા કલાક માટે - રૂ.૨૦/-</li> <li>● જ્યાં આવી વ્યવરસ્થા અથવા પછી પહેલેથી આસ્તિત્વમાં છે ચાં ઉપરની કિંમત લાગુ નહીં પડે, પરંતુ ચાંચ્યા આપવા દર અને કિંમત લાગુ પડશે.</li> </ul>	રેકડ / ટિમાન ફ્રાઇટ/ પે એન્ડ/લોન ફ્લુડાશિયન સ્ટેપ
ગોવા	રૂ. ૧૦/-	<ul style="list-style-type: none"> <li>● એઠ/એઠ્ પેપર - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● તેનાથી મોટા કાગળ - મુણ કિંમતે</li> <li>● છાપેલ પ્રકશન - નક્કી કરેલ કિંમતે</li> <li>● ક્રેચ્સ / ઉતારો - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● ફલોપી/ટિક્સ્ટ - રૂ.૫૦/-</li> <li>● નમેના/મૉડલ - મુણ કિંમતે</li> <li>● રેકકર્નું નિરીક્ષણ પ્રથમ કલાક વિના મૂલ્યે અને તે પછી દર ૧૫ મિનિટના - રૂ.૫/-</li> </ul>	રેકડ / ટિમાન ફ્રાઇટ/ નેકર રેક

સરકાર	અરજી ફી	વધારણી ફી	બાળા ભરવાની રીત
અરંભંડ	રૂ. ૧૦/-	<ul style="list-style-type: none"> <li>● એઝ/એઝ પેપર - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● તેનાથી મોટા કાગળ - મૂળ હિંમતે</li> <li>● અપેલ પ્રકાશન - નક્કી કરેલ હિંમત</li> <li>● એરોસ્ટ / ઉતારો - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● ફલોપી/ચિક્ક - રૂ.૫૦/-</li> <li>● નાસૂના/માર્કલ - મૂળ હિંમતે</li> <li>● રેકકન્ચું નિરીક્ષણ - પ્રશ્નમ કલાક માટે વિના મૂલ્ય,</li> <li>● ત્યાર પછીના દર અકદ્યા કલાકના - રૂ.૫/-</li> </ul>	રસ્તી દ સાથે રોકડ ચ્યૂક્યણી/ ડિમાંડ ફ્રાઇટ/બેન્કર ચેક
તામિલનાડુ	રૂ. ૧૦/-	<ul style="list-style-type: none"> <li>● એઝ/એઝ પેપર - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● તેનાથી મોટા કાગળ - મૂળ હિંમતે</li> <li>● અપેલ પ્રકાશન - નક્કી કરેલ હિંમત</li> <li>● ફલોપી/ચિક્ક - રૂ.૫૦/-</li> <li>● નાસૂના/માર્કલ - મૂળ હિંમતે</li> <li>● રેકકન્ચું નિરીક્ષણ - પ્રશ્નમ કલાક વિના મૂલ્યે અને</li> <li>● તે પછીના દર ૧૫ મિનિટના - રૂ.૫/-</li> </ul>	રોકડ / ડિમાંડ ફ્રાઇટ બેન્કર ચેક
ત્રિપુરા	રૂ. ૧૦/-	<ul style="list-style-type: none"> <li>● એઝ/એઝ પેપર - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● તેનાથી મોટા કાગળ - મૂળ હિંમતે</li> <li>● અપેલ પ્રકાશન - નક્કી કરેલ હિંમતે</li> <li>● એરોસ્ટ / ઉતારો - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● ફલોપી/ચિક્ક - રૂ.૫૦/-</li> <li>(શરત ઓટલી કે કોનેપ્યુટરમાં આ માહિતી ઉપલબ્ધ હોય)</li> <li>● નાસૂના/માર્કલ - મૂળ હિંમતે</li> <li>● રેકકન્ચું નિરીક્ષણ - પ્રશ્નમ કલાક વિના મૂલ્યે</li> <li>● તે પછી દર ૧૫ મિનિટ ના - રૂ.૫/-</li> </ul>	રસ્તી દ સાથે રોકડ

સરકાર	આરજી ઝી	વધારાની ઝી	બાધા ભરવાની રીત
ઇમાણ તેમજ દિવ / અને દાદરા નગર હૈવેલી	રૂ.૧૨૫/-	<ul style="list-style-type: none"> <li>● એજ / એઝ પેપર - રૂ.૨/- - પાણાં દીન</li> <li>● તેનાથી મોટા કાગળ - મૂળ કિંમતે ફલોપી - રૂ.૫૦/- , થીડી - રૂ.૧૦૦/-</li> <li>● નમુના / મોર્ટલ - મૂળ કિંમતે રેકડનું નિરિક્ષણ અરજીની તારીખથી</li> <li>● રેકડનું નિરિક્ષણ રૂ.૧૦ વર્ષ જુન રેકડના નિરિક્ષણની ઝી - રૂ.૧૦૦/- દિવસ દીન અરજીની તારીખથી રૂ.૧૦ વર્ષ ઝૂણ   રેકડના નિરિક્ષણની ઝી - રૂ.૨૫/- દિવસ દીન.</li> </ul> <p>એક દિવસમાં ૩ કલાકથી વધુ નિરિક્ષણ કરીન્તુ સ્પીકર નથી.</p>	દેઝરી ચ્રલાગ (૬.૬.૬.ભારતીય સ્ટેટ લેઝ દમણ અને સૌરાષ્ટ્ર સ્ટેટ લેઝ દિવ)
હિન્દી / આંદ્રા માન અને નિકોબાર ટાપુ / ચંઈગાલ કેળક શાસ્ત્ર પ્રદેશ	રૂ.૧૧૦/-	<ul style="list-style-type: none"> <li>● એજ / એઝ પેપર - રૂ.૨/- - પાણાં દીન</li> <li>● તેનાથી મોટા કાગળ - મૂળ કિંમતે ફલોપી / કિરક - રૂ.૫૦/-</li> <li>● નમુના / મોર્ટલ - મૂળ કિંમતે છપોલ પ્રકાશન - નજીકી કરેલ કિંમત રેકડ નિરિક્ષણ - પ્રથમ કલાક વિના મૂલ્યે અને ત્યાર પણીના રૂ.૧૫ ગ્રિનિયના - રૂ.૫/-</li> </ul>	રસ્સીદ ચાણે રેકડ / અંક ફાફડ / લેઝ ચેક
નગાલિન	રૂ.૧૧૦/-	<ul style="list-style-type: none"> <li>● એજ / એઝ પેપર - રૂ.૨/- - પાણાં દીન</li> <li>● તેનાથી મોટા કાગળ - મૂળ કિંમતે છપોલ પ્રકાશન - નજીકી કરેલ કિંમત પ્રોલેસ્ / ઉતારા - રૂ.૨/- - પાણાં દીન</li> <li>● ફલોપી / કિરક - રૂ.૫૦/-</li> <li>● નમુના / મોર્ટલ - મૂળ કિંમતે રેકડનું નિરિક્ષણ - પ્રથમ કલાક વિનામુલ્યે ત્યાર પણી દર કલાકના - રૂ.૫/-</li> </ul>	રસ્સીદ સાથે રેકડ / ડિમાંડ ફાફડ / લેઝ ચેક

સરકાર	અરજી ફી	વધારણી ફી	નાખા ભરવાની રીત
પંજાબ	રૂ.૧૦/-	<ul style="list-style-type: none"> <li>● એઠ/એટ પેપર - રૂ.૨/- પાણા દીન</li> <li>● તેનાથી મોટા કાગળ - મુણ કિંમત</li> <li>● આપેલ પ્રકાશન - નક્કી કરેલ કિંમત</li> <li>● ઝોરોક્ષ / ઉતારા - રૂ.૧૦/- પાણા દીન</li> <li>● ફલોપી/કિર્ક - રૂ.૫૦/-</li> <li>● રેકર્ડ નિરીક્ષાએ - પ્રથમ કલાક વિના મુજબે ચાર પછી દર ૧૫ મિનિટ માટે - રૂ.૫/-</li> </ul>	રોકડ/ બેંક ડ્રાફ્ટ/ ચેક/દ્રેઝની ચાલણ/ ભારતીય પોર્ટલ ઓફિસ
પાઞ્ચિમ બંગાળ	રૂ.૧૦/-	<ul style="list-style-type: none"> <li>● એઠ/એટ પેપર - રૂ.૨/- પાણા દીન</li> <li>● તેનાથી મોટા પેપર - મુણ કિંમત</li> <li>● આપેલ પ્રકાશન - નક્કી કરેલ કિંમત</li> <li>● ઝોરોક્ષ / ઉતારા - રૂ.૨/- પાણા દીન</li> <li>● ફલોપી/કિર્ક - રૂ.૫૦/-</li> <li>(કોમ્પ્યુટરમાં માહિતી ઉપલબ્ધ હોય તે શરતે) ● નમના/મૌડલ - મુણ કિંમતે</li> <li>● રેકર્ડ નિરીક્ષાએ - પ્રથમ કલાક - રૂ.૧૦/- ચાર પછી દર ૧૫ મિનિટ માટે - રૂ.૫/-</li> </ul>	કોઈ ફી
પાકિએન્ટી	રૂ.૧૦/-	<ul style="list-style-type: none"> <li>● એઠ/એટ પેપર - રૂ.૨/- પાણા દીન</li> <li>● તેનાથી મોટા કાગળ - મુણ કિંમતે</li> <li>● આપેલ પ્રકાશન - નક્કી કરેલ કિંમત,</li> <li>● ઝોરોક્ષ / ઉતારા રૂ.૨/- પાણા દીન</li> <li>● ફલોપી/કિર્ક - રૂ.૫૦/-</li> <li>(માહિતી કોમ્પ્યુટરમાં ઉપલબ્ધ હોય તે શરતે) ● નમના/મૌડલ - મુણ કિંમતે</li> <li>● રેકર્ડ નિરીક્ષાએ - પ્રથમ કલાકના રૂ.૧૦/- ચાર પછી દર ૧૫ મિનિટ માટે રૂ.૫/-</li> </ul>	કોઈ ફી

સરકાર	આરજી ફી	વધારણી ફી	નાખા ભરવાની રીત
બિહાર	રૂ. ૧૦/-	<ul style="list-style-type: none"> <li>● એઠ/એડ પેપર - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● તેલાથી મોથા કાગળ - રૂ.૩/- પાણાં દીઠ</li> <li>● છપેલ પ્રકાશન - નક્કી કરેલ હિંમત</li> <li>● શેટો - રૂ. ૧૦/- શૈટા દીઠ</li> <li>● ફલોપી/કિસ્ક - રૂ.૫૦/-</li> <li>● રેક્કડ નિર્મિકાણ - પ્રથમ કલાક વિના મૂલ્યે અને ત્યાર પણી દર કલાક માટે - રૂ.૫/-</li> </ul> <p><u>અપીલ કીઝી:</u></p> <p>અપીલ સત્તામંડળ / સત્તાધિકારીને પ્રથમ અપીલ - રૂ.૫૦/-</p>	સ્થીદ સાથે રોકડ / કિમાંડ ફાફડ / બેંકર ચેક
મહારાષ્ટ્ર	રૂ. ૧૦/-	<ul style="list-style-type: none"> <li>● એઠ/એડ પેપર - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● તેલાથી મોથા કાગળ - મૂળ હિંમતે</li> <li>● છપેલ પ્રકાશન - નક્કી કરેલ હિંમત</li> <li>● ફલોપી/કિસ્ક - રૂ.૫૦/-</li> <li>● નમુના / માર્કિલ - મૂળ હિંમતે</li> <li>● રેક્કડનું નિર્મિકાણ - પ્રથમ કલાક વિના મૂલ્યે અને ત્યાર પણી દર ૧૫ મિનિટ માટે રૂ.૫/-</li> <li>● એરોલાઇન / ઉતારા - રૂ.૨/- પાણાં દીઠ</li> </ul> <p><u>અપીલ કીઝી:</u></p> <p>અપીલ સત્તામંડળ / સત્તાધિકારીને પ્રથમ અપીલ - રૂ.૫૦/-</p>	રોકડ / કિમાંડ ફાફડ / બેંકર ચેક
મદયપ્રેદ્શ	રૂ. ૧૦/-	<ul style="list-style-type: none"> <li>● એઠ/એડ પેપર - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● તેલાથી મોથા કાગળ - મૂળ હિંમતે</li> <li>● છપેલ જથ્થા હિલેક્ટરોનિક ટેપિયમાં નકલો - નક્કી કરેલ હિંમતે</li> <li>● ફલોપી/કિસ્ક / વિઠીયો કેસેટ-રાજ્ય સહાયક / જાહેર માહિતી આ હિંમતી ક્ષણા નક્કી કરોશેલ હિંમત</li> <li>● રેક્કડનું નિર્મિકાણ-પ્રથમ કલાક અથવા તેનાથી ઓછા સમય માટે - રૂ.૫૦/- અને પણી દર ૧૫ મિનિટ માટે - રૂ.૨૫/-</li> </ul> <p><u>અપીલ કીઝી:</u></p> <p>અપીલ સત્તામંડળ / સત્તાધિકારીને પ્રથમ અપીલ - રૂ.૫૦/-</p> <p>રાજ્ય માહિતી આયોગને બીજુ અપીલ - રૂ.૧૦૦/-</p>	સ્થીદ સાથે રોકડ / નોન જચુકિશાયલ રેટેન્ચ

સરકાર	આજુ ઈ	વધારાની ઈ	બાધા અરવાની ઈ
મહારાજાં	રૂ.૧૦/-	<ul style="list-style-type: none"> <li>એર / એર પેપર - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>તેનાથી મોટા કાગળ - મૂળ કિંમતે</li> <li>બંકશા / દસ્તાવેજો વગેરે - નક્કી કરેલ કિંમત</li> <li>છપેલ પ્રકાશન - નક્કી કરેલ કિંમત</li> <li>અંગેસ / ડ્રોપાર - રૂ.૨/- પાણાં દીઠ</li> </ul> <p>ટપાલ ખર્ચ અલગાઈ-નો આરજદાર જાતે માહિતી મેળવા।</p> <p>આવે તો ફોર્ઝનખર્ચ નથી, ફ્લોપી / ડિસ્ક રૂ.૫૦/-</p> <p>દેક્કડનું જીર્ણકાશ - પ્રથમ ૧૫ મિનિટ વિના મૂલ્યે,</p> <p>ત્યાર પછીના દર ૧૫ મિનિટ માટે - રૂ.૫/-</p> <p><u>આપીલ ઈ:</u></p> <ul style="list-style-type: none"> <li>આપીલ સત્તામંડળ / સત્તાધિકારીને પ્રથમ અપીલ - રૂ.૨૦/-</li> <li>ચાલ્ય માહિતી આયોગને બીજુ અપીલ - રૂ.૨૦/-</li> </ul>	<p>આજુ ઈ : રૂસીદ પર રોકડા / ડિમાંડ ફૂફૂટ / બેંકર ચેક / કોઈ ઈ રેટિંગ</p> <p>વધારાનો ખર્ચ :</p> <p>રૂસીદ પર રોકડા</p> <p>ડિમાંડ ફૂફૂટ / બેંકર ચેક</p> <p>મની ઓક્કર</p> <p><u>આપીલ ઈ:</u></p> <p>રૂસીદ પર રોકડા</p> <p>ડિમાંડ ફૂફૂટ / બેંકર ચેક / કોઈ ઈ રેટિંગ</p>
મિઅરાં	રૂ.૧૦/-	<ul style="list-style-type: none"> <li>એર / એર પેપર - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>તેનાથી મોટા કાગળ - મૂળ કિંમતે</li> <li>પિંટઅઓર - રૂ.૫/- પાણાં દીઠ</li> <li>ફ્લોપી / ડિસ્ક - રૂ.૫૦/-</li> </ul> <p>છપેલ પ્રકાશન - નક્કી કરેલી કિંમત</p> <p>અંગેસ / ડ્રોપાર - રૂ.૨/- પાણાં દીઠ</p> <p>નમૃતના / મેંડલ, પિટાયો કેસેટ, માઇક્રો -</p> <p>મહેનાત અને સામગ્રીના ખર્ચના આધારે જાહેર માહિતી</p> <p>આધિકારી નક્કી કરશે</p> <p>દેક્કડનું જીર્ણકાશ - ગુણ્ણમ કલાક વિના મૂલ્યે</p> <p>અને ત્યાર પણી દર કલાક માટે - રૂ.૫/-</p> <p><u>આપીલ ઈ:</u></p> <p>બીજુ અપીલ - રૂ.૫૦/-</p>	<p>વધારાનો ખર્ચ :</p> <p>રોકડા</p> <p><u>આપીલ ઈ:</u></p> <p>કોઈ ઈ રેટિંગ</p>

સરકાર	આરજી ઈ	વધારની ઝી	બાણી ભરવાની રીત
મેધાલાય	રૂ.૧૦/-	<ul style="list-style-type: none"> <li>● એઝ/એડ પેપર - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● તેનાથી મોટા કાગળ - મૂળ કિંમતે</li> <li>● આપેલ પ્રકાશન - નક્કી કોલ કિંમત</li> <li>● ક્રોક્સ /ઉતારો - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● ફલોપી/કિસ્ક - રૂ.૫૦/- , નમૂળા/મોડલ - મૂળ કિંમતે</li> <li>● રેકડનું નિરીક્ષણા - પ્રથમ કલાક વિના મૂલ્યે</li> </ul> <p>ચાર પછીના દર ૧૫ મેનિટ માટે - રૂ.૫/-</p>	સ્લેદ પર રોકડા/ કિમાંડ ફ્રાફર/બેંકર ચેક
રાજ્યસ્થાન	રૂ.૫૦/-	<ul style="list-style-type: none"> <li>● એઝ/એડ પેપર - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● તેનાથી મોટા કાગળ - મૂળ કિંમતે</li> <li>● આપેલ પ્રકાશન - નક્કી કોલ કિંમત, ફલોપી/કિસ્ક - રૂ.૫૦/-</li> <li>● ક્રોક્સ /ઉતારો - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● નમૂળા /મોડલ - મૂળ કિંમતે</li> <li>● રેકડનું નિરીક્ષણા - પ્રથમ કલાક વિના મૂલ્યે</li> </ul> <p>ચાર પછી દર ૧૫ મેનિટ માટે - રૂ.૫/-</p>	સ્લેદ પર રોકડા/ કિમાંડ ફ્રાફર/બેંકર ચેક
સિક્રિકમ	રૂ.૧૦૦/-	<ul style="list-style-type: none"> <li>● એઝ/એડ પેપર - રૂ.૨/- પાણાં દીઠ</li> <li>● તેનાથી મોટા કાગળ - મૂળ કિંમતા સાથે ટપાલ ખર્ચ</li> <li>● આપેલ પ્રકાશન - નક્કી કોલ કિંમત</li> <li>● ક્રોક્સ /ઉતારો - રૂ.૫/- પાણાં દીઠ</li> <li>● ફલોપી/કિસ્ક-રૂ.૫૦/- (ક્રિમચટરમાં માલિતી ઉપલબ્ધ હોય એ શરૂટે)</li> <li>● નમૂળા/મોડલ- મૂળ કિંમત સાથે ટપાલ ખર્ચ</li> <li>● રેકડનું નિરીક્ષણા - પ્રથમ કલાક વિના મૂલ્યે અને</li> </ul> <p>ચાર પછી દર ૧૫ મેનિટ માટે - રૂ.૫/-</p> <p><u>અપાલ ઈ</u></p> <p>આપિલ સત્તામંડળ / સત્તાધિકારીને પ્રથમ અપીલ - રૂ.૧૦૦/-</p>	ફોં ઝી

સરકાર	અરજી ફી	વધારણી ફી	નાખા ભરવાની રીત
હિમાચલ પ્રદેશ	રૂ. ૧૦/-	<ul style="list-style-type: none"> <li>● છપેલ પ્રકાશન - છપેલ કિંમતે</li> <li>● એચ/નાનું પેપર - રૂ. ૧૦/- પાનાં દીઠ</li> <li>● તેનાથી મોટા કાગળ - ઓછામાં ઓછા રૂ. ૨૦/- ના</li> <li>● દરે પાના દીઠ મૂળ કિંમતે</li> <li>● ફલોપી - રૂ. ૫૦/-</li> <li>● સીડી - રૂ. ૧૦૦/-</li> <li>● ટેકન્કન્ચર્નું નિરીક્ષણા - દર ૧૫ મિનેટ માટે રૂ. ૧૦/-</li> </ul>	રૂઝી અલાદા / કિમાંડ ફ્રાફટ
હરિધાણ	રૂ. ૧૦/-	<ul style="list-style-type: none"> <li>● છપેલ પ્રકાશન - છપેલી કિંમતે</li> <li>● અધ્યાત્મ રૂ. ૧૦/- પાનાં દીઠ</li> <li>● એચ/ એડ પેપર - રૂ. ૧૦/- પાનાં દીઠ</li> <li>● તેનાથી મોટા કાગળ, ગંભેરા / મોડલ - મૂળ કિંમતે</li> <li>● ફલોપી - રૂ. ૫૦/-</li> <li>● સીડી - રૂ. ૧૦૦/-</li> <li>● નાસ્કાણ / મોડલ - મેળ કિંમતે</li> <li>● ટેકન્કન્ચર્નું નિરીક્ષણ પ્રથમ કલાક વિના મૂલ્ય,</li> <li>● ત્યાર પણી દર ૧૫ મિનેટ માટે - રૂ. ૧૦/-</li> </ul>	રૂઝી અલાદા / કિમાંડ ફ્રાફટ

## પરિશાષ્ટ-૩ : અપીલના નિયમો

(૩૦ સપ્ટેમ્બર ૨૦૦૫ની સ્થિતિ મુજબ)

કેન્દ્ર અને કેટલીક રાજ્ય સરકારોએ માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ અપીલના નિયમો નક્કી કર્યા છે. સીએચઆરઆઈએ અહીં બધા નિયમો દર્શાવ્યા નથી, કારણ કે ખૂબ વિસ્તૃત છે અને તેને સંક્ષિપ્તમાં દર્શાવવા જતાં કેટલીક મહત્વની બાબતો છૂટી જવાનો ભય રહે છે.

સામાન્ય રીતે અપીલ નિયમો નાગરિકોને વિભાગીય અપીલીય સત્તામંડળ અથવા માહિતી આયોગ સમક્ષ અપીલ કરવાની રૂપરેખા દર્શાવતા હોય છે. કેન્દ્ર સરકારના અપીલ નિયમોની નકલ મેળવવા માહિતીના અધિકારની વેબસાઇટ <http://rit.gov.in>પર કર્મચારીઓ, લોક ફરિયાદ તથા પેન્શન મંત્રાલય પર લોગ ઓન કરો; તમારી રાજ્ય સરકારે બહાર પાડેલા અપીલ નિયમો જાણવા માટે રાજ્ય સરકારની ઓફિસીઅલ વેબસાઇટ પર લોગ ઓન કરી શકો છો.

નોંધનીય છે કે, માહિતીના અધિકાર અધિનિયમમાં અપીલ માટે કોઈ ફી ની જોગવાઈ નથી, પરંતુ કેટલાક રાજ્ય સરકારોએ તેમના અપીલ નિયમોમાં ફીની જોગવાઈ કરી છે. આવી ફી માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ માન્ય નથી. તમે તમારા રાજ્ય માહિતી આયોગને ફરિયાદ કરી શકો છો કે તેઓ ફીને ગેરકાયદેસર ગણાવે અને જાહેરસત્તામંડળોને આદેશ આપે કે તેઓ ફી ન લે. જે રાજ્ય સરકારોએ અપીલ ફી નક્કી કરી છે તેની યાદી આ મુજબ છે :

સરકાર	અપીલીય સત્તામંડળોને અપીલ કરવાની ફી	માહિતી આયોગને અપીલ કરવાની ફી	ફી ભરવાની રીત
અરુણાચલ પ્રદેશ	શૂન્ય	રૂ.૫૦/-	ફ્રેજરી ચલણ
મધ્યપ્રદેશ	રૂ.૫૦/-	રૂ.૧૦૦/-	રોકડ/નોન-જ્યુડિશયલ સ્ટેમ્પ
મહારાષ્ટ્ર	રૂ.૨૦/-	રૂ.૨૦/-	ર્સીટ સાથે રોકડ/કિમાન્ડ ફ્રાફ્ટ/બેન્કર ચેક/કોઈ ફી સ્ટેમ્પ
ઓરિસ્સા	રૂ.૨૦/-	રૂ.૨૦/-	કોઈ ફી સ્ટેમ્પ
બિહાર	રૂ.૫૦/-	શૂન્ય	કોઈ ફી સ્ટેમ્પ
મિશ્રામ	રૂ.૪૦/-	રૂ.૫૦/-	કોઈ ફી સ્ટેમ્પ

## પરિશિષ્ટ-૪ માહિતી આયોગ-સંપર્ક વિગત\*

<p><b>કેન્દ્રીય માહિતી આયોગ</b>  <b>શ્રી વજાહત હબીબુલ્લાહ, મુખ્ય માહિતી આયુક્ત  બ્લોક-૪, પમા માળે, જૂના જેએનયુ પરિસર,  નવી દિલ્હી-૧૧૦૦૭૫</b>  ફોન : ૦૧૧-૨૫૭૧૭૩૫૪/૫૫  ફેક્સ : ૦૧૧-૨૫૭૧૭૩૫૪  ઈ-મેલ : whabibullah@nic.in  વેબસાઇટ : <a href="http://www.cic.gov.in">http://www.cic.gov.in</a></p>	<p>અરુણાચલ પ્રદેશ માહિતી આયોગ  <b>શ્રી ન. યોગન  મુખ્ય માહિતી આયુક્ત  (સરનામું ઉપલબ્ધ નથી)</b></p>
<p><b>આસામ માહિતી આયોગ</b>  <b>શ્રી આર. એસ. મુશાહી</b>  <b>મુખ્ય માહિતી આયુક્ત  ગૌહાટી ડિસ્પુર-જનતા ભવન  ગૌહાટી.</b>  ફોન : ૦૩૭૧-૨૨૫૨૭૦૪  ઈ-મેલ : scic-as@nic.in</p>	<p>અંધ્રપ્રદેશ માહિતી આયોગ  <b>શ્રી સી.કી. અરહા, મુખ્ય માહિતી આયુક્ત  બીજો માળે, હાકાભવન,  વિદ્યાનિસભા ભવનની સામે  હૈદરાબાદ-૫૦૦૦૨૨</b>  ફોન : ૦૪૦-૨૩૪૫૨૫૨૦/૫૫૪૦૫૫૫૯  મોબાઇલ -૦૯૮૪૯૮૦૯૮૦૧</p>
<p><b>ଓરિસસા માહિતી આયોગ</b>  <b>શ્રી ધીરેન્દ્ર નાથ પાઠી, મુખ્ય માહિતી આયુક્ત  રાજ્ય અતિથિ ગૃહ સામે, ૩મ-૪ એકમ ૫  ભુપનેશ્વર-૭૫૧૦૦૧. ફોન : ૦૬૭૪-૨૫૩૮૦૦૭  ફેક્સ ૦૬૭૪ -૨૫૩૫૪૦૪  ઈ-મેલ : secy_ic@ori.nic.in  વેબસાઇટ : <a href="http://orissasoochnacommission.nic.in">http://orissasoochnacommission.nic.in</a></b></p>	<p>ઉત્તર પ્રદેશ માહિતી આયોગ  <b>જર્સિટ્સ એમ.એ.ખાન  મુખ્ય માહિતી આયુક્ત  ઉત્તર પ્રદેશ રાજ્ય માહિતી આયોગ  કષ્ટો માળ, દિનિદ્રાભવન- લખનૌ-૭૫૧૦૦૧  ફોન : ૦૫૨૨-૨૨૮૮૫૮૮/૨૨૮૮૫૮૯</b></p>
<p><b>ઉત્તરાંધ્ર રાજ્ય માહિતી આયોગ</b>  <b>ડૉ. આર.એસ. ઠોલિયા</b>  <b>મુખ્ય માહિતી આયુક્ત  સી-૧૦, સેક્ટર-૧, ડિફેસ કોલોની  દાહોરાદુન-૨૪૮૦૦૧  ફોન-૦૧૩૫-૨૫૫૫૭૭૮/૭૮  ફેક્સ-૦૧૩૫-૨૫૫૫૭૭૮</b></p>	<p>કર્ણાટક માહિતી આયોગ  <b>શ્રી કે.કે.મિશ્ર, આઈએએસ  મુખ્ય માહિતી આયુક્ત  ૩મ-૩૦૨, ત્રીજોમાળ, વિદ્યાન સામે  બેંગલૂરુ-૫૬૦૦૦૧  ફોન : ૦૮૦-૨૨૨૫૩૫૫૧/૨૨૨૫૨૪૪૨  ફેક્સ-૦૮૦-૨૨૨૫૫૦૦૩  ઈ-મેલ : scic@karnataka.gov.in. ૦૮૦-૨૨૨૫૫૦૦૩</b></p>

\*જમુ-કાશ્મીર માહિતીના અધિકાર અધિનિયમના વિસ્તારમાં આપતું નથી તેથી ત્યાં માહિતી આયોગની સ્થાપના કરવામાં ચાવી નથી.  
બધા કેન્દ્ર સરકાર દ્વારા નિયંત્રિત અથવા ફંડ મેળવતા જાહેર સત્તામંડળો તેમજ બધા કેન્દ્ર શાસ્ત્રિત પ્રદેશ માટે.

<p><b>કેરળ માહિતી આયોગ</b>  <b>શ્રી પાલાટ મોહનદાસ, મુખ્ય માહિતી આયુક્ત  રાજ્ય માહિતી આયોગ, પુન્જન રોડ,  તિરુવનંતપુરમ-૭૮૫૦૩૮</b>  ફોન : ૦૪૭૧-૨૩૨૦૮૨૦,  ફેક્સ: ૦૪૭૧-૨૩૩૦૮૨૦</p>	<p><b>ગુજરાત માહિતી આયોગ</b>  <b>શ્રી આર.એન.દાસ, મુખ્ય માહિતી આયુક્ત  પ્રથમ માળે, અંકડા અને અર્થશાસ્ત્રની કચેરી,  સેક્ટર-૧૮, ગાંધીનગર-૩૮૨૦૧૮</b>  ફોન : ૦૭૯-૨૩૨૫૨૭૦૧ / ૨૩૨૫૨૮૮૯  ઈમેલ : gscic@gujarat.gov.in</p>
<p><b>ગોવા માહિતી આયોગ</b>  <b>શ્રી એ. વેંકટ રટનમ, મુખ્ય માહિતી આયુક્ત  શર્મા શક્તિ ભવન, ગ્રાઉન્ડ ફ્લોર  પતો પાનાજી, ગોવા-૪૦૩૪૦૧  ફોન : ૦૮૩૨-૨૪૩૭૮૮૦  મો : ૦૯૮૯૦૨૮૭૨૮૨ ઈમેલ : avr@nic.in</b></p>	<p><b>છતીસગઢ માહિતી આયોગ</b>  <b>શ્રી એ.કે. વિજયવર્ગિય, મુખ્ય માહિતી આયુક્ત  નિર્મલ છાચા ભવન, બોટલ હાઉસની પાસે,  મીરા દાતાર રોડ શંકરનગર-રાજપુર-૪૮૨૦૦૭  ફોન : ૦૭૭૧-૪૦૨૪૪૦૬  ઈમેલ : akvijayvariga@nic.in</b></p>
<p><b>કારખંડ માહિતી આયોગ</b>  <b>શ્રી હરિશંકર પ્રસાદ, મુખ્ય માહિતી આયુક્ત  અન્જનિયરીંગ હોસ્ટેલ નં.-૨,  ધૂરવાં, રાંચી-૮૩૪૦૦૪  મો. ૦૬૪૩૧૩૯૪૮૭</b></p>	<p><b>તામિલનાડુ માહિતી આયોગ</b>  <b>એસ. રામાકૃષ્ણાન્, મુખ્ય માહિતી આયુક્ત  ૮૮, ડૉ. અલાગપ્પા માર્ગ,  કૃષ્ણાવિલા, પુરુસવક્કમ, ચેનાઈ  ફોન : ૦૪૪-૨૫૪૦૩૩૫૫</b></p>
<p><b>ત્રિપુરા માહિતી આયોગ</b>  <b>શ્રી બી. કે. અચ્યુતર્ણી, મુખ્ય માહિતી આયુક્ત  સચિવાલય ભવન, ગોરખા વસ્તી,  પં. નહેરુ કોમ્પ્લેક્સ, અગરતલા,  ત્રિપુરા (પશ્ચિમ) - ૭૮૬૦૦૫  ફોન : ૦૩૮૧-૨૨૧૮૦૨૧</b></p>	<p><b>દમણ તેમજ ટિવિ/દાદર અને નગર હવેલી</b>  <b>કેન્દ્ર માહિતી આયોગ બ્લોક-૪, પમો માળ,  જૂનો જેનેન્યુ પરિસર, નવી ટિલ્હી-૧૧૦૦૫૭  ફોન : ૦૧૧-૨૫૭૧૭૩૫૨/૫૫  ફેક્સ -૦૧૧-૨૫૭૧૭૩૫૪  ઈમેલ : whabibullah@nic.in</b></p>
<p><b>નાગાર્લેન્ડ માહિતી આયોગ</b>  <b>શ્રી પી.તાલિતેમજેનાઓ- મુખ્ય માહિતી આયુક્ત  કોઠિમા-૭૮૭૦૦૧ નાગાર્લેન્ડ  ફોન : ૦૩૭૦-૨૨૭૦૦૭૯ / ૨૨૭૦૦૮૨</b></p>	<p><b>દિલ્હી/ આંદામાન -નિકોબાર ટાપુ</b>  <b>કેન્દ્ર માહિતી આયોગ, બ્લોક-૪ પમો માળ, જૂનો  જેનેન્યુ પરિસર, નવી ટિલ્હી-૧૧૦૦૫૭  ફોન : ૦૧૧-૨૫૭૧૭૩૫૨/૫૫ ફેક્સ ૦૧૧-  ૨૫૭૧૭૩૫૪ ઈમેલ : whabibullah@nic.in</b></p>
<p><b>પંજાબ માહિતી આયોગ</b>  <b>શ્રી રાજન કશ્યપ, મુખ્ય માહિતી આયુક્ત  એસસીઓ નં.૮૪-૮૫ સેક્ટર-૧૭ સી,  ચંદ્લીગઢ-૧૬૦૦૧૭ ફોન: ૦૧૭૨-૪૬૩૦૦૫૦  ફેક્સ : ૦૧૭૨-૪૬૩૦૦૫૨  ઈમેલ : scic@punjabmail.gov.in</b></p>	<p><b>પશ્ચિમ બંગાળ માહિતી આયોગ</b>  <b>શ્રી અરુણ ભણ્ણાચાર્ય, મુખ્ય માહિતી આયુક્ત  ભવાની ભવન, બીજો માળ,  કોલક્તા-૭૦૦૦૨૭  ફોન : ૦૩૩-૨૨૮૮૮૮૫૮</b></p>

<p>પોંડીચેરી માહિતી આયોગ શ્રી સી.એસ. જૈરવાલ, મુખ્ય માહિતી આયુક્ત મુખ્ય સચિવાલય, સી બ્લોક, ત્રીજોમાળ, બીચ રોડ, પાંડિચરી-૫૦૫૦૦૧ ફોન :૦૪૧૩-૨૩૩૩૨૭ ફેક્સ : ૦૪૧૩-૨૩૩૭૫૭૫ ઈમેલ : cs@pon.nic.in</p>	<p>બિહાર માહિતી આયોગ શ્રી શશાંક કુમાર સિંહ, મુખ્ય માહિતી આયુક્ત ઓથો માળ, માહિતી ભવન બેલી રોડ, (નવા સચિવાલયની સામે) પટના-૮૦૦૦૦૧. મોબાઇલ-૦૯૪૩૦૦૦૭૫૦૦</p>
<p>મહિન્દુર માહિતી આયોગ શ્રી સુંદરલાલ સિંહ- મુખ્ય માહિતી આયુક્ત જૂના સચિવાલય, ઇમ્ફાલ-૭૮૫૦૦૧ ફોન : ૦૩૮૫-૨૨૨૦૮૮૧ ફેક્સ : ૦૩૮૫-૨૨૨૦૮૮૧ ઈમેલ : sunderlal@nic.in</p>	<p>મદ્યપ્રદેશ માહિતી આયોગ મુખ્ય માહિતી આયુક્ત નિવચિન ભવન-બીજો માળ, જેલ રોડ, એમ.પી.નગર, મદ્યપ્રદેશ-૪૯૨૦૧૯ ફોન : ૦૭૫૫-૨૭૫૧૩૬૬/૭૭/૮૮ ફેક્સ : ૦૭૫૫-૨૭૫૧૩૬૮</p>
<p>મહારાષ્ટ્ર માહિતી આયોગ ડૉ. સુરેશ વી. જોધી, મુખ્ય માહિતી આયુક્ત ૧૩મો માળ, ન્યુ એડમિનિસ્ટ્રેટીવ બિલ્ડિંગ મંત્રાલયની સામે, મેડમ કામા રોડ, મુંબઈ-૪૦૦૦૩૮ ફોન : ૦૨૨-૨૨૮૫૦૦૭૮ મો.૦૯૮૨૧૫૨૫૨૭ ઈમેલ : sureshjosh@gmail.com</p>	<p>મિશ્રોરમ માહિતી આયોગ શ્રી રોબર્ટ રંગઢાલા મુખ્ય માહિતી આયુક્ત ખતલા, કેપિટલ કોમ્પ્લેક્સ, આઈઓલ -૭૮૫૦૦૧ ફોન : ૦૩૮૮-૨૩૩૪૮૨૯,૩૩ મો. ૦૯૪૩૯૪૦૨૪૭</p>
<p>મેઘાલય માહિતી આયોગ શ્રી જી.પી. વાહલાંગ, મુખ્ય માહિતી આયુક્ત મેઘાલય સચિવાલય કક્ષ-૨૨૫ શિલાંગ-૭૮૩૦૦૧. ફોન : ૦૩૭૪-૨૨૨૬૩૪૫ ઈમેલ : gpw@shillong.meg.nic.in</p>	<p>રાજ્યસ્થાન માહિતી આયોગ શ્રી એમ.ડી.કોરાની, મુખ્ય માહિતી આયુક્ત યોજના ભવન, બીજો માળ, સચિવાલયની પાછળ તિલક માર્ગ, જ્યાપુર. ફોન : ૦૧૪૧-૨૨૨૦૨૮૮</p>
<p>સિક્કિમ માહિતી આયોગ શ્રી ડી.કે. ગજમેર, મુખ્ય માહિતી આયુક્ત તાશીલિંગ સચિવાલય ગંગાટોક-૭૩૭૧૦૧ સિક્કિમ</p>	<p>હિમાચલ પ્રદેશ માહિતી આયોગ શ્રી પી.એસ.રાણા, મુખ્ય માહિતી આયુક્ત હિમાચલ પ્રદેશ સરકાર સચિવાલય, સિમલા-૧૭૧૦૦૨ ઈમેલ : scic-hp@nic.in</p> <p>હરિયાણા માહિતી આયોગ શ્રી જી. માધવન, મુખ્ય માહિતી આયુક્ત કેન્દ્રીય સચિવાલય કાર્યાલય, ૭૦-૭૧, પ્રથમ માળે સેક્ટર-૮-સી, મદ્યમાર્ગ-ચંડીગઢ ફોન : ૦૧૭૨- ૨૭૨૯૫૯૮ ફેક્સ : ૦૧૭૨-૨૭૨૯૫૯૮ ઈમેલ : madhavang@hry.nic.in</p>

# પરિશિષ્ટ-પ સંશાધન અને સંપર્ક - સૂત્ર

- **ભારત સરકારની માહિતીના અધિકાર ઉપરની વેબસાઈટ**  
કર્મચારીઓ, જાહેર ફરિયાદ અને પેશાન મંત્રાલયની માહિતીના અધિકાર ઉપરની ઓફિશિયલ વેબસાઈટ જે માહિતીના અધિકાર અધિનિયમ અને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ નિયમોની સંપૂર્ણ વિગત પૂરી પાડે છે.  
વેબ સાઈટ : <http://righttoinformation.gov.in>.
- **માહિતીનો અધિકાર- અ સિટિઝન ગેટવે**  
ભારત સરકાર દ્વારા નાગરિકો માટે વેબ ઉપર સરકારી વિભાગો દ્વારા પ્રકાશિત માહિતી સુધી પહોંચ ઉપલબ્ધ કરાવતું માહિતીના અધિકાર પોર્ટલ. વેબ સાઈટ : <http://rti.gov.in>.
- **કેન્દ્રનું માહિતી આચોગ**  
કેન્દ્રીય માહિતી પંચની ઓફિશાયિલ વેબસાઈટ જે નાગરિકોને આચોગના કાર્ય-સંચાલન, તેની નિર્ણય-પ્રક્રિયા, અપીલ અને ફરિયાદો પર નિર્ણય વિશે એક આંતરદાખિલ પ્રદાન કરે છે. વેબ સાઈટ : <http://www.cic.gov.in>
- **કોમનપેલ્થ હુમન રાઇટ્સ ઇનિશિએટિવ**  
ભારતમાં માહિતીના અધિકાર ચળવણની વિસ્તૃત પાર્શ્વ ભૂમિ સહિત કેન્દ્ર અને રાજ્યો સ્તરે આ સંદર્ભમાં થઈ રહેલ પ્રગતિ તેમજ પ્રસંગોની વિગત. ઈ-મેલ : [chriall@nda.vsnl.net.in](mailto:chriall@nda.vsnl.net.in)  
વેબ સાઈટ : <http://www.humanrightsinitiative.org/programs/ai/rti/india/india.htm>
- **રાષ્ટ્રીય લોક માહિતીનો અધિકાર અભિયાન (NCPRI)**  
આ અભિયાન રાષ્ટ્રીય સ્તરે માહિતીના અધિકારની વકાલત કરવા માટે આચોજીત કરવામાં આવ્યું છે. આ એક એવું રાષ્ટ્રીય મંચ છે જે દેશભરના નાગરિક સમાજ સમૂહો, કાર્યકર્તાઓ અને વ્યક્તિગત માહિતીના અધિકાર ઉપર પોતાના વાર્તાલાપ અને વકાલત કરવા માટે પણ મંચ પૂરો પાડે છે. ઈમેલ : [ncprimailinglist@yahooogroups.com](mailto:ncprimailinglist@yahooogroups.com)  
વેબસાઈટ : <http://righttoinformation.info>
- **ઇન્ડિયા રાઇટ ટુ ઇન્ડિઝેન્શન બ્લોગસ્પોટ**  
દેશભરમાં માહિતીના અધિકાર ઉપર થતી છેલ્લામાં છેલ્લી ચર્ચાઓ, સમાચારો અને માહિતી એકઠી કરતું ઓન લાઈન બ્લોગ.  
વેબ સાઈટ : <http://www.indiarti.blogspot.com>
- **પરિવર્તન (ન્યુ ઇંહી)**  
દિનહીમાં માહિતીના અધિકાર માટે કાર્યરત નાગરિકોનું એક આગળ પડતું જૂથ કે જે દિનહી સરકાર પાસેથી માહિતી ઉપલબ્ધ કરવામાં તેમને પડતી મુશ્કેલીઓનો નિયમિત અહેવાલ આપે છે અને માહિતીના અધિકારનો સફળતાપૂર્વક ઉપયોગ કરે છે.  
વેબ સાઈટ : <http://www.parivartan.com>
- **હમ જાનેંગે (ઓન લાઈન વાર્તાલાપ નિગમ, મહારાષ્ટ્ર)**  
એક એવું ઓનલાઈન વાર્તાલાપ નિગમ છે કે જે ભારતમાં માહિતીના અધિકારનો ઉપયોગ અને અમલ ઉપર દેખરેખ રાજે છે અને જે આ અધિકાર સંબંધિત મુદ્દાઓ / તકલીફો તથા સફળતાઓમાં ભાગીદારી કરવા એક મંચ પુરો પાડે છે. ‘હમ જાનેં ગે’ ની નેટવર્કાર્ગી મુખ્ય રીત તેની ચાદીમાં ઉમેશે કરવાનું છે. જેમાં જાહેર જગતામાંથી કોઈપણ પોતાનું નામ નોંધાવી તેમાં સામેલ થઈ શકે છે. ઈમેલ : [humjanenge@yahooogroups.co.in](mailto:humjanenge@yahooogroups.co.in)
- **ક્રિયા કાટે (KRIA Katte) (ઓન લાઈન વાર્તાલાપ નિગમ, કર્ણાટક)**  
કર્ણાટકમાં માહિતીના અધિકારભાં રુચિ રાખવાવાળા બધા સમૂહો અને વ્યક્તિગત માટે મળવાનું, અનુભવોની આપ-લે કરવાનું અને માહિતીના અધિકાર વિશે જાગૃતિનો પ્રસાર કરવા વાતું એક ઓન લાઈન નિગમ. આ જૂથ કર્ણાટક અને આખા દેશમાં માહિતીના અધિકાર અધિનિયમના અમલીકરણની નજીકથી દેખરેખ રાજે છે. ઈમેલ : [kria@yahooogroups.com](mailto:kria@yahooogroups.com)  
વેબ સાઈટ : <http://groups.yahoo.com/group/kria>





# સીએચઆરઆઈ ના કાર્યક્રમો

સીએચઆરઆઈનું કાર્ય એ માન્યતા પર આધાર રાખે છે કે માનવ અધિકાર અસરકારક લોકશાહી અને વિકાસ લોકોના જીવનમાં ત્યારે વાસ્તવિક બનશે જ્યારે રાજ્યમંડળ અને તેના સભ્યદેશો જવાબદેહિતા અને ભાગીદારીના ઉચ્ચ માપદંડો અને કાર્યરીતિ અપનાવશે. આ ઉપરાંત સીએચઆરઆઈન્યાય સુધીની પહોંચ અને માહિતી સુધીની પહોંચના મુદ્દામાં પણ કામ કરે છે. આ કાર્યથી સંશોધનો, પ્રકાશનો, કાર્યક્રમાણ અને માહિતી વિતરણ જેવા માધ્યમો દ્વારા કરે છે.

## માનવ અધિકાર હિમાયત :

સીએચઆરઆઈ રાજ્યમંડળના સરકારી સંગઠનો અને સભ્ય દેશોને બિયમિત રિપોર્ટ રજૂ કરે છે. જરૂરિયાત મુજબ ઈ.સ. ૧૮૮૮પથી સીએચઆરઆઈ એ નાઈજરીયા, ઝામ્પા, ફિઝ, આઇલેન્ડ અને સિએરાલિઓનમાં ફક્ત ફાઇઝીંગના મિશન મોકલ્યા છે. સીએચઆરઆઈ રાજ્યમંડળ નેટવર્કનું પણ સંકલન કરે છે. જે વિવિધ પ્રકારના સંગઠનોને એક જૂથમાં લાવીને તેમની સંગઠન શક્તિને માનવ અધિકારની હિમાયત માટે તૈયાર કરે છે. સીએચઆરઆઈનું મીડિયા ચુનિટ પણ એ બાબતોનું દ્વારા રાખે છે કે માનવ અધિકારના મુદ્દાઓ લોકોના દ્વારાનમાં રહે.

## માહિતી સુધીની પહોંચ :

### માહિતી(મેળવવાના)નો અધિકાર

સીએચઆરઆઈ નાગરિક સમાજો અને સરકારને માહિતીના અધિકાર અંગે પગલાં લેવા પ્રેરિત કરે છે તેમજ સહયોગીઓને કાયદાના અસરકારક અમલમાં મદદ કરે છે. સીએચઆરઆઈ સ્થાનિક જૂથોની અધિકારીઓ સાથે મળીને, સરકાર અને નાગરિક જૂથોની આ કાયદા માટે કાર્યક્ષમતા વધારવામાં તેમજ નીતિ બનાવનાર સાથે વકાલત કરે છે. સીએચઆરઆઈ દક્ષિણ એશિયામાં પણ કાર્યરત છે. તાજેતરમાં આ સફળ જુંબેશને સહયોગ આપીને રાજ્યીય કાયદો ઘડવામાં મદદરૂપ બન્યું છે. આફિકામાં પણ આ કાયદો ઘડવામાં કાયદાકીય સહયોગ આપે છે. પેસિફિકમાં સીએચઆરઆઈ સ્થાનિક અને રાજ્યીય સંસ્થાઓને આવા કાયદા બનાવવા માટે પ્રેરે છે.

### સંવિધાનવાદ :

સીએચઆરઆઈનું માનવું છે કે બંધારણના નિર્માણ અને તેની સમીક્ષણ વધુમાં વધુ લોકોના અભિપ્રાયો લેવા જોઈએ. સીએચઆરઆઈ લોક શિક્ષણ દ્વારા બંધારણીય હકોનો પ્રચાર કરે છે. તેમણે રાજ્યમંડળ સંસદીય સમિતિ માટે વેબ-આધારિત (Web-based) માનવ અધિકાર મોડયુલ બનાવ્યું છે. ચૂંટણી પહેલાં સીએચઆરઆઈએ ચૂંટણીની દેખરેખ કરવા નાગરિક જૂથોનું નેટવર્ક બનાવ્યું છે. જે ગુનામાં સંડોવાયેલા હોય તેવા ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા રહેવા સામે વાંધો ઉદાહેર કરે છે અને મતદાતાઓનું સિક્ષણ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓના કાર્યની દેખરેખ રાખે છે.

## ન્યાય સુધીની પહોંચ :

### પોલીસ સુધાર :

અનેક દેશોમાં પોલીસને નાગરિકોના હિતોના રક્ષણને બદલે સરકારના દમનકારી સાધન તરીકે જોવામાં આવે છે. આનાથી માનવ અધિકારોનું ઉલ્લંઘન અને અન્યાયને ઉતેજન મળે છે. સીએચઆરઆઈ સાર્વત્રિક સુધારની હિમાયત કરે છે, જેથી પોલીસ ન્યાયના રક્ષણીય ભૂમિકા બજાવે નહીં કે, સરકારના દમનકારી એજન્ટની ભૂમિકા ભારતમાં સીએચઆરઆઈનું કામ પોલીસ સુધારા માટે લોક સમર્થીની ઉભ્ય કરવાનું છે. પૂર્વ આફિકા અને ઘાનામાં સીએચઆરઆઈપોલીસની જવાબદેહિતા અને રાજ્યનૈતિક દખલના મુદ્દાઓ પર કામ કરે છે.

### જેલ સુધાર :

જેલના બંધ વાતાવરણના કારણે, ત્યાં માનવ અધિકારોના ઉલ્લંઘનની પ્રબળ આશંકા રહે છે. સીએચઆરઆઈનો હેતુ જેલના વાતાવરણને લોકોની તપાસ માટે ખુલ્લું બનાવવાનો છે.

### ન્યાયિક વિષયો ઉપર સંવાદ :

ઇન્ટરાર્ટિસ સાથે મેળવીને સીએચઆરઆઈએ દક્ષિણ એશિયાના ન્યાયાધીશો સાથે વંચિત સમુદાયોની ન્યાય સુધીની પહોંચના મુદ્દે અનેક કાર્યક્રમાણો કરી છે.

માહિતીનો અધિકાર એ એક શક્તિશાળી સાધન છે, જે તમને સરકાર અને તેના અધિકારીઓની કાર્યપદ્ધતિ બદલવા માટે તક આપે છે. સરકાર પાસેથી માહિતી માંગી, તમે ખરેખર તેની પાસે માંગ કરો છો કે તે તમારા પ્રત્યે પારદર્શક અને જવાબાદર બને. હવે આ શક્તિશાળી સાધન તમારા હાથમાં છે.

## બાજુ ઉપર બેસીના રહો... તેમાં સામેલ થાઓ અને આજે જ માહિતીના અધિકારનો ઉપયોગ કરો

આ વેબસાઈટ (<http://www.humanrightsinitiative.org/programs/ai/rti/india/national.htm>) નો રાષ્ટ્રીય વિભાગ તમને ભારતમાં માહિતીના અધિકાર અભિયાન અંગે વિસ્તૃત પાર્શ્વભૂમિ, કામગીરીની વિગતો અને વકાલત, સરકાર અને નાગરિક સમાજના સંશાધનો અને રાષ્ટ્રીય સ્તરે કાર્યરત વિવિધ સંસ્થાઓના સંપર્કની વિગતો પૂરી પાડે છે.

૨૮ રાજ્યોમાં અને ૭ કેન્દ્ર શાસ્ત્રિય પ્રદેશોના અલગ વેબ પેજ માટે મહેરબાની કરીને વેબસાઈટ <http://www.humanrightsinitiative.org/programs/ai/rti/india/states/default.htm> ઉપર લોગ ઓન કરો. જ્યાં તમે દરેક રાજ્ય સરકારના માહિતીના અધિકાર અધિનિયમ સંબંધિત નિયમો, અમલ માટે રાજ્યોએ કરેલ અધતન પ્રચાસોની માહિતી અને માહિતીના અધિકાર માટે કાર્યરત સંસ્થાઓની સંપર્ક વિગતો મેળવી શકો છો.



## કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિએટિવ

૬, નંદિગામ એપાર્ટમેન્ટ, પર/૧, અરણોદય સોસાયટી, અલકાપુરી,  
વડોદરા. - ૩૯૦ ૦૦૫. ફોન: ૦૨૬૫ - ૨૩૨૨૭૮૮

બી - ૧૧૭, સર્વોદય એન્કલેવ, ૧ લો માળ, જવી દિલ્હી - ૧૧૦ ૦૧૭.

ફોન: +૯૧-૦૧૧-૨૬૮૫૦૫૨૩, ૨૬૮૬૪૬૭૮,

ફેક્સ: +૯૧-૦૧૧-૨૬૮૬૪૬૮૮

E-mail : [chriall@nda.vsnl.net.in](mailto:chriall@nda.vsnl.net.in)

Website : [www.humanrightsinitiative.org](http://www.humanrightsinitiative.org)